તિર્થસ્નાન તથા કર્મકાંડની વિધી સાથે

શ્રી ભારભૂતેશ્વર તીર્થનું

માહા



ॐ

અનુવાદક તથા સંશોધક.

પુરાણી રામચંદ્ર ઈચ્છારામ વ્યાસ.

મુ. પો. અંકલેશ્વર.

પ્રકાશક.

મહારાજશ્રી ગોસ્વામીજી લક્ષ્મણપુરીજી

ગુરૂશ્રી શંકરપુરીજી.

શ્રી ભારભૂતેશ્વર મહાદેવના સ્થાનના માલીક.

સંવત ૧૯૮૭] મુ. પો. ભારભૂત. ડી ભરૂચ.

સને ૧૯૩૧] પ્રત ૧૦૦૦] કીંમત ૦-૬-૦


શ્રી સૌરાષ્ટ્ર પ્રિન્ટીંગ પ્રેસ ભાવનગરમાં પટેલ મગનભાઈ

કુબેરભાઈએ માલીકને માટે છાપ્યું. તા. ૨૭-૩-૩૧

તિર્થસ્નાન તથા કર્મકાંડની વિધી સાથે

શ્રી ભારભૂતેશ્વર તીર્થનું

માહાત્મ્ય



અનુવાદક તથા સંશોધક.

પુરાણી રામચંદ્ર ઇચ્છારામ વ્યાસ.

મુ. પો. અમલેશ્વર. ડી. ભરૂચ.

પ્રકાશક.

મહારાજશ્રી ગોસ્વામીજી લક્ષ્મણપુરીજી

ગુરૂશ્રી શંકરપુરીજી.

શ્રી ભારભૂતેશ્વર મહાદેવના સ્થાનના માલીક.

મુ. પો. ભારભૂત. ડી ભરૂચ.

સંવત ૧૯૯૭ | પ્રત ૧૦૦૦ સને ૧૯૪૧.

શ્રી બોરસદ પ્રિન્ટીંગ પ્રેસ બોરસદમાં પટેલ મનોરભાઈ
ફુલાભાઈએ માલીકને માટે છાપ્યું. તા. ૨૭-૩-૪૧

૨૨૯૦૩

॥ ॐ नमःशिवाय ॥

॥ अर्पण पत्रिका ॥

॥ जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ ॥

આ જગતનું કલ્યાણ કરનાર તેમજ માતા
પિતારૂપી શ્રી ભગવાન મહાદેવ તથા જગદંબા
પાર્વતીજીના ચરણકમલમાં આ તેમના
ગુણાનુવાદ રૂપી શ્રી ભારભૂતેશ્વર
માહાત્મ્ય નામનો આ ગ્રંથ મારા
ઈહલૌકીક અને પારલૌકીક
કલ્યાણ થવા માટે
અર્પણ
કરૂં
છું.

॥ तत्सत् ईश्वरार्पण मस्तु ॥

સંવત ૧૯૯૭ ના ચૈત્ર શુકલ પૂર્ણિમા

લી. ભવંતો કૃપાકાંક્ષી સેવક,
પુરાણી રામચંદ્ર ઇચ્છારામ વ્યાસ
અમલેશ્વરવાળા.



આરંભક ગાદીના.

મહંતશ્રી લક્ષ્મણપુરીજી ગુરુ ચંદનપુરીજી.

પ્રસ્તાવના.

પ્રિય, સુજ્ઞ વાંચકવર્ગ! અત્યારે અધર્માભિભૂત ઘોર કળીયુગ હળાહળ વ્યાપી રહ્યો છે. એટલે તેમાં આ ધર્મ જેવી વસ્તુને પ્રકાશમાં લાવવી એ આજના સુધારાવાળા જમાનામાં કદાચ કોઈ નાસ્તીક માણસો આશ્ચર્ય ઉપજાવશે, પણ તેમને ખબર નથી કે, આ દુર્લભ એવો મનુષ્યદેહ આપણને ઇશ્વરે કેમ આપ્યો છે અને તે મેળવીને આપણે આ સંસારમાં શું પ્રાપ્ત કરવાનું છે, તે અહીં જાણવાની જરૂર છે કે મનુષ્યે જન્મ લઇ આપણે જે કરવા માત્રથી આ લોક અને પરલોકમાં કલ્યાણ થાય એવી ચાર વસ્તુ સાધ્ય કરવાની છે તેમાં, ૧ ધર્મ, ૨ અર્થ, ૩ કામ, ૪ મોક્ષ. હવે પહેલો ધર્મ એટલે શું તે આપણે વિચાર કરીએ. ધર્મ એટલે મનુષ્યની ફરજ. હવે મનુષ્યે શું ફરજ અદા કરવાની છે કે, તેનામા સારાસારનું જ્ઞાન પ્રાપ્ત કરી શાસ્ત્રદ્વારા લખેલો જે ધર્મ તેનું હંમેશાં આચરણ કરવું. હવે ધર્માચરણ કરવાનું સાધન શરીરથી શું બની શકે એમ છે તેનો વિચાર કરીએ કે, ધર્મનાં દસ લક્ષણ છે. તેમાં ૧ સત્ય, ૨ પવિત્રતા, ૩ તપ, ૪ ઇન્દ્રિયનિગ્રહ, ૫ ક્ષમા, ૬ દાન, ૭ દયા, ૮ દેવ તીર્થ બ્રાહ્મણો ઉપર શ્રદ્ધા, ૯ અહિંસા, ૧૦ પરનિંદારહિત થવું તે. ઉપર પ્રમાણેનાં લક્ષણો જેનામાં હોય છે, તે મનુષ્ય ધાર્મિક ગણાય છે. તો હવે આપણે વિચાર કરવો જોઇએ કે ઉપર કહેલા દસ લક્ષણોવાળો ધર્મ જેટલો બને તેટલો

પાળવો જોઇએ તો તેમાં ૮ મું અંગ જે ધર્મનું તિર્થયાત્રા નામનું કહેલું છે, અને તે આપણા ભારતવર્ષમાં અનાદિ કાળથી પ્રચલીત છે, અને વર્તમાનમાં ચાલુ પણ છે, કે જે તીર્થોમાં જવાથી આપણે ત્યાં જઇ (રાજા દાને અને પ્રજા સ્નાને) એ કહેવત મુજબ સ્નાન, દાન કરી આ શરીરને પવિત્ર બનાવવું જોઇએ. હવે ભારતવર્ષને કર્મભુમિ કહેલી છે અને તેને માટે તમે જેટલાં પવિત્રપણે સત્કર્મ જે સ્થાનમાં આચરણ કરો તેનું પુણ્યફળ નાશ પામ્યા સિવાય તમારે માટે ઉચ્ચપદની પ્રાપ્તિ કરાવે છે અને તેવાં પવિત્ર સ્થાનો ભારતવર્ષમાં ઘણાં છે. જેવાં કે ઉત્તરગંગા ભગવતી ભાગીરથીના કીનારા ઉપર (કાશી) બનારસ, ગયાજી, પ્રયાગરાજ, મથુરાં, અયોધ્યા વિગેરે પ્રખ્યાત છે. તેવીજ રીતે આપણા ભારતવર્ષમાં શ્રી રૂદ્રદેહા ભગવતી શ્રી નર્મદાજી દક્ષિણગંગા તરીકે પ્રખ્યાત છે અને તેના કિનારા ઉપર પણ અનેક તિર્થો આપણને પવિત્ર બનાવી આપણા સત્કર્મના પ્રભાવવડે આ લોકમાં ભોગ, ઐશ્વર્ય, સુખ, સમૃદ્ધિ આપી પરલોકમાં મોક્ષ પ્રાપ્તિના સાધનરૂપ છે. જેવાં કે-ૐકારેશ્વર, શૂલપાનીશ્વર (નર્મદા ઓરીસંગમ) ચાંદોદ કરનાળી (ભૃગુકચ્છ) ભરૂચ ભાલોદ, કોરલ, શીનોર વીગેરે છે. તેમાંનુ આ એક તિર્થ નર્મદાજીના ઉત્તર કીનારા ઉપર ભરૂચથી ૧૦ માઇલને છેટે શ્રી ભારભૂતિશ્વર નામનું આવેલું છે કે જે તિર્થમાં જઇ સ્નાન, દાન કરવા માત્રથી મનુષ્યની શી ગતિ થાય છે, તેનું માહાત્મ્ય આ ગ્રંથમાં વર્ણવેલું છે. અને તે જ્યારે પૂર્વસંચીત પ્રારબ્ધકર્મ અનેક જન્મનાં હોય છે, ત્યારેજ મનુષ્યથી

આવાં પાપથી મુક્ત થવાય એવા તિર્થ પ્રત્યે જવાની ઇચ્છા થાય છે, અને તેનો લાભ લેવાય છે, જ્યારે બીજા કેટલાંક ધાર્મિક ક્રીયા કર્મોમાં દ્રવ્યની જરૂર છે અને અહીં તો પોતાની શારીરિક શક્તિનો ઉપયોગ તેમજ દ્રવ્યનો ઉપયોગ પણ પોતાની શક્તિ પ્રમાણે શાસ્ત્ર તો કરવાનું કહે છે તો ફરીથી આપણે વિચાર કરવો જોઇએ કે અનાયાસે જો આપણને સ્નાન, પૂજન, દર્શન વિગેરેથી આવો લાભ મળતો હોય તો આપણે શા માટે ન લેવો, જરૂર લેવો જોઇએ. માટે મારે તો આપ સૌ ધાર્મિક ભાઈ બેનોને કહેવાનું એટલુંજ છે કે તમારા દેહના કલ્યાણ કરવાના સાધનરૂપ આ તીર્થ ઉપર લખેલી જગ્યા ઉપર રહેલું છે જે તે તીર્થમાં દર વરસમાં બે વખત યાત્રા ભરાય છે. ૧ કાર્તિક સુદી પૂર્ણિમા ઉપર તથા બીજી ચૈત્ર સુદી પૂર્ણિમા ઉપર તેમજ દર અઢાર વરસે એક મોટી યાત્રા અધિક ભાદરવો માસ આવે છે ત્યારે એક મહીના સુધી ભરાય છે જેમાં લક્ષાવધી માણસોની સંખ્યા આવે છે અને તેનો લાભ લે છે તો જરૂર દેહનું સાર્થક કરવા માટે .જીંદગીમાં એક સમયે પધારી આ તિર્થનો લાભ લેશો તો આ મેં લખેલા ગ્રંથની સાર્થકતા થએલી છે એમ હું માનીશ. વળી નર્મદાજીના સ્નાન માટેની ઉત્તમતા માટે સાક્ષાત સપ્તકલ્પાયુષી નર્મદાજીએ પોતાના સમકાલીન મુનિશ્રી માર્કંડેયજીને કહેલું કે ॥ मज्जयन्ति मुनयः सर्वे । त्वमेकं न मज्जसि ॥ હે માર્કંડેય આ બધા મુનિઓ મહાન ભક્તિભાવથી દુરથી મારા કીનારા ઉપર આવી શ્રદ્ધાવડે તિર્થ સ્નાન કરવા આવે છે ને તું તો સ્નાન કરવા આવે છે ને તું તો સ્નાન કરતો નથી.

ત્યારે માર્કંડેય મુનિયેં શ્રી નર્મદા દેવીને કહ્યું કે ॥ **मुक्तिस्ता-दर्शनाद्देवी । नजाने स्नानजं फलम्** ॥ હે દેવી હું તો એમ માનું છું કે મનુષ્યને તમારા દર્શન માત્રથી દેવને પણ દુર્લભ એવા મોક્ષની પ્રાપ્તિ થાય છે તો કદાચ આપના જળમાં સ્નાન કરવાથી શું ફળ મળતું હશે તે તો હું જાણતોજ નથી. માટે આ કરતાં શ્રેષ્ટ બીજું કાંઈ નથી એમ માની જરૂર દરેક મનુષ્યે તન, મન, ધનથી આ તીર્થસ્નાનનો લાભ લેવો. એજ અભ્યર્થના

લી.

પુરાણી રામચંદ્ર ઇચ્છારામ અમલેશ્વરવાળા.

સ્થાન પરિચય તથા સ્નાનની સિદ્ધી.

:(૦):

પ્રિય વાંચકવર્ગ ! એક સમય એવો હતો કે આપણા ભારતવર્ષમાં ધર્મની રેલમછેલ થઇ રહી હતી. પરંતુ જગન્નિયંતા પરમેશ્વરે ઉદયાસ્તનો ક્રમ અનાદિકાળથી દરેકને માટે મુકેલો હોય છે. પરંતુ એ તો ત્રીકાલાબાધ્ય વસ્તુ હોવાથી જ્યારે આપણે જોઇશું ત્યારે જેને તે સ્થિતિમાં આપણને માલુમ પડશે, તો હવે આપણે વિચાર કરીએ કે, જ્યારે ૧૨૦૦ થી ૧૩૦૦ ના સૈકામાં મુસલમાનોનું સામ્રાજ્ય આપણા ભારતવર્ષમાં પ્રવર્તેલું હતું અને તેની પ્રાબલ્યતાને લીધે કેટલાએક ધાર્મિક દેવાલયો તથા જગ્યાઓ તે લોકોએ


નાશ કરી દીધેલાં અસ્તવ્યસ્ત સ્થિતિમાં માલુમ પડતાં હતાં, ત્યારે આ સ્થાન પણ યવનોએ અસ્તવ્યસ્ત સ્થિતિમાં કરી શ્રી ભગવાન ભારભૂતેશ્વરનું સ્વયંસિદ્ધ જે લીંગ સ્વરૂપ હતું તે જ્યાં ત્યાં ઉખેડી નાખેલું હતું. એ એનો અસ્તકાળ હતો પણ એ જગન્નિયંતા પરમેશ્વરની લીલાજ હતી એટલે એ અસ્ત આપણા જોવામાં આવતો હતો પણ એતો પોતે જાગ્રત સ્થિતિમાં હતા. એટલે એમને તો એ સ્થળ ઇચ્છા કરે તેટલીજ વાર હતી. એટલે જ્યારે ઇચ્છા થઇ ત્યારે તેમણે પોતાના ચમત્કાર તરીકે તિર્થનો તેમજ પોતાનો પ્રભાવ દેખાડવા માટે સુરતના એક સોની વેલજીને બે સ્રીઓ હતી. પણ પોતાને કાંઇ સંતાન નહિ, તેમજ લક્ષ્મી પણ પુષ્કળ એટલે ધર્મ પણ ઘણીજ શ્રદ્ધાથી પુત્ર પ્રાપ્તિને માટે કર્યા કરતો હતો, તેને ધાર્મીક તથા શ્રદ્ધાળુ તેમજ પોતાનો પરમભક્ત જાણી પરમકૃપાળુ પરમેશ્વર શ્રી મહાદેવે સ્વપ્નુ આપ્યું કે તું મારૂં દેવાલય યવનોએ નાશ કરેલું છે તે ફરીથી બંધાવ અને મારી લીંગરૂપી મૂર્તિ જે અસ્તવ્યસ્ત સ્થિતીમાં છે તેની સ્થાપના તેમાં કર તો જરૂર હું તને પુત્ર આપીશ ત્યારે આ સ્વપ્નાની વાત ઉપરથી તે સોનીએ નર્મદાજીના ઉત્તર કીનારા ઉપર ભરૂચથી સાત ગાઉ ઉપર ભારભુતેશ્વર નામના સ્થાનમાં આવી અને અત્યારે જે દેવાલય છે તે તેણે સં. ૧૯૫૭ શાકે ૧૬૨૩ ની ઉત્તરાયણના સૂર્યમાં વસંતઋતુ હતી ફાગણ માસ હતો તેમાં શુકલપક્ષની ૫ ને દીવસે શ્રી ભગવાન મહાદેવ ભારભુતેશ્વરના દેવાલયમાં મહાદેવના લીંગની નૂતન પ્રતિષ્ઠા કરી જે અદ્યાપી વિદ્યમાન

છે. ને તેના પુજારી તરીકે ત્યારથી તે જગ્યામાં આજે ૧૫૦ વરસથી પુજા કરતા આવેલા ગોસ્વામીજી મહારાજશ્રી સુંદરપુરીજી તેમના શિષ્ય મહારાજશ્રી રણજીતપુરીજી તેમના શિષ્ય મહારાજશ્રી ભગવાનપુરીજી તેમના શિષ્ય મહારાજશ્રી શંકરપુરીજી તેમના શિષ્ય હાલ ગાદી ઉપર બીરાજતા મહારાજશ્રી લક્ષ્મણપુરીજી જેવા સમર્થ પુરૂષો આ જગ્યાને ચલાવી રહ્યા છે. તો દરેક મનુષ્યે બને ત્યાં સુધી ત્યાં જવું અને તિર્થસ્નાન તથા જગ્યા ઘણી રમણીય હોવાથી એક રાત્રી નિવાસ કરી મહારાજશ્રીના તરફથી જ્ઞાનપિપાસુએ જ્ઞાનનો લાભ લેવો.

લી. ભવદીય કૃપાકાંક્ષી

પુરાણી રામચંદ્ર ઇચ્છારામ.

અમલેશ્વરવાળા.



૧	શ્રી ભારભૂતેશ્વર	૬	રામ લક્ષ્મણ જાનકીજીનું મંદિર
૨	શ્રી નર્મદાજીનું મંદિર	૭	નર્મદા પરિક્રમાવાસીઓને ઉતરવાની ધર્મશાળા.
૩	પુજારીને રહેવાનું સ્થાન	૮	ગૌશાળા
૪	અંબાજીનું મંદિર	૯	ગુરૂ દત્તાત્રય મંદિર
૫	શ્રી સત્યનારાયણ મંદિર	૧૦	સૂર્યનારાયણનું મંદિર

(સારસ્વત પ્રેસ)

॥ ॐ ॥

॥ अथ तीर्थस्नान ॥

શ્રી અરૂણોદય સમયે પથારીમાંથી ઉઠી સર્વ દેવને નમસ્કાર કરી વિષ્ણુત્ત્રોત્સર્ગ તથા દંતધાવન વગેરે ક્રિયાઓ આટોપી લઈ શ્રી ભારભૂતેશ્વર તિર્થમાં સ્નાન કરવા માટે જોઇતું સાહિત્ય લઈ શ્રી નર્મદાજીના કિનારા ઉપર જવું. સ્નાનમાં ઉપયોગી એવી સુંદર માટી, ગાયનું છાણ, મુત્ર, દુધ, દહીં, ઘી, જવ, તલ, સોપારી, તુલસી, દર્ભ, પુષ્પ, હીરણ્યભસ્મ, પવિત્ર વસ્ત્ર, પંચપાત્ર, આચમની, તરભાણી, વિગેરે લઇ તટ ઉપર જઇ સ્નાનને માટે તીર્થની પ્રાર્થના નીચેના લખેલા મંત્રોથી કરવી

तीर्थ प्राथना

नमामि गंगे तव पादपंकजं । सुरासुरै र्वंदित दिव्यरुपम् ॥
भक्तिं च मुक्तिं च ददासि नित्यं । भावानुसारेण यथा नराणां ॥१॥

या गति र्योगयुक्तानां । मुनिना मूर्ध्वरेतसाम ॥
सा गतिः सर्व जंतुनां । नर्मदातीरवासिनाम् ॥२॥

पुष्कराद्यानि तिर्थानि । गंगाद्या सरितस्तथा ॥
आगच्छंतु पवित्राणि । स्नानकाले सदा मम ॥३॥

त्वं राजा सर्वतीर्थानां । त्वमेव जगतः पिता ॥
याचितं देहि मे तीर्थं । सर्वपापैः प्रमुच्यते ॥४॥

अपामधिपतिस्त्वंहि । तिर्थेषु वसति स्तव ॥
वरूणाय नमस्तुभ्यं । स्नानानुज्ञां प्रयच्छ मे ॥५॥

अधिष्ठातृश्च तीर्थानां । तीर्थेषु विचरन्ति याः ॥
देवतास्ताः प्रयच्छंतु । स्नानाज्ञां मम सर्वदा ॥६॥
गंगे च यमुनेचैव । गोदावरि सरस्वति ॥
नर्मदा सिंधु कावेरी । जलेऽस्मिन्सन्निधिंकुरू ॥७॥

ઉપર લખ્યા પ્રમાણે તીર્થની પ્રાર્થના કરી પાણી વડે હાથ, પગ, મુખ વગેરે ધોઈ આચમન ત્રણ કરવાં. પછી જમણા હાથમાં પાણી લઈ સ્નાન સંકલ્પ કરવો.

॥ स्नान संकल्प ॥

विष्णुः विष्णु विष्णुः श्रीमद् भगवतो महापुरूषस्या विष्णु राज्ञया प्रवर्तमानस्य अद्य श्रीब्रह्मणः द्वितिये ॥ परार्धे श्रीविष्णु-पदे श्रीश्वेतवाराहकल्पे वैवस्वत ॥ मन्वंतरे अष्टाविंशति तमे कलियुगे तत्र कलि प्रथम चरणे बौद्धावतारे अस्मिन वर्तमाने अमुक नाम संवत्सरे अमुकायने अमुक ऋतौ ॥ अमुक मासे अमुक पक्षे अमुक तिथौ अमुक वासरे अमुक नक्षत्रे अमुक योगे अमुक करणे अमुक राशीस्थिते चंद्रे अमुक राशीस्थिते श्री सूर्य अमुकराशीस्थीते श्रीदेवगुरौ शेषेषु ग्रहेषु यथा यथा राशीस्थान स्थितेषु सत्सु एवं ग्रहगण विशेषेणा विशिष्टायां शुभ पुन्ये तीथे मम आत्मनः श्रुति स्मृति पुराणोक्त पुन्य फल प्राप्त्यर्थे इहजन्मनी जन्मांतरे वा कायिक वाचिक मानसिक ॥ सांसर्गिक ज्ञाता ज्ञाता स्पर्शास्पर्श भुक्ताभुक्त पितादि मातादि सकल पातक निरसन ॥ पूर्वक आसन भोजन शयन गमन अनृत भाषण आदि दोष निरासानार्थं श्री चतुर्विध पुरुषार्थे सिद्धयर्थे श्री अक्षय्य-लोक प्राप्तिका मोह श्रीभारभूतेश्वर तिर्थे समस्त तीर्थानां स्नानसंपूर्ण फलप्राप्तये तिर्थस्नानं करिष्ये ॥

આ પ્રમાણે સંકલ્પ કરી પાણી મુકી દેવું પછીથી નીચેના લખેલા મંત્રોથી દશ વિધિ સ્નાન કરવું

॥ दशविधि स्नानमंत्राः ॥

(१) ॥ प्रथम भस्म स्नान ॥ પહેલી ભસ્મ હાથમાં લઇ
પાણી મેળવી નીચેના મંત્રથી માથાથી પગ સુધી બધા શરીરે ચોળવી

यथाग्नि दहने भस्म । तृणकाष्टादि संचयम् ॥
तथा मे दहतां पापं कुरू भस्म शुचे शुचिम् ॥ १ ॥

(२) ॥ मृतिका स्नानम् ॥ પછી માટી લઇ તેને પણ ઉપર પ્રમાણે ચોળવી

अश्वक्रान्ते रथक्रान्ते । विष्णुक्रान्ते वसुंधरे ॥
उध्धृतासि वराहेण । कृष्णेना शतबाहुना ॥ २ ॥
मृत्तिके हर मे पापं । यन्मया दुष्कृतम् ॥
मृत्तिके ब्रह्मदत्तासी । काश्यपे नाभिमंत्रिता ॥३॥
मृत्तिके देहि मे पुष्टिं । त्वयि सर्वं प्रतिष्ठितम्
इति स्नानम् ॥

(३) ॥ गोमयस्नानं ॥ પછીથી ગાયનું છાંણ લઇ ઉપર પ્રમાણે ચોળવું.

गोमये वसते लक्ष्मीः । पवित्रं सर्वमंगलम ॥
स्नानार्थं संस्कृतं देवं । पापं मे हर गोमय ॥१॥
अग्रमम चरंतीनां । औषधिनां वने वने ॥
तासां वृषभपत्निनां । पवित्रं पापशोधनम् ॥२॥
यन्मे रोगांश्च शोकंच । तन्मे दहतु गोमय ॥
इति गोमय स्नानम् ।

(૪) ॥ पंचगव्यस्नानं ॥ ગાયનું મુત્ર, દુધ, દહી, ઘી વગેરે લઈને એકત્ર કરી માથાથી પગના તળીઆ સુધી બધા સુધી બધા શરીરે ચોળવું.

गोमुत्रं गोमयंक्षीरं । दधि सर्पिः कुशोदकम् ॥
सर्वपापविशुद्धार्थं । पंचगव्यं पुनातु माम् ॥१॥
इति पंचगव्यस्नानम् ॥

(૫) गोरज स्नानम ॥ગાયની ખરીની ધુળ લઈને ઉપર પ્રમાણે પાણી મેળવી નીચેના મંત્રોથી ચોળવી

गवांक्षुरेण निर्धुतं । यद्रेणु गगने गतम् ॥
शरीरे तेन संलिप्तं महापातकनाशनम् ॥
इति गोरजस्नानम् ॥

(૬) धान्यस्नानम् ॥ પછી જવ, તલ લઈ પાણીમાં મેળવી નીચેના મંત્રોથી શરીરે ચોળવા.

धान्यौषधिमनुष्याणां । जीवनं परमस्मृतम ॥
तेन स्नाने ह देव । मम पापं व्यपोहतु ॥१॥
इति धान्यस्नानम ॥

(૭) फलस्नानम् ॥ પછીથી સોપારીને પાણીથી ધોઈ તે પાણી નીચેના મંત્રોથી બધા શરીરે ચોળવું.

वनस्पति रसोद्भिव्यः । फलं पुष्पं घृतं सदाः ॥
तेन स्नानेन मे देव । फलं पुण्यमनन्तकम ॥१॥
इति फलस्नानम् ॥

(૮) सर्वौषधिस्नानम ॥ પછી પુષ્પને પાણી સાથે મેળવી નીચેના મંત્રથી શરીરે ચોળવાં દરો વગેરે મળે તે પણ લેવી.

ओषधिः सर्ववृक्षाणां तृण गुल्म लता स्तुयाः ॥
दुर्वा सर्षव संयुक्ता. । सर्वौषध्यः पुनातु माम् ॥१॥
इति सर्वौषधिस्नानम ॥

(૯) ॥ हिरण्यस्नानम् ॥ પછીથી સોનું અથવા રૂપુ અગર ત્રાંબાનાણું લઇ તેને પાણીમાં ધોઇને તે પાણી માથાથી પગ સુધી નીચેના મંત્રથી ચોળવું.

॥ हिरण्यगर्भगर्भस्थं । हेमबीजं विभावसोः ॥

अनंतपुन्यफलदमतः शांतिं प्रयच्छ मे ॥१॥

इति हिरण्यस्नानम् ।

॥ नर्मदोदकस्नानम ॥ પછીથી નર્મદાજીનું પાણી નીચેના મંત્રથી માથા ઉપર ચઢાવવું.

॥ शिवदेहसमुत्पन्ना रेवे उत्पथगामिनी ॥

धर्मद्रवेतिविख्याता । पापं मे हर नर्मदे ॥१॥

इति नर्मदोदकस्नानम् ॥

॥ पश्चात् आचमनं कृत्वा स्नानविधिना स्नानं यथा शुद्धिं कुर्यात् ॥

પછીથી આચમન કરી બરોબર શરીર ચોળીને નર્મદાજીના પાણીમાં સ્નાન કરવું પછી ત્રણ દર્ભ લઇ પાણીમાંથી અંજલી ભરી દેવ ઋષિ મનુષ્યોના નિમિત્તે નીચે લખેલા મંત્રોથી તર્પણ તથા માર્જન કરવું.

: इति स्नानविधिः ॥

॥ अथ मार्जन मंत्र ॥

॥ ॐ भूः पुनातु ॐ भुवः पुनातु ॐ स्वः पुनातु ॐ महः पुनातु ॥ ॐ जनः पुनातु ॐ तपः पुनातु ॐ सत्यं पुनातु ॐ तत्सवितुरितिगायत्री ॥ मां सर्वं पुनातु ॥

આ પ્રમાણે ત્રણ દર્ભની સળીઓથી માર્જન કરી

શરીર શુદ્ધ પવિત્ર બનાવી દર્ભની સળીઓ હાથમાં મધ્યમાં રાખી પાણીની અંજલી ભરવી પછી નીચેના મંત્રોથી તર્પણ કરવું.

॥ अथ तर्पणमंत्राः

ॐ ब्रह्माद्योदेवास्तृप्यन्ताम् । ॐ भूर्देवास्तृप्यन्ताम् ॐ भूवर्देवास्तृप्यन्ताम् ॥ ॐ स्वर्देवास्तृप्यन्ताम् ॥ ॐ भूर्भुविस्वर्देवास्तृप्यन्ताम् ॥

પછીથી કંઠમાં જનોઈ રાખી (અંજલી) નીચેના મંત્રોથી પોસની (અંજલી) મધ્યમાં (વચ્ચે) પાણી ઉતારવું.

ॐ द्वैपायनाद्यो ऋषय.स्तृप्यन्ताम् ॥ ॐ भूऋषयस्तृप्यन्ताम् ॥ ॐ स्वऋषयस्तृप्यन्ताम् ॥

પછીથી અપસવ્ય એટલે ડાબે ખભે જનોઈ હોય તે જમણી બાજુના ખભા ઉપર લાવી બેવડો દર્ભ કરી પાણીની અંજલી જમણા અંગુઠે પાણી ઉતારી નીચેના મંત્રથી ત્રણ ત્રણ અંજલી આપવી.

ॐ कव्यवाडनलादयः पितरस्तृप्यन्ताम् ।३। ॐ भूः पितरस्तृप्यन्ताम् ।३। ॐ भूवः पितरस्तृप्यन्ताम् ।३। ॐ भूवः पितरस्तृप्यन्ताम् ।३। ॐ स्वः पितरस्तृप्यन्ताम् ।३। ॐ भूर्भुवस्वः पितरस्तृप्यन्ताम् ।३।

પછીથી તલથી મિશ્રિત અંજલી ભરી શ્રી નર્મદાજીના કિનારા ઉપર નીચેના મંત્રથી પાણી આપવું.

॥ यन्मया दुषितं तोयं । शारिरमलसंभवात ॥

॥ तस्य पापस्य शुध्यर्थं । यक्षमेतत्तेतिलोदकम् ॥

પછી નીચેના લખેલા મંત્રથી અંજલીમાં પાણી લઈ શીખાને પાણી અડકાડી કિનારા ઉપર પોતાની જમણી બાજુ આપવું.

॥ लता गुल्मेषु वृक्षेषु । पितरोमे व्यवस्थिता: ॥
ते सर्वैंतृप्तिमायान्तु । मयोत्सृष्टै: शिखोदकै: ॥१॥

આ પ્રમાણે તિર્થ તર્પણ સમાપ્ત કરી પાણીથી બહાર નીકળીને શુદ્ધ ધોએલાં પવિત્ર વસ્ત્ર ધારણ કરવાં. પછીથી હાથ પગ ધોઇ આચમન કરી સંધ્યા વગેરે કર્મ કરી શ્રી ભગવાન ભારભૂતેશ્વરના પૂજનને માટે સાહિત્ય લઇ ભગવાનના મંદિરમાં જવું. ત્યાં એકાગ્ર ચિત્તથી નીચે લખેલી વિધી પ્રમાણે શ્રદ્ધા અને પોતાની શક્તિ મુજબના સાહિત્યથી ષોડશોપચાર અથવા રાજોપચાર વિધિથી ચાર પહોર તેમની પૂજા અભિષેક સાથે કરવી

॥ इति तिर्थस्नानविधि: ॥

॥ अथ पुजनमंत्राः ॥

પછીથી આસન ઉપર બેસી શ્રદ્ધા અને ભક્તિથી સાવધાન થઇ એકાગ્ર ચિત્તથી શ્રી ભગવાન મહેશ્વરના પૂજનને। નીચે પ્રમાણે આરંભ કરવો અને ત્રણ આચમન કરવાં નીચેના મંત્રોથી.

॥ आचमनमंत्रः ॥

ॐ भूः आत्मतत्वायस्वाहा: ॥१॥ ॐ भूवः विद्यातत्वायस्वाहा ॥२॥ ॐस्व: शिवतत्वायस्वाहा ॥३॥ ॐ केशवायनम: ॥१॥ ॐ नारायणायनम: ॥२॥ ॐ गोविंदायनम: ॥३॥ ॐ मधुसुदनेति हस्तं ॥प्रक्षाल्य ॥

પછીથી નીચેના મંત્રોથી શાંતિપાઠ ભણી ગણપતિનું સ્મરણ કરવું.

॥ अथ गणपतिस्मरणम् ॥

॥ सुमुखश्चैकदन्तश्च । कपिलो गजकर्णिकः ॥
॥ लंबोदरश्चविकटो । विघ्ननाशो विनायकः ॥१॥
॥ धुम्रकेतु र्गणाध्यक्षो । भालचंद्रो गजाननः ॥
॥ द्वादशैतानिनामानि य पठेत् श्रुणुयादपि ॥२॥
॥ विद्यारंभे विवाहे च । प्रवेशे निर्गमे तथा ॥
॥ संग्रामे संकटेचैव । विघ्नस्तस्य न जायते ॥३॥
॥ शुक्लांबरधरं देवं । शशिवर्णं चतुर्भुजम् ॥
॥ प्रसन्नवदनं ध्यायेत् । सर्व विघ्नोपशांतये ॥४॥
॥ लाभस्तेषां जयस्तेषां । कुतस्तेषां पराजयः ॥
॥ येषांइंदिवरश्यामो । हृदयस्थो जनार्दनः ॥५॥
॥ विनायकं गुरूं भानुं । ब्रह्माविष्णुमहेश्वरान् ॥
॥ सरस्वतीं प्रणम्यादौ । सर्वकामार्थसिद्धये ॥६॥
॥ अभिप्सितार्थसिद्ध्यर्थं । पूजीतोयःसुरासुरैः ॥
॥ सर्वविघ्नहरस्तस्मै । गणाधिपतयेनमः ॥७॥
॥ वक्रतुंड महाकाय । सूर्यकोटी समप्रभो ॥
॥ निर्विघ्नं कुरु मे देवा । सर्व कार्येषु सर्वदा ॥८॥
॥ सर्वदा सर्व कार्येषु । नास्तितेषाममंगलम् ॥
॥ येषां हृदिस्थो भगवान् । मंगलाय तनो हरः ॥९॥
॥ सर्व मंगल मांगल्ये । शिवे सर्वार्थ साधिके ॥
॥ शरण्ये त्र्यंबके गौरी । नारायणि नमोऽस्तुते ॥१०॥
॥ यत्र योगेश्वरो कृष्णो । यत्र पार्थो धनुर्धरः ॥
॥ तत्रश्री विजयो भूति । र्ध्रुवा नितिर्मितिर्मम ॥११॥
॥ सर्वेष्वारंभ कार्येषु । त्रयस्त्रि भुवनेश्वराः ॥
॥ देवा दिशन्तुनः सिद्धिं । ब्रह्मेशान जनार्दनाः ॥१२॥

—

ઉપર પ્રમાણે ધ્યાન કરી નીચેના મંત્રોથી નમસ્કાર કરવા.

ૐ લક્ષ્મી નારાયણાભ્યાં નમઃ । ૐ ઉમામહેશ્વરાભ્યાં નમઃ । ૐ શચીપુરંદરાભ્યાં નમ । ૐ વાણીહીરણ્યગર્ભાભ્યાં નમઃ । ૐ इष्टदेवताभ्यो नमः । ૐ ग्राम देवताभ्यो नम । ૐ एतत्कर्मप्रधानदेवताभ्यो नमः । ૐ श्री भगवान सांब सदाशिव श्री भारभूतेश्वराय नम ॥

ઉપર પ્રમાણે નમસ્કાર પછી આચમનીમાં જળ અને અક્ષત લઈ શ્રી ભગવાનની પૂજાનો સંકલ્પ નીચે લખેલા મંત્રોથી કરવો.

॥ प्रधान संकल्प. ॥

॥ अद्याद्य पूर्वोक्तरित्या पठनं कार्यम् ॥ एवं ग्रहगण विशेषेणा विशिष्टायां शुभ पुण्य तिथौ मम आत्मनः श्रुति स्मृतिपुराणोक्त पुन्यफलप्राप्त्यर्थं धर्मार्थ काम मोक्षफल-प्राप्त्यर्थं तथा चास्यशरिरे गृहेजनानां पशुनां रोगदोष भयव्याधिजरापीडामृत्यु निवारणार्थं चतुर्विधपाप क्षयार्थं त्रिविधतापोपशमनार्थं दशविधिलक्ष्मीप्राप्त्यर्थं श्री भारभूत देवताप्रीत्यर्थं कृतायाः श्री भारभूतेश्वरतिर्थ प्रति वार्षिकवा अष्टादश वार्षिक महायात्राः संपूर्ण फलप्राप्तये अद्यान्हियथा मिलितोपचारद्रव्यैः यथा शक्त्या अभिषेकपूर्वकं वा शिव रात्र्यां पंचवक्त्र पूजनपूर्वकं तत्कथा श्रवणपठनपूर्वक श्री भारभूतेश्वर पुजनाद्यर्चनमहंकरिष्ये. ॥

ફરીથી પાણી લઈ નીચે પ્રમાણે મંત્ર બોલી સંકલ્પ કરીને મૂકવું.

॥ तदंगीभूतं गणपतिगौरी हनुमन्नंदीश्वरादीनां पंचोपचारेः पूजनमहंकरिष्ये.

ફરીથી પાણી લઈ નીચેના મંત્રથી સંકલ્પ કરી મૂકી દેવું.

॥ तथा च दिग्रक्षणं कलशाराधनं भूमिपुजनं शंख घंटा दिपादीनां च पूजनं करिष्ये ॥

આ પ્રમાણે સંકલ્પો કરી આચમનીમાં જળ લઈ નીચે પ્રમાણે મંત્ર ભણી મૂકી દેવું અને પછીથી જમીન ઉપર ચાર વખત પાણી મૂકી ગંધાક્ષત પુષ્પ પૃથ્વીને ચઢાવીને નમસ્કાર કરવા.

॥ तत्र पृथ्वीमंत्रस्य मेरुपृष्टऋषिः कुर्मोदेवता सुतलं छंदः आसने विनियोगः ॥ पृथ्वि त्वया धृतालोका देवि त्वं विष्णुना धृता उध्धृतासि वराहेण कृष्णेन शतबाहुना ॥१॥ ॐ योगासनाय नमः । विमलासनाय नमः । कुर्मासनाय नमः भूम्यै नमः सर्वोपचारार्थे गंधाक्षतपुष्पाणि समर्पयामि. ॥

પછીથી કળશની નીચે અક્ષત મુકી કળશને હાથ અડકાડી નીચે પ્રમાણે મંત્રો ભણી ચાર દિશામાં કલશને ગંધ અક્ષત પુષ્પ કરી અંદર ગંધાક્ષત પુષ્પ કરવા પછી તેમાંથી નીચે લખેલા મંત્રથી ડાબા હાથમાં એક આચમની પાણી લઈ પૂજાના સાહિત્ય દેવાલય તથા શરીર ઉપર માર્જન કરવું.

तत्राक्षत पुंजेपु कलशं संस्थाप्य कलशं स्पृष्ट्वा पठेत् ॥
कलशस्य मुखे विष्णुः । कंठे रूद्र समाश्रितः ॥
मूले तत्रस्थितो ब्रह्मा । मध्ये मातृगणः स्मृता ॥१॥
॥ कुक्षेतु सागराः सर्वे । सप्त द्विपा वसुंधरा ॥

॥ ऋग्वेदोऽथयजुर्वेदः । सामवेदो ह्यथर्वणः ॥२॥
॥ अंगैश्च सहिताः सर्वे । कलशेतु समाश्रिताः ॥
॥ अत्र गायत्रि सावित्रि । शांतिपुष्टिकरि तथा ॥३॥
॥ आयान्तु देव पूजार्थं । दुरित क्षयकारका. ॥
॥ गंगे च यमुने चैव । गोदावरि सरस्वति ॥
॥ नर्मदा सिंधु कावेरी । जलेऽस्मिन्सन्निधिं कुरू ॥४॥
॥ ब्रह्मांडोदर तीर्थानि । करैः स्पृष्टानि तेरवे ॥
॥ तेन तीर्थेन मे देव । तीर्थं देहि दिवाकर ॥५॥

॥ ॐ वं वरुणाय नमः अवाहनं समः० । ॐ वं वरूणाय नमः सर्वोपचारार्थे गंधाक्षत पुष्पाणि सम० नमस्करोमि ॥

॥ तस्मादुदकात् उदकं गृहीत्वा पूजाद्रव्याणि आत्मान च संप्रोक्षयेत् ॥ वामहस्ते अक्षतान् सर्षपान् वा गृहीत्वा रक्षोघ्नमंत्रान पठित्वा ॥ चतुर्दिक्षुर्विकिरेत । उर्ध्वताल त्रयं कृत्वा वामपादेन भूमाघातत्रयं कुर्यात् जलं स्पृशेत् ॥

પછીથી નીચેના મંત્રોથી ડાબા હાથમાં સરસવ અથવા ચોખા લઈ જમણો હાથ ઉપર ઉંધોવાળી ભણવા અને માથાની ચોતરફ નાખી દેવા ઉપર ત્રણ તાળી પાડવી અને જમીન ઉપર ત્રણ વખત પગ ઠોકી કાને તથા આંખે પાણી અડાડવું.

॥ अथ दिग्रक्षणम् ॥

॥ अपसर्पतु ते भूताः । ये भूताः भूमिसंस्थिताः
॥ ये भूताः विघ्नकर्तारः । स्ते नश्यंतु शिवाज्ञया ॥१॥
॥ अपक्रामंतुभूतानि । पिशाचाः सर्वतोदिशम् ॥
॥ सर्वेषामविरोधेन । पूजाकर्म समारभेत् ॥२॥

પછીથી દીવાની તથા સૂર્યનારાયણને ગંધાક્ષત પુષ્પ ચઢાવીને શંખ તથા ઘંટાનું પૂજન નીચે લખેલા મંત્રોથી કરવું.

॥ अथ दिपकपुजन मंत्रः ॥

॥ भो दीप देव रुपस्त्वं । अंधकार निवारक ॥
॥ इमांमया कृतां पूजां गृहाण स्तेजःप्रवर्धये ॥१॥
॥ दीपाधिष्ठात्र देवताभ्यो नमः सर्वोपचारार्थे गंधाक्षत
॥ पुष्पाणि सम० ॥

॥ अथ सूर्यपुजनम् ॥

॥ एकचक्र रथोयस्य । दिव्यः कनक भूषितः ॥
॥ समेभवतु सुप्रितः । पद्महस्तो दिवाकरः ॥१॥
॥ श्रीजगच्चक्षुषे सूर्यनारायणाय नमः ॥ सर्वोपचारार्थे गंधाक्षतपुष्पाणि सम० ॥

॥ अथ शंखपुजनम् ॥

॥ त्वं पुरा सागरोत्पन्नो ॥ विष्णुना विधृतः करे ॥
॥ निर्मितः सर्व देवैश्च । पांचजन्य नमोऽस्तुते ॥१॥
॥ पांचजन्याय विद्महे पावमानाय धिमहि तन्नो शंखः प्रचोदयात् ॥ शंखस्थ देवेभ्यो नमः सर्वोपचार्थे गंधाक्षत पुष्पाणि सम० ॥

॥ अथ घंटापुजनम् ॥

॥ आगमार्थं तु देवानां । गमनार्थं तु राक्षसाम् ॥
॥ घटानादं प्रकुर्वीत । पश्चाद्घंटां प्रपूजयेत् ॥१॥
॥ घंटस्थाय गरूडाय नम । सर्वोपचार्थे गधाक्षत पुष्पाणि सम० ॥

પછીથી પુષ્પ અક્ષત લઈ ગણપતિનું ધ્યાન કરવું અને ધ્યાન કરી સ્નાન કરાવી ગંધાક્ષત પુષ્પ કરવાં

॥ अथ गणपति ध्यानम् ॥

॥ श्वेतांगं श्वेतवस्त्रं सितकुसुमगणैः पूजितंश्वेतगंधैः ॥
॥ क्षीराब्धौरत्नद्वीपैः सुरवरतिलकं रत्नसिंहासन स्थम् ॥
॥ दोर्भिः पाशांकुशाजाभयवरमनसं चंद्रमौलिंत्रिनेत्रं ॥
॥ ध्यायेच्छांत्यर्थमिशं गणपतिमममलं श्री समेतं प्रसन्नम् ॥१॥
॥ ॐ श्री सिद्धिबुद्धसहित गंगणपतयेनमः ध्यायामि ॥
॥ ॐ गंगणपतयेनमः सर्वोपचारार्थे गंधाक्षतपुष्पाणि दुर्वांकुरान
॥ समर्पयामि शेषोपचारार्थे नमस्कारान समर्पयामि० ॥२॥

પછીથી ફરી હાથમાં ચોખા પુષ્પ લઇ શ્રી જગદંબા પાર્વતિનું ધ્યાન કરી સ્નાન કરાવવું. અને ગંધાક્ષત પુષ્પ કરી નમસ્કાર કરવા.

॥ अथ देवी ध्यानम् ॥

॥ श्यामांगींशशिशेखरां निजकरै र्दानं च रक्तोत्फलम् ॥
॥ रत्नाढ्यं कलशंपरं भयहरंम् संविज्जतिं शाश्वतीम् ॥
॥ मुक्ताहारलसत पयोधरनतां नेत्रत्रयोल्लासिनीम् ॥
॥ आवाहत सुरपूजितां हरवधुं रक्तारविंदस्थिताम् ॥१॥

ઉપર પ્રમાણે ધ્યાન કરી જગદંબા પાર્વતિજીને ચડાવી સ્નાન કરાવી ગંધ ગંધાક્ષત પુષ્પ કરવાં. શેષોપચારને માટે નમસ્કાર કરવા.

॥ अथ हनुमान ध्यानम् ॥

હાથમાં અક્ષત પુષ્પ લઇ હનુમાનનું ધ્યાન નીચે લખેલા મંત્રથી કરવું.

॥ मनोजवं मारूततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठम् ॥
॥ वातात्मजं वानरयुथमुख्यं श्रीरामदुतं शिरसानमामि ॥१॥

॥ श्रीरामदुताय हनुमते नमः ध्यायामि । सर्वोपचार्थे गंधा-
॥ क्षतपुष्पं समo ॥ शेषोपचारार्थे नमस्कारान् समo ॥

ઉપર પ્રમાણે ધ્યાન કરી ચોખા પુષ્પ હનુમાનજી ઉપર ચઢાવી સ્નાન કરાવવું પછી ગંધાક્ષત પુષ્પ ચઢાવી નમસ્કાર કરવા પછીથી નંદી વિગેરે દેવોને સ્નાન કરાવી ગંધાક્ષત પુષ્પ નીચેના મંત્રથી ચઢાવવાં.

॥ अथ श्री नंदीकेश्वरायनमः ॥ सर्वोपचारार्थे गंधाक्षत
पुष्पार्णा समo ॥ शेषोपचारार्थे नमस्कारान समo ॥

પછી નમસ્કાર કરવા અને ત્યાર બાદ શાંતચિત્તથી શ્રીભગવાન ભારભૂતેશ્વરની પુજાનો આરંભ કરવો હાથમાં પુષ્પાક્ષત લઇ નીચેના મંત્રોથી ધ્યાન કરવું.

॥ अथ ध्यान मंत्रः ॥

॥ ॐ ध्यायेन्नित्यं महेशंरजतगिरिनिभं चारु चंद्रावतंसं ॥
॥ रत्नाकल्पोज्वलांगं परशुमृगवरा भितिहस्तं प्रसन्नम ॥
॥ पद्मासिनं समन्तात् स्तुतममरगणै र्व्याघ्रकृत्तिंवसानं ॥
॥ विश्वाद्यं विश्ववंद्यं निखिलभयहरं पंचवक्त्रं त्रिनेत्रं ॥१॥
॥ ॐ नमःशंभवायच भयोभयायचनमः शंकरायचमयस्कारायनमः
नमः ॥ शिवायच शिवतरायच ॥ ॐभूर्भूवःस्वः श्रीभगवते
॥ भारभूतेश्वराय शांब सदाशिवायनमः ध्यायामि ॥

ધ્યાન કર્યા પછીથી પુષ્પ અક્ષત લઇ દેવની ઉપર ચઢાવવાં અને ફરીથી આસનને માટે નીચેનો મંત્ર ભણી પુષ્પાક્ષત ચઢાવવાં.

॥ अथ आसन मंत्रः ॥

॥ रम्यं सुशोभनमं दिव्य सर्वसौख्यकरं शुभंम् ॥
॥ आसनंच मयादत्तं । गृहाण परमेश्वर ॥२॥

॥ ॐ पुरुषएवेदᳩ. सर्वं यद्भूतंयच्चभाव्यम् ॥ उतामृतत्वस्ये- शानोयदन्ने नातिरोहति ॥ ॐ भूर्भूवः श्री भगवते भारभूतेश्वराय शांब सदाशिवाय नमः ॥ आसनार्थे पुष्पं सम० ॥

પછી આચમનીમાં પાણી ભરી તેમાં ચંદન નાખી ભગવાનને નીચેના મંત્રથી પાદ્ય કરવું.

॥ अथ पाद्य मंत्रः ॥

॥ उष्णोदकं निर्मलंच । सर्वसौगंध्य संयुक्तम् ॥

॥ पादप्रक्षालनार्थायदत्तंप्रतिगृह्यताम् ॥३॥

॥ ॐ एतावानस्यमहिमातोज्यायांश्चपुरुषः ॥ पादोस्यविश्वा

॥ भूतानित्रियादस्यामृतन्दिवि ॥

॥ ॐ भूर्भूवः स्वः भगवते भारभूतेश्वराय शांब सदाशिवा

॥ नमः पादयोःपाद्यं सम० ॥

પછીથી આચમનીમાં ચંદન અક્ષત પુષ્પ પાણી ફળ તથા હિરણ્ય મુકીને અર્ધ્ય બનાવી નીચેના મંત્રથી ભગવાનને ચઢાવવો.

॥ अथ अर्घ्य मंत्राः ॥

॥ ॐ अर्घ्यंगृहाणदेवेश । गंध पुष्पाक्षतैर्युतम् ॥

॥ करुणाकरमेदेव । गृहाणार्घ्यं नमोस्तुते ॥४॥

॥ ॐ त्रिपादुर्ध्वउदैतपुरुषः पादोस्येहाभवत्पुनः ॥

॥ ततोविष्वङ्व्यक्रामत्साशनानशनेअभि ॥

॥ ॐ भूर्भुवःस्वः भगवमे भारभूतेश्वराय शांब सदाशिवाय

॥ नमः हस्तयोःअर्घ्यं सम० ॥

પછીથી આચમનીમાં પાણી લઈ નીચેનો મંત્ર ભણી ભગવાનને આચમન કરાવવું.

॥ अथ आचमन मंत्रः ॥

॥ सर्वतिर्थ समायुक्तं सुगंधिनिर्मलं जलम् ॥
॥ आचम्यतां मयादत्तं गृहाण परमेश्वर ॥
॥ ॐ ततोविराडजायत विराजोऽधिपुरुषः सजातोअत्यरिच्यत
॥ तपश्चाद्भू मिमथोपुरः ॥ ॐ भूर्भुवःस्वः भगवते भार
भूतेश्वराय शांब सदाशिवायनमः मुखे आचमनीयं सम० ॥

પછી સ્નાનને માટે નીચેનો મંત્ર ભણી ભારભૂતેશ્વર મહાદેવને પાણી ચઢાવવું.

॥ अथ स्नान मंत्रः ॥

॥ गंगा सरस्वती रेवा । पयोष्णीनर्मदाजलैः ।
॥ स्नापितोऽसि मयादेव । तथा शांतिकुरुष्वमे ॥६॥
॥ ॐ तस्माद्यज्ञात्सर्वहुतः सम्भृतम्पृषदाज्यम् ॥
॥ पशूँस्तॉश्चक्रे । वायव्यानारण्या ग्राम्याश्चये ॥
॥ ॐ भूर्भुवःस्वः भगवते भारभूतेश्वराय शांब सदाशिवाय
॥ नमः स्नानं समर्पयामि ॥

પછીથી એક પાત્રમાં દુધ દહિં ઘી મધ ખાંડ વીગેરે લઈ એકત્ર કરી નીચેના મંત્રથી શ્રી ભારભુતેશ્વર મહાદેવને પંચામૃત સ્નાન કરાવવું.

॥ अथ पंचामृतस्नान मंत्रः ॥

॥ पयोदधि घृतंश्चैव । मधु च शर्करायुतम् ॥
॥ पंचामृतंमयानित्तं । स्नानार्थं प्रतिगृह्यताम् ॥७॥
॥ ॐ पंचनद्याः सरस्वतिमपियन्तिसस्रोतसः ॥
॥ सरस्वतितुपंचधासोदेशेभवत्सरित् ॥

॥ ॐ भूर्भुवःस्वः भगवते भारभूतेश्वराय शांब सदाशिवाय
॥ नमः पंचामृत स्नानम् स्म० ॥

હવે જો પંચામૃત સ્નાન પ્રત્યેક મંત્રથી વિભક્ત કરાવવું હોય તો બીજેથી તે મંત્રો ભણીને કરાવવું પછીથી પાણીની આચમની ભરી તેમાં ચંદન કપુર વિગેરે મુકી નીચેના મંત્રથી ગંધોદક સ્નાન કરાવવું.

॥ मलयाचल संभुतं चंद्नागरु संभवम् ॥
॥ चंदनं देवदेवेश ॥ स्नानार्थं प्रतिगृह्यताम् ॥८॥
॥ ॐ गंधद्वारां दुराधर्षां नित्यपुष्टां करिषिणिम् ।
॥ ईश्वरीं सर्वं भूतानां तामिह्रो पह्वयेश्रियम् ॥
॥ ॐ भूर्भुवःस्वः भगवते भारभूतेश्वराय नमः गंधोदकस्नानं
॥ समर्पयामि ॥

પછીથી અત્તર હોય તો નીચેના મંત્રથી શ્રીભગવાનને અત્તરથી સ્નાન કરાવવું.

॥ अथ उदर्तव स्नान मंत्रः ॥

॥ नानासुगंधिद्रव्यंच चंदन रजनीयुतम् ॥
॥ उद्वर्तनंमयादत्तं । स्नानार्थं प्रतिगृह्यताम् ॥९॥
॥ ॐ ६' शुनाते । अ ६' शुः पृच्यतामपरूखस्परूः ॥
॥ गन्धस्तेसोमभवतुमदायरसोऽअच्युत ॥
॥ ॐ भूर्भुवःस्वः भगवते भारभूतेश्वराय नमः उद्ववर्नन
॥ स्नानं समर्पयामि ॥

પછીથી ભગવાનને શુદ્ધ પાણીથી સ્નાન કરાવવું પછી નીચેના મંત્રોથી વસ્ત્ર જનોઇ ગંધ અક્ષત પુષ્પ બીલી સુગંધી દ્રવ્ય ધુપ દીપ નૈવેદ્ય સાકરનું ધરાવવું પછી ફળ તાંબુલ દક્ષણા આરતી મંત્રપુષ્પાંજલી વિશેષાર્ઘ નમસ્કાર

સંક્ષિપ્તથી કરાવવા પછી પુજા નૈવેદ્ય કરી ઉત્તર દિશામાં મહાદેવ ઉપરથી નિર્માલ્ય લઈ સુંઘીને નાખી દેવું ફરીથી મહાદેવને ગંધાક્ષત પુષ્પ કરી પાણીની ગળતી હોય તેમાં દુધ પાણી ચંદન અક્ષત વિગેરે નાખી સળંગ ૨ રૂદ્રી ૩ લઘુરૂદ્ર ૪ મહારૂદ્ર ૫ અતિરૂદ્ર અભિષેકાત્મક કરવો તેમાં પુરાણોક્ત હોય તો તે (**महिम्न स्तोत्रथी**) કરવો અને વેદોક્ત હોય તો તે અષ્ટાધ્યાયી રૂદ્રીથી કરવો તેમાંથી ૯ નમસ્તે રૂદ્ર । ૨ **गणानात्वाथी** સળંગ એમ મળીને ૧૧ તે આઠમા અધ્યાયના નમક ચમક સાથે કરવો જો ચાર પહોરની પુજા હોય તો દરેક પ્રહરમાં યથાશક્તિ ઉપર લખેલા પાંચમાંના ગમે તે પ્રકારથી પણ અભિષેક કરવા અભિષેક થતો હોય ત્યારે પોતે કથા વાર્તા વિગેરે પાઠો કરવા અથવા સાંભળવા:—

॥ ॐ भारभूतेश्वरायनमः वस्त्रोपवस्त्रार्थे अक्षतानसमर्पयामि॥
॥ ॐ भारभूतेश्वरायनमः यज्ञोपवितार्थे अक्षतान समर्पयामि॥
॥ ॐ भारभूतेश्वरायनमः गंधं समर्पयामि ॥
॥ ॐ भारभूतेश्वरायनमः अक्षतान समर्पयामि ॥
॥ ॐ भारभूतेश्वरायनमः बिल्वपत्राणी समर्पयामि ॥
॥ ॐ भारभूतेश्वरायनमः ऋतुकालोद्भवानि पुष्पाणि सम० ॥
॥ ॐ भारभूतेश्वरायनमः सौभाग्यद्रव्यं समर्पयामि ॥
॥ ॐ भारभूतेश्वरायनमः प्रत्यक्ष धूपमाघ्रापयामि ॥
॥ ॐ भारभूतेश्वरायलमः प्रत्यक्ष दीपं दर्शयामि ॥
॥ ॐ भारभूतेश्वरायनमः शर्करामात्र नैवेद्य निवेदयामि ॥

આ પ્રમાણે બીડીના પાનમાં નૈવેદ ધરાવી નમઃશિવાય કહીને પાણીના છાંટા નાખી ડાબો હાથ આડો રાખી જમણા હાથથી નીચેના મંત્રોથી પાંચ વખત જમાડી બે વખત નીચે

લખેલા મંત્રોથી પાણી મુકીને ચંદનના છાંટા ભગવાનને નાખવા.

॥ ॐ प्राणायस्वाहा । ॐ अपानायस्वाहा. ॐ व्यानायस्वाहा

॥ ॐ उदानायस्वाहा ॥ ॐ समानायस्वाहा ॐ ब्रह्मणेस्वाहा ॥

॥ ॐ भारभूतेश्वरायनमः हस्तप्रक्षालनं ॥ मुखप्रक्षालनं समर्पयामि करोद्वर्तनार्थे गंधं समर्पयामि ॥

॥ ॐ भारभूतेश्वरायनमः फल मुखवास तांबुलं समर्पयामि ॥

॥ ॐ भारभूतेश्वरायनमः हिरण्यमुद्रा दक्षिणां समर्पयामि ॥

॥ ॐ भारभूतेश्वरायनमः कर्पुरारार्तिक्यं समर्पयामि ॥

॥ ॐ भारभूतेश्वरायनम प्रदक्षणां समर्पयामि ॥

॥ ॐ भारभूतेश्वरायनमः मंत्रपुष्पयुक्त नमस्कार समर्पयामि ॥

॥ ॐ भारभूतेश्वरायनमः विशेषार्घं समर्पयामि ॥

॥ ॐ भारभूतेश्वरायनमः प्रार्थनां समर्पयामि ॥

॥ अनेन पंचामृतादि स्नानांत पुजन कृतेन भगवान

॥ भारभूतेश्वरः ॥ प्रियतांनमम ॥ निर्माल्यंविसृज्य ॥

॥ पुनश्च गंधाक्षत पुष्पाणि समर्पयामि ॥

ઉપર પ્રમાણે પુજન કરી આગળ લખ્યા મુજબ યથાશક્તિ અભિષેક કરવો અથવા બ્રાહ્મણદ્વારા કરવવો પછી અભિષેક સ્નાન થઇ રહે એટલે નીચેના મંત્રથી ભગવાનને શુદ્ધોદક સ્નાન કરાવી વસ્ત્ર ચઢાવવું.

॥ ॐ अथ वस्त्र मंत्रः ॥

॥ सर्वभूमाधीके मान्ये । लोकलज्जानिवारणे ॥

॥ मयोपपादितेतुभ्यं । वाससिप्रतिगृह्यताम् ॥१०॥

॥ युवासुवासाः परिवित आगत्सउश्रेयान्भवति जायमानः ॥

॥ तंधीराः सकवय ॥ उन्नयंति स्वाध्योमनसा देवयन्तः ॥

॥ ॐ भूर्भुवःस्वः भगवते भारभूतेश्वराय शांब सदाशिवाय
॥ नमः ॥ वस्त्रोपवस्त्रं समर्पयामि ॥

પછી નીચેનો મંત્ર બોલી જનોઈ પહેરાવવી.

॥ अथ यज्ञोपवित मंत्रः ॥

॥ नवभिस्तंतुभिर्युक्तं । त्रिगुणंदेवतामयम् ॥
॥ उपवितं मयादत्तं । गृहाण परमेश्वर ॥११॥
॥ ॐ यज्ञोपवितं परमंपवित्रं प्रजापतेर्यत्सहजं पुरस्तात् ॥
॥ आयुष्यमग्र्यं प्रतिमुंच शुभ्रंयज्ञोपवितं बलमस्तुतेजः ॥
॥ ॐ भूर्भुवःस्वः भगवते भारभूतेश्वराय शांब सदाशिराय
॥ नमः यज्ञोपवितं समर्पयामि ॥

પછી નીચેના મંત્રથી ભગવાનને ભસ્મ લગાવી ચંદન કરવું.

॥ अथ भस्म मंत्रः ॥

॥ ॐ त्र्यंबकं यजामहे सुगन्धिम्पुष्टिवर्धनम् ॥ उर्वारुकमिव
॥ बन्धनान्मृत्योर्मुक्षियमामृतात् ॥ ॐ भूर्भुवःस्वः भगवते
॥ भारभूतेश्वराय शांब सदाशिवायनमः ॥ भस्मंविलेपयामि ॥

॥ अथ चंदन मंत्रः ॥

॥ श्रीखंडं चंदनंदिव्यं । गंधाढ्यंसुमनोहरम् ॥
॥ विलेपनं सुरश्रेष्ट । चंदनंप्रतिगृह्यताम् ॥
॥ ॐ त्वांगन्धर्वा अखनँ स्त्वामिन्द्रस्त्वां बृहस्पतिः ॥
॥ त्वामोषधेसोमोराजा विद्वान्यक्ष्माद्मुच्यत् ॥
॥ ॐ भूर्भुव स्वः भगवते भारभूतेश्वराय शांब सदाशिवाय
॥ नमः गंधं समर्पयामि ॥

પછીથી નીચેના મંત્રથી ભગવાનને ચોખા ચોટાડવા.

॥ अथ अक्षत मंत्रः ॥

॥ अक्षतांश्चसुरश्रेष्ट । कुकुंमाक्ता: सुशोभिता: ॥
॥ मयानिवेदताभक्त्या गृहाण परमेश्वर ॥१४॥
॥ ॐ अक्षन्नत्रीमदन्तह्यवप्रिया अधुषत ॥ अस्तोषतस्व
॥ भानवौविप्रानविष्ठया मतियोजान्विन्द्रतेहरी ॥
॥ ॐ भूर्भुवःस्वः भगवते भारभूतेश्वराय शांब सदाशिवाय
॥ नमः अक्षतान समर्पयामि ॥

પછીથી નીચેના મંત્રથી બીલીપત્ર ચઢાવવાં વધારે હોય તો ૧૦૮ અથવા ૧૦૦૦૮ સહસ્ત્ર નામાવલીથી અર્પણ કરવાં.

॥ अथ बिल्वदलार्पण मंत्रः ॥

॥ त्रिदलं त्रिगुणाकारं त्रिनेत्रंच त्र्यायुधम ॥
॥ त्रिजन्मपाप संहारं । एक बिल्वपत्र शिवार्पणं ॥१५॥
॥ ॐ नमो बिल्मीनेचकवचिने च नमोवर्म्मिणेच वरुथिनेच ॥
॥ नमःश्रुनायच श्रुतसेनायचनम: ॥
॥ ॐ भूर्भुवःस्वः भगवते भारभूतेश्वराय शांबसदाशिवाय
॥ नमः ॥ बिल्वदलपत्राणि समर्पयामि पंचाक्षरी मंत्रेण ॥

પછીથી નીચેના મંત્રથી ભગવાન ભારભૂતેશ્વરને પુષ્પ ચઢાવવાં.

अथ पुष्प मंत्रः ॥

॥ माल्यादिनि सुगंधिनी माल्त्यादिनी वैप्रभो ॥
॥ मयानिवेतानी पुष्पाणी । पुजार्थे प्रतिगृह्यताम् ॥१६॥
॥ ॐ यत्पुरुषं व्यदधु: कतिधाव्य कल्पयन ॥
॥ मुखंकिमस्यासित्किंबाहूरुपादा उच्यते ॥
॥ ॐ भूर्भुवःस्वः भगवते भारभूतेश्वरायनमः शांब सदा
॥ शिवाय नमः ॥ पुष्पाणि समर्पयामि ॥

પછીથી અબીલ ગુલાલ સીંદુર સર્વૌષધી વિગેરે નીચેના મંત્રોથી ચઢાવવી.

॥ अथ सौभाग्यद्रव्य मंत्रः ॥

॥ अबीलंच गुलालंच चुवाचंदन मेवच ॥
॥ सिंदुरेण समायुक्तं सौभाग्यं प्रतिगृह्यताम् ॥
॥ ॐ अहिरिवभोगैः पर्य्येतिबाहुंजायाहेतिम्परिवाधमानः ॥
॥ हस्तघ्नोविश्वाव्वयुनानि विद्वान्पुमान्पुमा ८ं सम्परिपातु
॥ विश्वतः ॐ भूर्भुवस्वः भगवते भारभूतेश्वराय शांब
॥ सदाशिवायनमः सौभाग्यद्रव्यं समर्पयामि ॥

પછીથી નીચેના મંત્રથી ભગવાન પાસે ધુપ સળગાવીને મુકવો ને સંકલ્પ કરવો.

॥ अथ धुप मंत्रः ॥

॥ वनस्पतिरसोद्भूतो गंधाढ्योगंधउत्तमः ॥
॥ आघ्रेयः सर्वदेवानां धुपोयं प्रतिगृह्यताम् ॥१८॥
॥ ॐ धूरसिधुर्व्व धूर्वन्तंम्योस्मान धुर्वतितं धुर्वयंवयं धुर्वामि ॥
॥ देवानामसिवन्हि तम ८ं सस्ति तमम पप्रितंमगुष्ट-
॥ तमन्देवाहुतमम् ॥ ॐ भूर्भूवस्वः भगवते भारभूतेश्वराय
॥ नमः शांब सदाशिवायनमः धुपमाघ्रापयामि ॥

પછી દીવાને ગંધાક્ષત કરી પાણી લઇ નીચેના મંત્રથી સંકલ્પ કરવો.

॥ अथ दीप मंत्रः ॥

॥ आज्यंच वर्तिसंयुक्तं । वह्निनार्याजितोमया ॥
॥ दिपंग्रहाणदेवेश । त्रैलोक्ये तिमिरापह ॥१९॥
॥ ॐ अग्निर्ज्योतिर्ज्योतिरग्निःस्वाहा सूर्यो ज्योतिर्ज्योतिःसूर्य
॥ स्वाहा अग्निर्व्वर्च्चो ज्योतिर्वर्च्चःस्वाहा ॥ ज्योतिः सूर्यः

॥ सूर्योज्योतिःस्वाहा ॥ ॐ भूर्भुवःस्वः भगवते भारभूतेश्वराय
॥ शांब सदाशिवायनमः दिपंदर्शयामि ॥

પછીથી પાત્રમાં નૈવેદ્ય પકવાન્ન વિગેરે જે હોય તે મુકી આચમનીમાં પાણી લઈ નીચેનો મંત્ર ભણવો.

॥ अथ नैवेद्य मंत्रः ॥

॥ शर्कराघृतसंयुक्तं मधुरस्वादुचोत्तमम् ॥
॥ उपहार समायुक्तं नैवेद्य प्रतिग्रह्यताम् ॥२०॥
॥ ॐ अन्नपतेऽन्नस्यनो देह्यनमिवस्यशुष्मिणः ॥
॥ पप्रदातारन्तारिखउर्जन्नोधेहिद्विपदे शंचतुष्पदे ॥
॥ ॐ भूर्भुवःस्वः भगवते भारभूतेश्वराय शांब सदाशिवाय
॥ नमः स्वाद्यनवेद्यम् सम० ॥

પછીથી તે નૈવેદ્ય ઉપર ॐ નમઃશિવાય એ મુલ મંત્રથી પ્રોક્ષાલન કરી ગ્રાસ મુદ્રાવી પાંચ વખત નીચે લખેલા મંત્રથી જમાડી ચાર વખત પાણી મુકવું અને પછી અત્તર અથવા ચંદનના છાંટા નાખવા અને પછીથી ભગવાનને ઈલાયચી લવિંગ પાન વિગેરે નીચે લખેલા મંત્રોથી અર્પણ કરવાં.

॥ भोजन विधि ॥

॥ ॐ प्राणायस्वाहा ॥ ॐ अपानायस्वाहा ॥ ॐ व्यानाय-
॥ स्वाहा ॐ उदानायस्वाहा ॥ ॐ समानायस्वाहा ॥
॥ मध्येपानियं ॥ उतरापोशनं ॥ हस्त प्रक्षालन समर्पयामि ॥
॥ मुख प्रक्षालनं समर्पयामि ॥ करोद्वर्तनार्थे गंधं सम० ॥

॥ अथ तांबुल मंत्रः ॥

॥ पुंगीफल महद्दिव्यं । नागवल्लिदलैर्युतम ॥
॥ पलादिचुर्ण सयुक्त । तांबुलं प्रतिग्रह्यतांम ॥२१॥

॥ ॐ यत्पुरुषेण हविषादेवा यज्ञमतन्वत ॥
॥ वसन्तोऽस्यासिदाज्यंग्रिष्मइध्मः शरद्धविः ॥
॥ ॐ भूर्भुवःस्वः भगवते भारभूतेश्वराय शांब सदाशिवाय
॥ नमः मुखवासार्थे तांबुलं समर्पयामि ॥

પછીથી નીચેના મંત્રથી સોપારી વિગેરે ફળ મુકવાં.

॥ ॐ याः फलिनीर्याऽअफलाऽअपुष्पायाश्चपुष्पिणिः ॥
॥ बृहस्पति प्रसुतास्तानो मुचन्त्व ६ हसः ॥२२॥
॥ ॐ भूर्भुवःस्वः भगवते भारभूतेश्वराय शांब सदाशिवाय
॥ नमः फलम् समर्पयामि ॥

પછીથી હિરણ્યદક્ષણા લેઇને નીચેના મંત્રથી મુકવી.

॥ अथ हिरण्यदक्षणा मंत्रः ॥

॥ हिरण्यगर्भं गर्भस्थं । हेमबिजंविभावसोः ।
॥ अनंत पुण्यफलदमतः । शांति प्रयच्छमे ॥२३॥
॥ हिरण्यगर्भःसमवर्तताग्रे भूतस्यजातः पतिरेक आसित
॥ सदाधार पृथिवीं द्यामुतेमां कस्मैदेवाय हविषाविधेम ॥
॥ ॐ भूर्भुवःस्वः भगवते भारभूतेश्वराय शांब सदाशिवाय
॥ नमः हिरण्य दक्षणां समर्पयामि ॥

પછીથી આરતી સળગાવી ગંધાક્ષત પુષ્પથી નીચેના મંત્રથી પુજન કરી પાછળ લખેલી છે તે આરતી બોલવી ને ત્યારપછીનો બધો વિધિ સંપૂર્ણ કરવો ત્યારે પુજાની સમાપ્તિ થશે.

॥ ॐ रत्नेश्वर्यै नमः सर्वोपचारार्थे गंधाक्षत पुष्पाणि
॥ समर्पयामि ॥

॥ ॐ ॥

॥ श्री गणेशाय नमः ॥

॥ श्री नर्मदादेव्यै नमः श्री भवानी शंकराभ्यां नमः ॥
॥ श्री मंगलं भगवान शंभुमंगलं वृषवाहना: ॥
॥ मंगलं पार्वतिनाथ मंगलायतनो हरः ॥१॥
॥ नर्मदायैनमः प्रातार्नर्मदायैनमोनिशि ॥
॥ नमोऽस्तु नर्मदेतुभ्यं । त्राहिनां शरणागतम् ॥२॥
॥ गणराजं नमस्कृत्यम् नमस्कृत्य पितामहम् ॥
॥ नमस्कृत्यमहंकुर्व । स्तुतिं भारभूतेश्वरस्यच ॥३॥
॥ तत्रादौ ॥

કહ્યું છે કે હંમેશાં કોઈપણ કાર્ય કરતાં પહેલાં દરેક મનુષ્યે મંગલ કરવું જોઇએ. તેને માટે હું પણ અહિં પ્રાણી માત્રનું કલ્યાણ કરનાર એવા ભગવાન શંભુ તથા વૃષભવાહન મારૂં આ કાર્યમાં મંગલ કરે એવી ઈચ્છાથી પાર્વતીપતી પરમેશ્વર અનેક પાપોનો નાશ કરનાર મંગલ સ્વરૂપ ભગવાનને નમસ્કાર કરૂં છું. અને તેનું વર્ણન આપણે કરીએ છીએ એવા પતીતપાવની શ્રી નર્મદાજી તમને અહો-રાત્રી હું નમસ્કાર કરીને માગું છું કે હે દેવી! હું આપના શરણમાં આવ્યો છું તો આપ મારૂં રક્ષણ કરો. તેમજ અનેક વિઘ્નોનો નાશ કરનાર ગણરાજને તેમજ જગનાપતિ બ્રહ્માને નમસ્કાર કરીને આ શ્રી નર્મદાજીના ઉત્તર કિનારા ઉપર આવેલા શ્રીભગવાન ભારભૂતેશ્વર મહાદેવના મહાત્મને લખવા માટે આરંભ કરીએ છીએ. આ કથાનો આરંભ કયાંથી થાય છે તેનો આપણે અહિં વિચાર કરવાનો છે! કે, શ્રી નર્મદાજી જેમ મહાદેવથી ઉત્પન્ન થયેથાં, અને તે આપણા

ભારતવર્ષમાં દક્ષીણગંગા તરીકે પ્રખ્યાત છે. તો એવાં પતિત-પાવની સપ્તકલ્પાયુની ભગવતી શ્રીનર્મદાજી શ્રીતુંડેશ્વર નામના તીર્થમાં મધ્યહિન્દુસ્તાનમાં આવેલા અમરકંટક પર્વતમાંથી નીકળી પશ્ચિમમાં સાગરગમા થયેલાં છે. તેમના ઉત્તર કિનારા ઉપર આવેલું તીર્થ જેના દર્શન તથા સેવન માત્રથી અનેક જન્મોનાં સંચિત તેમજ આ જન્મનાં કરેલાં જે ક્રિયમાણ કર્મોથી ઉત્પન્ન થયેલાં મહાન પાપો નાશ કરનાર એવા ભગવાન ભારભૂતેશ્વર નામના મહાદેવ બીરાજે છે તેમના મહાત્મનું વર્ણન કરવામાં આવે છે એ ભગવાન મારૂં તેમજ આ સર્વનું જગતનું કલ્યાણ કરો. એવું હું ભગવાન પાસે પ્રાર્થનાપૂર્વક યાચના કરૂં છું. અને યથામતિ કથા તેમજ સ્તુતિ લખવાનો આરંભ કરૂં છું

॥ श्री रस्तु । कल्याण मस्तु ॥

॥ ॐ ॥

॥ श्री भारभूतेश्वर महादेवनुं माहात्म प्रारंभ ॥

—:(०):—

શ્રી વાયુક્ત શિવ સંહિતામાં ॥ રેવાખંડ ॥ શ્રી નર્મદા માહાત્મ નામના ગ્રંથમાં શ્રી માર્કંડેય મુનિ અમરકંટક પર્વત ઉપર બીરાજેલા છે. ત્યાં વનવાસમાં નીકળેલા તિર્થ યાત્રામાં આવેલા એવા પાંડવોમાં શ્રેષ્ટ (ધર્મરાજા) યુધિષ્ઠિરને કથા કહે છે.

॥ श्री मार्कंडेय उवाच ॥

॥ ततः क्रोशांतरे गच्छे तिर्थ त्रैलोक्ये विश्रुतम् ॥

॥ देव दानव गन्धर्वा अप्सरो गण सेवितम् ॥१॥

માર્કંડેયમુનિ કહેવા લાગ્યા કે:-ઋણમુક્તેશ્વર નામના તિર્થથી એક ગાઉને છેટે દેવો દાનવો ગન્ધર્વો અપ્સરાઓ ઋષિ મુનિઓએ સેવેલું ત્રણ લોકમાં પ્રખ્યાત એવું ॥ ૧ ॥

॥ यत्र तिष्ठतिदेवेशो । साक्षातरुद्रो महेश्वरः ॥

॥ भारेण महता जातो । भारभूति स्तथोच्यते ॥२॥

કે જ્યાં સાક્ષાત રૂદ્રરૂપી ભગવાન દેવાધિદેવ મહાદેવ મહાન એવા ભારતમાંથી ઉત્પન્ન થયેલા જેને ભારભૂતિ નામથી ઓળખવામાં આવે છે, તેમના નામથી ભારભૂતેશ્વર નામનું તિર્થ પ્રખ્યાત થયેલું છે ત્યારે ॥ ૨ ॥

॥ युधिष्ठिर उवाच ॥ યુધિષ્ઠર પુછવા લાગ્યા કે:—

॥ भारभूति मितिप्रोक्तं । त्वया तिर्थं तु यन्मुने ॥

॥ कथं कदाचतउजातं । वदविस्तरतो मम ॥३॥

હે મુનિ આપ જે ભારભુતેશ્વર નામનું તિર્થ છે, એવું કહ્યું તો એ તિર્થ ક્યારે અને કેવી રીતે ઉત્પન્ન થયું એ બધું મને વિસ્તારથી કહો. ત્યારે ॥ ૩ ॥

॥ मार्कंडेय उवाच ॥ માર્કંડેયમુનિ કહેવા લાગ્યા કે.—

॥ भारभूति समुत्प्रोक्तं । शृणु पांडव सत्तम ॥

॥ विस्तरान्मे यथा प्रोक्तं । पुरादेवेन शंभुना ॥४॥

હે પાંડવ શ્રેષ્ટ ! તું જે ભારભુતિશ્વર તિર્થ કેવી રીતે થયું એ મને પુછે છે તો મને પહેલાં એ તિર્થનું મહાત્મ શ્રી ભગવાન પરમ કારૂણિક મહાદેવે વિસ્તારથી મને કહ્યું છે,

તે હું તને કહું છું તે તું સાંભળ ॥ ૪ ॥

॥ आसित् कृत युगे विप्रो वेदवेदांङ्ग पारगः ॥

॥ रैवतस्य मनोराद्य । साधुकर्मा गुणान्वीतः ॥५॥

પહેલાં રૈવત નામનો મનુ થયો તેના આદી ભાગમાં સત્યયુગને વિષે વેદ તથા વેદના અંગો જાણનાર શુભ કર્મ-યુક્ત મહા ગુણવાન ॥ ૫ ॥

॥ विष्णुशर्मोऽति विख्यातो । सव शास्त्र विशारद्ः ॥

॥ क्षमा तपो द्या द्ानम् । सत्यं शौचं धृतिर्घृणा ॥६॥

સર્વ શાસ્ત્રને જાણનાર એવો વિષ્ણુશર્મા નામનો બ્રાહ્મણ હતો. કે જેમાં બ્રાહ્મણનાં લક્ષણો જેવાં કે ક્ષમા, તપ, દયા-યુક્ત, દાતા, સત્ય, પવિત્રતા, ધૈર્ય, નિંદા રહિત ॥ ૬ ॥

॥ विद्या विख्यातमास्तिक्यं । एत तस्मिन्प्रतियुतम् ॥

॥ रुद्र विधाहिये विप्राः । पूज्यन्ते नृप सत्तम ॥७॥

હે રાજા સર્વ વિદ્યા વિશારદ ઇશ્વર સબંધી તેમજ લૌકિક સર્વ પ્રકારનું જ્ઞાન તેમજ આસ્થાવાળો આ બધાં લક્ષણો તેમનામાં હતાં કે એ લક્ષણો જેનામાં હોય છે તે હંમેશાં પૂજાય છે. અને તે ॥ ૭ ॥

॥ पतंतं नरके घोरे । तारयंति तरंतिहि ॥

ઘોર નર્કમાં જનાર જે પાપિષ્ટ જીવો તેમને પોતાનાં કરેલાં અશુભ કર્મો થયાથી છોડાવી નર્કમાંથી તેનો ઉદ્ધાર કરે છે. અને પોતે પણ નર્કમાંથી તરી જાય છે

॥ शांताश्च दांताः अनिशिलिनोये जितेन्द्रिया प्राणिवधान्निवृत्ताः ॥

॥ प्रतिग्रहे संकुचिता ग्रहस्तास्ते ब्राह्मणास्तारयितु समर्थाः ॥८॥

કારણકે ક્ષમાવાન જેવું પોતાની ઇન્દ્રિયો દમન કરેલી છે, તેમજ જીતેલી છે વળી પ્રાણી માત્રની પણ મન વાણી કે કાયાથી પણ હિંસા ન કરનાર અને દાન લેવામાં જેણે પોતાના હાથને પાછા ખેંચેલા હોય છે, એવા ગુણવાળા બ્રાહ્મણો આ સંસારમાંથી હંમેશાં પોતે તરે છે અને બીજા પાપી જીવોને તારે છે, એવા શક્તિવાન હોય છે. ॥ ૮ ॥

॥ एवं गुण गणाकीर्णो । ब्राह्मणो नर्मदा तटे ॥
॥ शिलोञ्छ वृत्ति जीवीच । न्यवसन ब्राह्मणैः सह ॥९॥

એવા ગુણોથી યુક્ત એવો વિષ્ણુશર્મા નામનો બ્રાહ્મણ જેનો નિર્વાહ શિલોઞ્છવૃત્તિથી કરેલ છે, તે નર્મદાજીના ઉત્તર કિનારા ઉપર કેટલાએક બ્રાહ્મણો સાથે રહેતો હતો ॥ ૯ ॥

॥ नित्यं नित्यं प्रशंसन्ति । ब्राह्मणं विष्णुशर्मणः ॥
॥ तादृशं ब्राह्मणं ज्ञातुं । देवदेवो महेश्वर ॥१०॥

અને ત્યાં જે કોઈ બ્રાહ્મણો આવે તે આવા સુંદર ગુણો તથા લક્ષણોથી યુક્ત વિષ્ણુશર્માની ખ્યાતિ બધે થયેલી જોઈને દેવોના પણ દેવ મહેશ્વર ભગવાન મહાદેવને પણ તેમને જોવાની ઇચ્છા થઈ. ॥ ૧૦ ॥

॥ भूत्वा द्विज बटुः श्रीमान् । आजगाम तदाश्रमम् ॥
॥ ददृशातं ब्राह्मणैः सार्धं । उच्चरन्तं पदक्रमम् ॥११॥

એટલે પોતાના ઐશ્વર્યથી યુક્ત એવા મહાદેવે બ્રાહ્મણના બાળકનું રૂપ લઈ જ્યાં આ વિષ્ણુશર્મા રહે છે ત્યાં પોતે આવીને જુવે છે તો બ્રાહ્મણોની સાથે પદ ક્રમ જેની વિકૃતિઓ છે એવા વેદનો પાઠ કરતા જોયા અને પાસે જઈને.

॥ अभिवाद्य सर्तंविप्रा । स्वागतेनाभ्य पूजयन ॥
॥ मुहुर्तार्थे मुवाचाथ । ब्राह्मणन्ब मिहामन: ॥
॥ किमर्थं मे बटो ब्रूहि । किंकरोमि तवे प्सितम ॥१२॥

નમસ્કાર કર્યા એટલે પેલા બધા બ્રાહ્મણોએ સ્વાગત તથા શબ્દથી અભિવાદન કર્યું પછીથી જ્યારે પાઠ પુરો થયો એટલે અર્ધા મુહુર્ત જેટલો કાળ વિત્યા પછી વિષ્ણુશર્માએ બટુકને પુછયું કે હે બટુક તારે અહિં આવવાનું શું કારણ છે, તેમજ તારી શું ઇચ્છા છે તે તું મને કહે અથવા તારૂં જે કાંઇ કામ હોય તે મને તું જણાવ. તે હું કરૂં આ પ્રમાણે કહ્યું ત્યારે ॥ ૧૨ ॥

॥ श्री बटुक उवाच ॥ શ્રી બટુક રૂપી મહાદેવ કહેવા લાગ્યા કે:—

॥ विद्यार्थिन मनु प्राप्तं । विद्धिमां द्विज सत्तम ॥
॥ दास्यसे यद्विमां विद्यां । ततः स्थास्यामिते गृहे ॥१३॥

હે દ્વિજ શ્રેષ્ટ હું આપની પાસે વિદ્યાર્થિ થઇને આવ્યો છું માટે જો આપ મને વિદ્યા ભણાવો તો હું આપના આશ્રમમાં રહિશ. આ પ્રમાણે બટુકે કહ્યું ત્યારે ॥ ૧૩ ॥

॥ ब्राह्मण उवाच ॥ વિષ્ણુશર્મા બ્રાહ્મણ કહેવા લાગ્યો કે:-

॥ सर्वेषामेव विप्राणां । बटोत्वं पात्र उत्तमः ॥
॥ दानानां परमं दानं । कथं विद्या न दीयते ॥१४॥

હે બટુક! બ્રાહ્મણોમાં બટુકને સૌથી શ્રેષ્ટ પાત્ર ગણવામાં આવેલું છે. તો એવું જે તું ઉત્તમ પાત્ર આજે મને બટુક રૂપી મળ્યું તો હું સર્વ દાનોમાં શ્રેષ્ટ એવું વિદ્યારૂપી દાન તને કેમ નહી આપું. પણ ॥ ૧૪ ॥

॥ गुरु शु श्रुषया विद्या । पुष्कलेन धनेनवा ॥
॥ अथवा विद्यया विद्या । भवतिनी फलप्रदा ॥१५॥

વિદ્યા હંમેશાં ત્રણ પ્રકારની હોય છે એક તો ગુરૂની સેવા કરવાથી બીજી પુષ્કળ ધન આપ્યાથી અને ત્રીજું અરસપરસ વિદ્યા આપવાથી જે વિદ્યા પ્રાપ્ત થાય છે તે વિદ્યા હંમેશાં ઉત્તરોતર ઉત્તમ મધ્યમ અને કનિષ્ટ ફળને આપે છે આ પ્રમાણે વિષ્ણુશર્માએ કહ્યું ત્યારે ॥ ૧૫ ॥

॥ श्री बटुक उवाच ॥ શ્રી બટુક કહેવા લાગ્યા કે:—

॥ यथान्ये बालका स्त्वत्ते । शुश्रुषंति ह्यहर्निशम् ॥
॥ भगवान बटुभि सार्धं । शु श्रूषामि तथा ध्रुवम् ॥१६॥

હે ભગવાન જેમ આ બધા બાળકો આપની હંમેશાં અહીં રહીને સેવા કરે છે તે પ્રમાણે હું પણ તેમની સાથે અહીં રહીને જરૂરથી આપની સેવા હંમેશાં કરીશ આ પ્રમાણે બટુકે કહ્યું ત્યારે ॥ ૧૬ ॥

॥ श्री मार्कंडेय उवाच ॥ શ્રી માર્કંડેયમુનિ કહેવા લાગ્યા કે-

॥ तथेति चोक्त्वा विप्रेन्द्रः । पठयंस्तं दिने दिने ॥
॥ वर्तते सह शिष्यैः स । शिलोंच्छानुवहारयन ॥१७॥

બ્રાહ્મણોમાં શ્રેષ્ઠ એવા વિષ્ણુશર્માને આ પ્રમાણે સેવા ભાવથી રહીને તે બટુકે ભણવાની હા કહી એટલે દરરોજ તેને ભણાવવા લાગ્યા અને તે બટુક બધા બ્રાહ્મણોના બાળકોની સાથે હંમેશાં શિલોંચ્છવૃત્તિ કરવા જવા લાગ્યા ॥ ૧૭ ॥

॥ ततःकति पयाहोति । प्रोक्तो बटुनिरिश्वरः ॥
॥ पचनाद्यं बटो कर्म । कुरु पययि मागतम ॥१८॥

આ પ્રમાણે કેટલાએક દિવસ વીત્યા એટલે સાક્ષાત ઈશ્વરરૂપી બટુકને પેલા બધા બટુકો કહે કે હે બટુક આજે અનુક્રમ રસોઈ કરવાનું કામ તારે માથે આવેલું છે, તો તું આજે તે બનાવજે ॥ ૧૮ ॥

॥ तथेति चोक्त्वा देवेश । तदाश्रम पदे स्थितः ॥
॥ अध्यापकश्च शिष्याश्च । वनं जग्मुर्यथातुरा ॥१९॥

આ પ્રમાણે કહ્યું એટલે ભગવાન મહાદેવને (ઘેર) આશ્રમમાં મુકી હંમેશના રીવાજ પ્રમાણે ગુરુ અને શિષ્યો શિલોંચ્છવૃત્તિ કરવા માટે વનમાં ગયા ॥ ૧૯ ॥

॥ बटु वनस्पतिर्ध्यात्वा । कामधेनु तथा तथैव ॥
॥ यावदा गच्छते विप्रः । बटुभिः सह मन्दिरं ॥२०॥

તેમના ગયા પછી શ્રી ભગવાન મહાદેવરૂપી બટુકે વનસ્પતિઓ તથા કામધેનુ ગાયનું સ્મરણ કર્યું, એટલે તેમને બોલાવીને કહેવા લાગ્યા કે વનમાં શિષ્યો સાથે ગુરૂજી ગયા છે (ઘેર) આશ્રમમાં આવે ॥ ૨૦ ॥

संसिद्धमन्नं मदाज्ञि कर्तव्यं तावदाश्रमे ॥

ત્યાં સુધીમાં તારે મારી આજ્ઞાથી આ આશ્રમમાં રસોઈ તઈયાર કરી રાખવી આ પ્રમાણે કહીને

॥श्री मार्कंडेय उवाच ॥ શ્રી માર્કંડેયમુનિ કહેવા લાગ્યા કે:-

॥ एवमुक्त्वा स तान्सर्वान । बटुरूपो महेश्वरः ॥
॥ तदानीमेव ते यत्र । तत्रयातोनु लीलया ॥२१॥

આ પ્રમાણે તમામને કહીને બટુકરૂપી શ્રી ભગવાન મહાદેવ તેજ વખતે ત્યાંથી પોતાની લીલા બતાવવા માટે જ્યાં ગુરૂ તથા શિષ્યો ગયા છે ત્યાં તેમની પાછળ પોતે ગયા. ॥૨૧॥

॥ धिक्कृतो बटुभिस्तैस्तः । ततो वै गुरु सन्निधौ ॥

એટલે પેલા બધા બટુકો તેમને ધિક્કારવા લાગ્યા અને પોતાના ગુરૂ વિષ્ણુશર્મા પાસે જઇને

॥ बटव उचुः ॥ બટુકો કહેવા લાગ્યા કેઃ-

॥ क्षुत्क्षाम कंठा सर्वेस्म । इतोगत्वा स्वमाश्रमम् ॥

॥ त्वायसिध्धेनचान्नेन । तृप्तिं यास्याम चेयतः ॥२२॥

આપણે બધા ભૂખ્યા તરસ્યા થયેલા છીએ તે અહિંયાંથી ઘેર જઇને તૈયાર બનાવેલી રસોઈ જમીને શાંત અને તૃપ્ત થઈશું એવી અમે આશા રાખી હતી ॥ ૨૨ ॥

॥ तद्वृता चिन्तितं सर्वं । त्वया गत्य कृतं हिनः ॥

॥ मिथ्या प्रतिज्ञा मूढेन । दुर नुष्ठित मद्यते ॥२३॥

પણ તેં બધા વિચારો તેં અહિં આવીને નાશ કર્યા અને અમારૂં તેં ઉલટું ખોટું કર્યું. તારા જેવા મિથ્યા પ્રતિજ્ઞ મૂઢ માણસ કોણ હોય જે આવું અસત્ય આચરણ કરે. આ પ્રમાણે કહ્યું એટલે ॥ ૨૩ ॥

॥ श्री बटुक उवाच ॥ શ્રી બટુકરૂપી મહાદેવ કહેવા લાગ્યા કેઃ—

॥ ईर्ष्यांवाप्यनु नापंवा । भोजानार्थेद्विजर्षभाः ॥

॥ माकुरुध्वं यथान्यायं । सिध्धेऽन्नं गृहमेष्यथ ॥२४॥

હે બ્રહ્મણ બાળકો તમે બધા મારી ઉપર ભોજનને માટે ક્રોધ તનજ ખોટી ઇર્ષ્યા ન કરો કારણ કે મેં તમારા કહેવા મુજબ મારા વારા પ્રમાણે આજે રસોઇ તૈયાર કરી છે માટે તમે બધા ઘેર ચાલો આ પ્રમાણે કહ્યું એટલે ॥૨૪॥

॥ बटवः उचुः ॥ બટુકો કહેવા લાગ્યા કેઃ—

॥ असिध्धे सिद्ध मस्मकं । यत्त्वया समुदाहृतं ॥

॥ गतैस्तत्रानृतं द्रष्टवा । बद्ध्वा क्षेप्यस्त्वमंमसि ॥२५॥

તેં રસોઈ તૈયાર કરી નથી અને તું અમને કહે છે કે મેં તૈયાર કરી છે તો ઘેર જઈ અને જો ત્યાં રસોઈ તૈયાર નહી જોવામાં આવે તો અમે તને ચુડેઃ જાણી બાંધીને પાણીમાં ફેંકી દઈશું. આ પ્રમાણે કહ્યું એટલે ॥૨૫॥

॥ बटुरुवाच ॥. શ્રી ભગવાન મહાદેવ રૂપી બટુક કહેવા લાગ્યા કેઃ---

॥ शृणुध्वंभो द्विजगणाः सोपाध्यायाद्विजर्षभाः ॥
॥ प्रतिज्ञां मम दुर्धर्षां । यां श्रुत्वा विस्मयो भवेत ॥२६॥

હે દ્વિજ શ્રેષ્ઠો તમે બધા ગુરૂની સાથે હું અહીં એક પ્રતિજ્ઞા કરૂં છું તે તમે સાંભળો. કે જે પ્રતિજ્ઞા મારી કર્યા પછીથી ફરી શકે નહિ એવી કઠણ છે અને તમને સાંભળવા માત્રથી આશ્ચર્ય ઉત્પન્ન થશે એવી છે ॥ ૨૬ ॥

॥ यदि सत्य मिदं सर्वं । यदुक्तं भवतां मया ॥
॥ यूयं बध्वाततः सर्वे । क्षेप्तव्या नर्मदा जले ॥२७॥

માટે જો તમે મને કહ્યું કે તને અમે બાંધીને પાણીમાં નાખી દઈશું એ વાત સાચી હોય તો હું પણ તમને કહું છું કે મેં જે કહ્યું તે જો સત્ય હોય તો હું તમને બધાને બાંધીને નર્મદાજીના પાણીમાં ફેંકી દઉં. ॥ ૨૭ ॥

॥ पश्चाच्च त्वमुपाध्याय । बद्धानां क्षीरसां हृदे ॥
॥ गतानामाश्रमे साक्षी । सर्वांते वासिनां द्विजः ॥२८॥

માટે હે ગુરૂ અમે બધા તમારી પાછળ અનુસરનાર હોવાથી આપણું આશ્રમમાં જઈશું તો અમારા બંને પક્ષના સાક્ષી તમે છો માટે આજે તમે આ બધાંને બાંધીને પાણીમાં નાખી દીધેલા દેખશો. આ પ્રમાણે કહ્યું ત્યારે ॥ ૨૮ ॥

॥ श्री मार्कंडेय उवाच ॥ શ્રી માર્કંડેયમુનિ કહેવા લાગ્યા કેઃ—

॥ तथेति कृत्वा ते सर्वे । समयं गुरु सन्निधौ ॥
॥ स्नात्वा जप्त्वा विधानेन । भूति ग्रामं ततो ययुः ॥२९॥

આ પ્રમાણે અરસપરસ ગુરૂની સાનિધ્યમાં પ્રતિજ્ઞા કરીને તે બધા વનમાંથી નર્મદાજીના કિનારા ઉપર આવી સ્નાન, સંધ્યા, પુજા, જપ, વિગેરે કરી પોતાના નિવાસસ્થાન-રૂપ ભૂતિ ગ્રામમાં આવ્યા. ॥ ૨૯ ॥

॥ दृष्ट्वा ते विस्मयं जग्मु । विस्तृते भक्ष्य भोजने ॥
॥ षट्र स्नान्नेन ते राजन । जुहुवुः बुभुजुः पृथक् ॥३०॥

પોતાના આશ્રમમાં આવીને જોયું તો હે રાજન ષટરસ ભોજન તૈયાર બનાવીને ત્યાં પાથરેલાં હતાં તે જોઇને બધા આશ્ચર્ય પામી ગયા, પછીથી તેમણે નિત્ય નૈમિત્તિક વૈશ્વદેવાદિક, હોમ. વિગેરે કરીને બધા જમવા લાગ્યા ॥ ૩૦ ॥

॥ तुष्टः प्रोवाच वचनं । उपाध्यायस्ततो मुदा ॥

જમવાથી સંતુષ્ટ થયેલા ગુરૂ મહાન આનંદમાં આવી કહેવા લાગ્યા.

॥ श्री अध्यापक उवाच ॥ ગુરૂ બટુકને કહે છે કેઃ—

॥ वरदोऽस्मि वत्सवत्स । शृणु यस्तव रोचते ॥
॥ सांगोपांगा स्नुते वेदाः । शास्त्राणि विविधानिच ॥३१॥

હે વત્સ હું તારા ઉપર પ્રસન્ન થયો છું માટે તને વરદાન આપું છું કે જે વરદાન તારી ઇચ્છા પરિપૂર્ણ કરે એવું છે. તો તને વેદો તથા ઉપવેદો અને અનેક પ્રકારનાં

શાસ્ત્રો બધા પ્રકારની તમામ વિદ્યા મારા વરદાનથી તને પ્રાપ્ત થાઓ. આ પ્રમાણે ગુરૂએ કહ્યું એટલે ॥ ૩૧ ॥

॥ श्री मार्कंडेय उवाच ॥ શ્રી માર્કંડેય મુનિ કહેવા લાગ્યા કેઃ—

॥ एवमुक्तः सगुरूणा । तैश्चिक्रीडु यथासुखम ॥
॥ द्वितियेच ततः प्राप्ते । दिवसे नर्मदा जले ॥ ३२ ॥

કે આ પ્રમાણે ગુરૂની પાસેથી વરદાન પ્રાપ્ત કરી તે બધાઓની સાથે તે દીવસ આનંદમાં નિર્ગમન કર્યો પછીથી બીજે દીવસે સવાર થયું એટલે નર્મદાજીના કિનારા ઉપર સ્નાન કરવા માટે બધા ગયા.

॥ क्रीडनार्थं गताः सर्वे । सोपाध्याया युधिष्ठिर ॥
॥ ततः स्मृत्वा पणंतस्य । समाभाष्य परस्परम् ॥३३॥

હે યુધિષ્ટિર નર્મદા જળમાં રમત કરવા માટે ગુરૂની સાથે બધા વિદ્યાર્થીઓ ઉતરેલા છે ત્યાં રમત કરતાં કરતાં અરસપરસ પેલા બટુકે ગઈ કાલની વાત કરી કે મેં કાલે જે તમારે માટે પ્રતિજ્ઞા કરેલી છે તેની બધાંને યાદ લાવીને ॥ ૩૩ ॥

॥ भारं यबंध सर्वेषां । बटुनां वल्हि दामभिः ॥
॥ शापानुग्रहदृक्ष्ह्येषो । क्षिपत्तोये यथा गृहे ॥३४॥

વેલાની દોરડીઓ બનાવી બધા વિદ્યાર્થીઓનો તેનાથી ભારો બાંધી શાપાનુગ્રહ કરવાની શક્તિ છે જેનામાં એવા ભગવાન મહાદેવરૂપી બટુકે તે વિદ્યાર્થીઓના ભારાને પાણીમાં ફેંકી દીધો. જેમ કોઈ વસ્તુ ઘરમાં ફેંકી હોય તેમ નિઃશંક-પણાથી ફેંકી દીધો. ॥ ૩૪ ॥

॥ जले क्षिप्तान बटून दृष्ट्वा । विषण्णेन ततो नृप ॥
॥ बटुः सगुरूणा प्रोक्तो । हा किंते साहसं कृतम् ॥३५॥

આ પ્રમાણે બધા બટુકોને પાણીમાં નાખીને નિશ્ચિંત થઈને ઉભેલા તે બટુકને જોઈને હે રાજા ! તે વિષ્ણુશર્મા ગુરૂએ મહાદેવરૂપી બટુકને કહ્યું કે હે બટુક આ તેં કેટલું સાહસ કર્મ કર્યું. વળી ॥ ૩૫ ॥

॥ एतेषां पितरो मूढ । शिष्याणां ग्रह मागताः ॥
॥ यदि इक्षंति ते पुत्रान । वक्ष्यामि क्व गतानिह ॥३६॥

હે મૂર્ખ આ બધા શિષ્યોના માતા પિતાઓ મારે ઘેર આવીને જોશે, તો હું એમને ક્યાંથી બતાવીશ. તેમજ પુછશે કે ક્યાં ગયા છે, તો હું શું કહીશ. ॥ ૩૬ ॥

॥ एवं सति महा महाभारे । यदि कश्चिन्मरिष्यति ॥
॥ तदा स्वकिय जीवेन । किं जीवयितु मर्हति ॥३७॥

અને એમ છતાં બહુજ ભારને લીધે કદાચ પાણીમાં કોઈ મરી જશે તો હું પણ મારા જીવનને હવે જીવવાની ઈચ્છા રાખતો નથી. કારણ કે, એવું નિંદિત જીવન જીવ્યાથી મને લાભ શું છે. ॥ ૩૭ ॥

॥ ब्रह्म हत्याश्च ते बह्वः । भविष्यति मृतेमयि ॥
॥ द्विज बंधन मात्रेण । नरके पतनं ध्रुवम् ॥३८॥

અને મારા મરી ગયા પછીથી તને બહુજ બ્રહ્મહત્યાઓનું પાપ લાગશે કારણકે બ્રાહ્મણને બાંધવા માત્રથી માણસ નર્કમાં નક્કી જાય છે તો આ તેં અનેક બ્રહ્મહત્યાઓ કરી છે. તો તેનાથી તું ક્યાં છુટીશ. ॥ ૩૮ ॥

॥ प्रापिते मरणावस्थां । तत्र न ज्ञायते गतिः ॥
॥ मनसापि द्विजे हिंसा । यश्चिंतयति मूढधीः ॥ ३९ ॥

અને તું મરી જઈશ ત્યારે તારી શું ગતિ થશે તે કહી શકાય એમ નથી કારણ કે જે મુંઢ બુદ્ધિવાળો માણસ મનથી પણ જે બ્રાહ્મણને મારવાનો વિચાર કરે છે ॥૩૯॥

॥ तस्यापि ब्रह्महत्यास्यात् । किमुताधिक कारिणः ॥

તેને પણ બ્રહ્મહત્યા લાગે છે તો આતો તેં જાતે બ્રહ્મહત્યાઓ કરી છે આથી અધિક બીજું કયું પાપ હોઈ શકે આ પ્રમાણે ગુરૂએ કહ્યું ત્યારે

॥ श्रीमार्कंडेय उवाच ॥ શ્રી માર્કંડેય મુનિ કહેવા લાગ્યા કે

॥ एवमुक्तस्तु विप्रेण । उज्जहार वटुन जलात् ॥
॥ भारंमुक्त्वा गुरोरग्रे । छादयामास तान्द्विजान ॥४०॥

આ પ્રમાણે વિષ્ણુશર્મા બ્રાહ્મણે બટુકને કઠોર વચન કહ્યું એટલે શ્રીભગવાન મહાદેવે પાણીમાંથી પેલા વિદ્યાર્થિઓના ભારાને બહાર કાઢીને પોતાના ગુરૂ આગળ લાવી મુકયો. અને તે ભારાને પોતાના વસ્ત્રથી ઢાંકવા લાગ્યા. ॥૪૦॥

॥ स्ववस्त्रेण नृप श्रेष्ट । तस्थौ प्रांजलि रग्रतः ॥

હાથ જોડીને હે રાજન્ પોતાના ગુરૂની આગળ ઉભા રહ્યા

॥ मुंच सर्वान पृथक्कृत्वा । यदि जीवति सत्वरम ॥
॥ पणानृण्य गतास्सर्वे । हष्टस्वांते च वै बटो ॥४१॥

ત્યારે ગુરૂ કહેવા લાગ્યા કે હે બટુક આ બધા પોતાની પ્રતિજ્ઞા પાળવાને માટે મરવા તૈયાર થયેલા એવા તેમને હવે

તું છોડ અને બધાને છુટા પાડીને મુક કારણ કે કદાચ કોઇ, એમાંથી જીવી જાય તો સારૂ માટે તું ઉતાવળ કર. ॥૪૧॥

॥ उपाध्याय वचः श्रुत्वा । यावद्भाराद् विमुंचति ॥
॥ भारस्थाने महालिंगं । तावदुच्छ्रिते मैश्वरम् ॥४२॥

એવું જ્યાં ગુરૂએ કહ્યું ત્યારે પેલા બટુકે વિદ્યાર્થિઓના ભારાને જ્યાં છોડયો તો જ્યાં ભારો મુકેલો હતો તે ઠેકાણે ઈશ્વરનું શ્રીભગવાન મહાદેવનું મહાન લીંગ પૃથ્વિને ભેદીને નીકળેલું દીઠું. ॥૪૨॥

॥ ददर्शासमृतांस्तांश्च । जिवितान पुरतो गुरूः ॥
॥ स्वरूप धारिणं शंभुं । सायुधं सविभूषणम् ॥४३॥

અને મરણ પામેલા એવા પેલા વિદ્યાર્થીઓ બધા જીવતા થયેલા જોયા. એટલે પોતાની (આગળ) સામે સર્વ જગતનું કલ્યાણ કરનાર એવા જેણે પોતાનાં આયુધ તથા વાહન, અને આ ભૂષણ ધારણ કરેલાં છે. એવા પોતાના મુળસ્વરૂપી ભગવાન શ્રી મહાદેવને જોયા. ॥૪૩॥

॥ ततः सविस्मयाविष्टो । वीक्ष्य सर्वांश्च शिष्यकान ॥
॥ विष्णुशर्मा समुत्थाय । प्रणाममकरोद्भूवि ॥४४॥

તે વખતે વિષ્ણુશર્મા એકદમ આશ્ચર્ય સાથે પોતાના બધા શિષ્યોને જીવતા થયેલા જોઇને શ્રીભગવાન મહાદેવનું સાક્ષાત્ ઈશ્વરસ્વરૂપ જોયું એટલે ઉભા થઇ પૃથ્વી ઉપર પડીને સાષ્ટાંગ નમસ્કાર કર્યા. ॥૪૪॥

॥ श्री विष्णुशर्मोवाच ॥ પછી વિષ્ણુશર્મા કહેવા લાગ્યા.

॥ धन्योऽस्मि कृत पुण्योऽस्मि । किं करोमि तवेश्वर ॥
॥ अज्ञानेन मया तेद्य । यदुक्तं परमेश्वर ॥४५॥

કે હે ઈશ્વર મેં કેટલાંએક પૂર્વે પુન્ય કર્યા હશે ધન્ય છે કે મને આજે આપના કલ્યાણમય સ્વરૂપનાં દર્શન થયાં, માટે હે પ્રભુ આપને માટે હું શું કરૂં કે આજે મેં આપને અનેક કઠોર શબ્દો કહ્યા છે, તે અજ્ઞાનથીજ કહેલા છે. ॥૪૫॥

॥ दुरूक्तंम प्रियं चापि । कृतं तत्क्षंतु मर्हसि ॥

તો મારાથી આપની પાસે જે કંઈ ખોટું ખરૂં થયું હોય તેની મને આપ ક્ષમા આપજો. આ પ્રમાણે વિષ્ણુશર્માએ કહ્યું ત્યારે

॥ श्री महेश्वर उवाच ॥ શ્રી મહાદેવ કહેવા લાગ્યા.

॥ भवान गुरू र्भवान देवो । भवान्पूज्यश्च मे पिता ॥
॥ वेदगर्भ नमस्तेऽस्तु । नास्ति कश्चिद्व्यतिक्रमः ॥४६॥

કે આપ મારા ગુરૂ છો તેથી પિતાતુલ્ય તેમજ દેવ તુલ્ય છો, કારણ કે આપનું શરીર વેદમય છે એવા આપને હું નમસ્કાર કરૂં છું કે આમાં કંઈજ મને ઉલટું લાગે એવું આપે કર્યું નથી, કારણ કે આપણા

॥ जनिता चोपनेताच । यश्च विद्यां प्रयच्छति ॥
॥ अन्नदाता भयत्राता । पंचैते पितरः स्मृताः ॥४७॥

શાસ્ત્રમાં જન્મ આપનાર, ઉપનયન આપનાર, વિદ્યા આપનાર, અન્ન આપનાર, અને ભયથી રક્ષણ કરનાર, આ પાંચ જણને પિતા કહેવામાં આવ્યા છે માટે આપનો કોઈ અપરાધ એવો થએલો નથી કે જેની હું ક્ષમા આપું. ॥૪૭॥

॥ यत्रमे विहितो भारः । सद्वाध्यायि द्विजन्मनां ॥
॥ भारभूतिरिति ख्यातं । तेन तिर्थं भविष्यति ॥४८॥

પરંતુ જ્યાં મેં આ મારા સહાધ્યાયી વિદ્યાર્થીઓને ભારે મુકયો હતો. તે જગ્યા ઉપર આપને મારાં દર્શન થયાં છે આ તિર્થનું નામ આજથી ભારભૂતિ નામનું અહિ નર્મદાજીના ઉત્તર કિનારા ઉપર પ્રખ્યાત થશે. ॥૪૮॥

॥ भारभूतिश्वरं नाम्ना । योमामर्चयिष्यति ॥
॥ लिंगेऽस्मिन्ब्राह्मण श्रेष्ट । भूक्ति मुक्ति स लप्स्यते॥४९॥

અને એ ભારભૂતિ તિર્થમાં આવીને જે માણસ ભારભૂતિશ્વરના નામથી અમારા લિંગની શ્રદ્ધા, ભક્તિથી પુજા કરશે તો તે મનુષ્યને હે બ્રાહ્મણશ્રેષ્ઠ લાભ અને મોક્ષ બંને પ્રાપ્ત થશે ॥૪૯॥

॥ एवमुक्त्वा तदापार्थं । विष्णुशर्माणं मिश्वरः ॥
॥ तिर्थे समापृच्छयात्मानं । द्विजानंतर्दधे स्वयम ॥५०॥

આ પ્રમાણે કહીને વિષ્ણુશર્મા તથા બ્રાહ્મણોને કહીને હે પાર્થ શ્રી ભગવાન મહાદેવને તિર્થમાં પોતાના મુળ સ્વરૂપ સાથી લીંગમાં અંતર્ધ્યાન થઈ ગયા. ॥૫૦॥

॥ श्री मार्कंडेय उवाच ॥ ત્યારે માર્કંડેય મુનિ કહેવા લાગ્યા કે

॥ तदा प्रभृति तत्तिर्थं । भारभूतिश्वरं मतम् ॥
॥ विख्यातं सर्व लोकेषु । महा पातक नाशनम् ॥५१॥

ત્યારથી એ તીર્થ ભારભૂતિશ્વરના નામથી સર્વ લોકમાં પ્રખ્યાત થયું કે જે તિર્થનું સેવન કરવાથી ગમે તેવાં મહાન પાપો હોય તો તે પણ નાશ પામે છે. ॥૫૧॥

॥ ब्राह्मणा विस्मिताः सर्वे । विष्णुशर्मा पुरोगमाः ॥
॥ पुजयां चक्रिरे देवं । तत्र तिर्थे युधिष्ठिर ॥५२॥

આ બધી શ્રી ભગવાન મહાદેવની લીલા જોઈ અને તેમના મુખારવીંદથી તીર્થનું માહાત્મ્ય વિષ્ણુશર્મા ને આદિ લઇ બધા બ્રાહ્મણો સાંભળીને આશ્ચર્ય પામ્યા. પછીથી તેમણે તે તિર્થમાંહે યુધિષ્ઠિર સ્નાન કરી દેવાધિદેવ શ્રીભારભૂતિશ્વર નું પૂજન કર્યું. ॥૫૨॥

॥ तत्र तिर्थे पुनर्वृत्तामितिहासं पुरातनम् ॥
॥ समा हि तमना पार्थ । शृणु तत्पाप नाशनम् ॥५३॥

હવે હે પાર્થ આ તિર્થમાં બીજો એક પુરાતન ઇતિહાસ બનેલો છે તે હું તને કહું છું કે તે તું સાવધાન ચિત્તથી સભળ કે જેના સાંભળવા માત્રથી પ્રાણી માત્રના પાપનો નાશ થાય છે. ॥૫૩॥

॥ पुरा कृतयुगस्यादौ । वैश्यः कश्चिन्महाधनः ॥
॥ सुकेश इति विख्यातो । तस्य पुत्रोऽति कश्चिन्महाधनः॥५४

પહેલાં સત્યયુગની આદીમાં કોઈ એક સુકેશ નામનો મહા ધનવાન વાણીઓ હતો તેને એક મહાન ધાર્મિક પુત્ર હતો. ॥૫૪॥

॥ सोमशर्मा इतिख्याती । दाता मति मतांवरः ॥
॥ ससरवाय वणिकपुत्रं कंचित चक्रे तु निर्धनम् ॥५५॥

તેનું નામ સોમશર્મા એવું હતું, તે દાન આપનાર તેમજ બુદ્ધિવાન હતો. તેણે કોઇ એક ગરીબ વાણીઆના પુત્રની સાથે (ભાઇબંધી) મિત્રાચારી કરી હતી. ॥૫૫॥

॥ सहदेवा ह्वयं राजन । सर्व कर्मसु कोविदं ॥
॥ पक दातु समं तेन । व्यवहार मचिंमयत ॥५६॥

હે રાજા તેનું નામ સહદેવ એવું હતું. અને તેનામાં સર્વ જાતની કળાકૌશલ્યતા હતી, એટલે એક દીવસના સમાયોગે સોમશર્મા પોતાના મિત્ર સહદેવની સાથે વેપાર રોજગારની વાતચીત કરવા બેઠા હતા. ॥૫૬॥

॥ वैश्य उवाच ॥ તેમાં સોમશર્મા સહદેવને કહેવા લાગ્યા કે

॥ सरवे समुद्र यानेन । गच्छावो यदि मन्यसे ॥
॥ भांडं बहु समादाय: । मदीय द्रव्य साधने ॥ ५७॥

હે મિત્ર તારૂં મન જો માનતું હોય તો આપણે વહાણમાં અનેક દ્રવ્ય ઉપર્જન કરવાની વસ્તુઓ ભરીને પરદેશ વ્યાપાર કરવા જઈએ, ॥૫૭॥

॥ पर द्विपं गमिष्याव । उत्कर्षश्चावयो: सम: ॥
॥ तथेति तेन चैवोक्तं । मंत्रयित्वा मनोगत ॥५८॥

અને ત્યાં જે વ્યાપારમાંથી નફો મળશે. તેમાં તારો તથા મારો સરખો ભાગ છે આ પ્રમાણે બંનેઉ મિત્રોએ પરસ્પર વિચાર કરી મનની વાત જે હતી તે કહી દીધી.॥૫૮

॥ सर्वे क्रयाणकं निन्त्वा । तावा रूढौ महोदधिं ॥
॥ परं द्विपं तयोर्गत्वा । विक्रिते वसुतत्तदा ॥५९॥

અને વ્યાપાર કરવાની તમામ વસ્તુઓ ભરી વહાણુ સમુદ્રમાં ચાલતું કર્યું. કેટલાએક દિવસે બીજા દેશમાં તેઓ પહોંચ્યા, ત્યાં વ્યાપાર કરવા લાગ્યા. ॥૫૯॥

॥ प्राप्तं बहु सुवर्णं वै । रत्नानि विविधानिच ॥
॥ नावं तां सभृतां कृत्वा तोपश्चाद्दारूरोहतु ॥६०॥

વ્યાપારમાં મળેલા ધનથી સોનું તથા અનેક જાતનાં

રત્નો હીરા, માણેક, મોતી વીગેરે લઇ વહાણુમાં ભરી દીધાં પછીથી બંનેઉ મિત્રો પોતાના દેશમાં પાછા આવવા માટે વહાણમાં બેઠા.

॥ नावमंतर्जले ज्ञात्वा । निशिथे स्वर्ण संभृतां ॥
॥ दृष्टवा तं सोम शर्मणि । उत्संगे कृत मस्तके ॥६१॥

મધ્યરાત્રિનો સમય થએલો છે પોતાના ખોળામાં માથું મુકીને સુતેલો સોમશર્માને જોઇ, વહાણ મધ્ય દરિઆમાં આવેલું છે એટલે આ સહદેવ વીચાર કરવા લાગ્યો કે—

॥ अस्याधीन मिदं सर्वं । द्रव्यजात मशेषतः ॥
॥ उत्कर्षार्धं चमे दद्यात । तत्र गत्वेति वानवा ॥६२॥

આ વહાણુમાંનું ધન બધું તેમજ અમારા પંત્યાળો નફો પણ એના કબજામાં છે તો ઘેર જઇ પછીથી એ મને મારો ભાગ આપે કે ન આપે તો મારે શું કરવું. ॥૬૨॥

॥ इति निश्चित्य मनसा । पापस्तं लवणोदधौ ॥
॥ चिक्षेप सोमशर्माणं । ध्यात्वा पापं हि चेतसा ॥६३॥

એવો મનમાં નિશ્ચય કરી, તે પાપી, એવા સહદેવે, મનમાં પાપ લાવી પોતાના ભાઇબંધ સોમશર્માને ઉંઘતો જાણી ઊંચકીને સમુદ્રમાં નાખી દીધો. ॥૬૩॥

॥ उत्तिर्णस्तरणात्तस्मात् । ततः संगृह्य तद्धनम् ॥
॥ स्वस्थः स्वगृहमागात्स । निःशंकः सुप्रतीकवत॥६४॥

પછી જાણે મેં કંઇપણ પાપ કર્યું નથી એમ નિઃશંક પણે સ્વસ્થચિત્તે વહાણમાંનું ભરેલું જે ધન હતું તે બધું લઇને પોતાને ઘેર આવ્યો. ॥૬૪॥

॥ ततः कतिपयाहोभि : संयुक्तो काल धर्मतः ॥
॥ गतो यमपुरं घोरं । गृहितो यमकिंकरैः ॥६५॥

એમ કરતાં કેટલાક દીવસે તે વાણીઓ મરણ પામ્યો એટલે પોતાના પાપકર્મ વડે કરીને તેને યમરાજના દુતો પકડીને ઘોર એવા જમપૂરમાં લઈ ગયા. ॥૬૫॥

॥ सनीतस्तेन मार्गेण । यत्र संतपते रविः ॥
॥ कृत्वा द्वादशधात्मानं । संप्राप्ते प्रलये यथा ॥६६॥

ત્યાં એ વાણીઆને એવા માર્ગમાં થઈને લઈ જવામાં આવ્યો કે જ્યાં શ્રીભગવાન સૂર્યનારાયણ જગતના પ્રલય સમયે, જેમ પોતાના બાર સ્વરૂપથી તપે છે, તે પ્રમાણે તે માર્ગમાં પણ તપેલા હતા. વળી ॥ ૬૬ ॥

॥ सुतप्ता बालुका यत्र । क्षुधा तृष्णो तमो महत् ॥
॥ यत्र तोय कथा नास्ति । न छाया नाश्रयं क्वचित् ॥६७॥

વળી જે માર્ગમાં રેતી પાથરેલી તે પણ ખુબ તપેલી છે, તેમજ ભૂખ, તરસ, અંધારૂં પણ બહુજ છે, એવા ઉપર નીચેના તાપથી ત્યાં થઇને જનાર માણસને માટે છાયા પણ નથી, તેમજ કોઈ જાતનું બીજું વિશ્રાંતિ લેવાનું સ્થાન નથી તો ત્યાં પાણીની તો વાતજ શી કરવી—વળી ॥ ૬૭ ॥

॥ सुतिक्ष्णा कंटकायत्र । यत्र श्वानाःसु दारूणाः ॥
॥ तिक्ष्ण दंष्ट्रा महा व्यालाः । व्याघ्रा यत्र महावृकाः ॥६८।

જે માર્ગમાં અણીદાર ભાલા જેવા કાંટા તથા મોટી દાઢોવાળા કુતરાઓ તેમજ ભયંકર સાપો અને વાઘ, વિગેરે હતાં. ॥ ૬૮ ॥

॥ अन्नोदकं प्रार्थयता । ज्वलदंगार भक्षणम् ॥

॥ छाया: प्रार्थयितानाना । भृशं तपति भास्करः ॥६९॥

એવા મહાન કઠણ માર્ગમાં થઇને જતાં રસ્તામાં ભુખ, તરસ, લાગે છે ત્યારે તે પ્રાણીને બળતા અંગારા ખાવા માટે આપવામાં આવે છે, તેમજ સુર્યનારાયણના પણ તે જીવ અત્યંત તાપને લીધે અનેક પ્રકારની છાયાને માટે પ્રાર્થના કરે છે. ॥૬૯॥

॥ नेर्दह्यमाना बहुशो । विलपंति मुहूर्मुहूः ॥

॥ हाभ्रातः पुत्रमातेति । पतंति पथि मूर्छिताः ॥७०॥

આ પ્રમાણે અનેક પ્રકારના દુઃખોથી બળી રહેલા તે જીવો વારંવાર હે ભાઇ, હે બાપ, હે મા એમ બોલીનેરડે છે અને રસ્તામાં અંધારાં આવવાથી ઉભાથી નીચે પડે છે. ॥૭૦॥

॥ इत्थं भूते तथा मार्गे । स्नीतो यमकिंकरैः ॥

॥ यत्र तिष्ठति देवेशः । प्राणि संयमनो यम ॥७१॥

આવા માર્ગમાં થઇને પેલા વાણીઆ, સહદેવને યમરાજાના દુતોએ જ્યાં દેવરાજ પ્રાણીમાત્રના શુભાશુભ કર્મના ફળને આપનાર એવા યમરાજા બેઠેલા છે. ત્યાં યમપુરીમાં લઇ ગયા ॥૭૧॥

॥ ते द्वारदेशे संस्थाप्य । निनदुर्यमकिंकराः ॥

તેને યમરાજાની સભાના દ્વાર ઉપર બહાર ઉભો રાખી અંદર જઇ નોકરો કહેવા લાગ્યા

॥ दुत उचुः ॥ દુતો યમરાજાને કહે છે કેઃ—

॥ बध्वा शृंखल पाशेन । आनितो मित्रघातकः ॥

॥ स्थापितो द्वारि लोकेश । विधत्स्व यदनंतरम् ॥७२॥

કે હે મહારાજ અમે આપના હુકમથી પેલા મિત્ર-હત્યા કરનાર વાણીઆને બેડી પાશ વિગેરેથી બાંધીને લાવ્યા છીએ અને તેને બહાર બેસાડેલો છે તો તેને હવે આપ હુકમ કરો તે પ્રમાણે શિક્ષા કરીએ ત્યારે ॥ ૭૨ ॥

॥ यम उवाच ॥ યમરાજા કહેવા લાગ્યા કેઃ—

॥ नैवं पूर्वं विक्षितंमे । मुखं विश्वस्त घातिनाम् ॥
योमित्र द्रोहकः पापो । मानवो मा प्रवेश्यतां ।'७३॥

હે દુતો મેં આજ દીન સુધીમાં કોઇપણ દિવસ વિશ્વાસઘાતીનું મુખ જોયું નથી. તો જેણે વિશ્વાસઘાત તેમજ તેમજ મિત્રદ્રોહ કર્યો છે, એવા એ પાપી વાણીયાને અહીયાં મારી પાસે લાવતાજ નહિ. ॥૭૩॥

॥ ऋषयोऽत्र विचारार्थे । नियुक्ता निपुणाः स्थिता ॥
॥ ते यत्र ब्रुवते तत्र । नियतां मा विचार्यतां ॥७४॥

પરંતુ અહીં આપણી પાસે એવા પાપીઓના પાપની સજાનો નિર્ણય કરવા માટે ડાહ્યા અને વિદ્વાન એવા ઋષિઓ સભામાં બેસાડવાંમાં આવે છે તેમને જઇને પુછો ને તે જે નિર્ણય આપે એને માટે તે પ્રમાણે એને શિક્ષા કરો, જાઓ વિચાર ન કરો. ॥ ૭૪ ॥

॥ इत्युक्तास्ते तमादाय । किंकराः शीघ्रगामिनः ॥
॥ ऋषीन् गत्वा तानूचु । स्तं निवेद्य यमाज्ञया ॥७५॥

આ પ્રમાણે યમરાજાની આજ્ઞા લઇ નીકળેલા તે દુતો ઉતાવળા ઉતાવળા તે મુનિઓ પાસે પેલા પાપી વાણીઆને લઇને આવ્યા ને કહેવા લાગ્યા. ॥ ૭૫ ॥

॥ शृणुध्वं भो ऋषि श्रेष्ठाः । पापिना तेन यत्कृतम् ॥
॥ मित्रो वैश्यस्तु वाणिज्ञा । संसुप्तो निशि घातितः ॥७६॥

હે શ્રેષ્ટ મુનિઓ આ પાપીએ શું પાપ કર્યું છે તે અમે તમને કહીએ છીએ તે આપ સાંભળો, કે આ વાણીઆએ વિશ્વાસથી પોતાનો મિત્ર રાત્રે ઉંઘતો હતો તેને મારી નાખ્યો છે ॥ ૭૬ ॥

॥ धन लोभेन विश्वस्तः । कृतोत्संग शिरा सुचिः ॥
॥ आदिश्यतां गतिस्तस्य । यथा शास्त्रं हिनोद्विज्ञाः ॥७७॥

કારણ કે ધનના લોભથી, પવિત્ર હૃદયથી, પોતાના ખોળામાં માથું મુકીને ઉંઘતો હતો તેને એણે માર્યો છે. માટે હવે એ મિત્રદ્રોહી તથા વિશ્વાસઘાતીને માટે જે શાસ્ત્રમાં ગતિ કહી હોય તે આપ વિચાર કરીને અમને કહો. ત્યારે ॥ ૭૭ ॥

॥ ऋषय उचुः મુનિઓ કહેવા લાગ્યા કે:—

॥ अदृष्ट पूर्व मस्माकं । मुखं विश्वस्त घातिनां ॥
॥ मित्र द्रोह कृतां दुताः । कृतघ्नानां विशेषतः ॥७८॥

હે દુતો આજ દીન સુધીમાં કાઇ દીવસ અમે ઘણું કરીને વિશ્વાસઘાતિ તથા મિત્રદ્રોહી અને કૃતઘ્નો માણસનું મુખ જોયું નથી. ॥ ૭૮ ॥

॥ कृत्वा पद्यांतरैहीनं । शृण्वंत्वस्य यथागतिः ॥

માટે એને અહીંથી છેટો રાખો પછીથી અમે તમને એની જે ગતિ થતી હશે તે કહીએ છીએ તે તમે સાંભળો.

॥ श्री मार्कंडेय उवाच ॥ ત્યારે શ્રી માર્કંડેય મુનિ કહેવા લાગ્યા કે—

॥ अन्वेषितानि शास्त्राणि । वेदाः सांगाःस्मृतिस्तथा ॥
॥ पुराणानिच मीमांसा । सर्वशश्च विचारिता ॥७९॥

તે મુનિઓએ પછીથી પેલા પાપીને તેના કરેલા પાપનો નીર્ણય આપવા માટે છ શાસ્ત્ર, ચાર વેદ, છ વેદના અંગો, અઢાર સ્મૃતિઓ, અષ્ટાદશ પુરાણો તેમજ પૂર્વોત્તર મીમાંસા વીગેરે ધર્મશાસ્ત્રના ગ્રંથો બધા જોઈ વારંવાર વીચાર કર્યા. ॥ ૭૯ ॥

॥ ब्रह्मघ्नेच सुरापेच । स्तेये गुर्वंगनागमे ॥
॥ निष्कृतिर्विहिता शास्त्रे । कृतघ्ने नास्ति निष्कृतिः ॥८०॥

છતાં તેમાં બ્રહ્મહત્યા કરનાર, દારૂ પીનાર, ચોરી કરનાર અને પોતાના ગુરૂની સ્ત્રીનું ગમન કરનાર એને માટે શું શિક્ષા કરવી તેનો નિર્ણય લખેલો જોવામા આવ્યો પણ કૃતઘ્નીનો નિર્ણય શું કરવો તે કંઇ લખેલું જોવામાં આવ્યું નહિ. વળી ॥ ૮૦ ॥

सर्व पाप रतानांच । दुर्वत्ताभक्ष भक्षिणां ॥
काप्युक्ता निष्कृतिः शास्त्रे । ननु विश्वस्त घातिनाम् ॥८१॥

ગમે તેવાં નાનાં મોટાં પાપો તથા અભક્ષ્ય ભક્ષણ દુરાચાર વીગેરેના નીર્ણયો શાસ્ત્રમાં લખવામાં આવ્યા છે પણ વિશ્વાસઘાતીને માટે શું કરવું તે લખ્યું કેમ નથી. ॥ ૮૧ ॥

मित्र द्रोग्धा कृतघ्नश्च । यश्च विश्वास घातकः ॥
त्रयस्ते नरकं यान्ति । यावच्चंद्र दिवाकरो ॥८२॥

પણ મીત્રદ્રોહી, પોતાની ઉપર ઉપકાર કરનારનો અપકાર કરનાર, કૃતઘ્ની તથા વિશ્વાસઘાતી આ ત્રણે જ્યાં સુધી ચંદ્ર સૂર્ય છે ત્યાં સુધી નર્કના અધિકારી છે. ॥ ૮૨ ॥

वापि कूप तडागादि । भेत्तारो येच मानवाः ॥
उद्यान वाटिकादिनां । तरूणां छेद कारकाः ॥८३॥

તેમજ વાવ કુવા તળાવને તોડી નાખનાર, તેમજ વાડી બગીચાના ઝાડોને ઉખેડી નાખનાર, અથવા કાપી નાખનાર હોય, વળી ॥ ૮૩ ॥

दावाग्नि दाहकायेच । सततं प्राणि हिंसकाः ॥
न्यासापहारिणो येच । गरदाः स्वामिवंचकाः ॥८४॥

વનમાં અગ્નિ મુકનાર, હંમેશાં પ્રાણીઓને મારનાર, આપેલું પાછું લઈ લેનાર, તેમજ પોતાના માલીકને ઠગનાર, અને બીજાને ઝેર આપનાર, વળી ॥ ૮૪ ॥

मातृपितृ गुरूणांच्च । त्यागिनो दोष दायिन
बालघ्नीच पतिघ्नीच्च । गर्भघ्नी कुलटाच्चया ॥८५॥

માતા પિતા ગુરૂ વિગેરેનો ત્યાગ કરનાર, તેમજ તેમને દોષ આપનાર હોય. વળી સ્ત્રી થઈને જેણે બાળહત્યા કરી હોય, પતિને માર્યો હોય, ગર્ભપાત કર્યો હોય, કે વેશ્યા થઈને ફરતી હોય. અથવા તો ॥ ૮૫ ॥

विवेक रहिता या स्त्री । या स्नात्वा न पतिं व्रजेत ॥
सिद्धान्नंवा स्वयं भुंक्ते । त्यक्त्वा देवान पितृन पतिं ॥८६॥

વિવેક વિનાની અર્થાત મર્યાદા રહીત જે સ્ત્રી હોય તથા રજસ્વલા થઈને ચોથે દિવસે સ્નાન કરીને જે પોતાના પતિ પાસે ન જતી હોય વળી રસોઈ બનાવી દેવોને નૈવેદ્ય ધરાવ્યા વિના તેમજ પિતૃઓને ગ્રાસ આપ્યા વિના અને પતિને જમાડયા વિના હંમેશાં પોતે પહેલી જમી લેતી હોય તો ॥૮૬॥

एतेषांतुगति र्द्दृष्टा । नतु विश्वस्त घातिनाम ॥
इति स्थितेषु पापेषु । गतिरेवं विधियते ॥८७॥

એવી સ્ત્રીઓના પાપને માટે શાસ્ત્રમાં નિર્ણય લખેલો છે પણ વિશ્વાસઘાતિને માટે તો ઉપર કહી ગયા તેજ નિર્ણય શાસ્ત્રમાં કરવામાં આવેલો છે. ॥ ૮૭ ॥

नान्यागति र्मित्रहणे । विश्वस्तेऽपिहि निश्चितं ॥

કારણ કે વિશ્વાસઘાતિ હોય તેમજ મિત્રદ્રોહી હોય એ બંનેની એકજ સ્થિતિ હોય છે.

ऋषय उचुः ॥ એટલે આવા પ્રકારના ધર્મશાસ્ત્રના અનેક નિર્ણયો અનેક પાપોને માટે વિચાર કરી મુનિ લોકો યમરાજાના દુતોને કહેવા લાગ્યા કેઃ—

यमदुता इतोगत्वा । एनं विश्वस्त घातिनम् ॥
कल्पकोटि शतं स्नाप्यं । पर्यायेण पृथक् पृथक् ॥८८॥

હે યમદુતો તમે આ વિશ્વાસઘાતિ મહાપાપી વાણીઆને અનુક્રમે જુદા જુદા નર્કોમાં કરોડો કલ્પો, તેમજ કરોડો વર્ષ સુધી અહીંથી જઈને એના કરેલા પાપની શીક્ષાને માટે એને અનુક્રમે ભોગવાવો આ પ્રમાણે પેલા મુનિઓએ કહ્યું ॥૮૮॥

ત્યારે श्री मार्कंडेय उवाच ॥ શ્રી માર્કંડેય મુનિ કહે છે કેઃ-

त्रिंशत् कोटि प्रसंख्येषु । नरकेषु स्वकर्मतः ॥
क्षिप्यतामेष मित्रघ्नो । न विचारोऽत्र कश्चन ॥८९॥

આ મિત્ર હત્યા કરનાર વાણીઆને (૩૦) ત્રીસ કરોડ નર્કકુંડો અનુક્રમે ભોગવવા માટે લઈ જાઓ અને તેમાં એને નાખો. ત્યારે ॥ ૮૯ ॥

श्री मार्कंडेय उवाच ॥ માર્કંડેય મુનિ કહે છે કેઃ-

इति ते वचनं श्रुत्वा । किंकरा ऋषि भाषितम् ॥
निगृह्य नरकान घोरान् । प्रतिक्षेप्तुं गताहिते ॥९०॥

આ પ્રમાણે મુનિઓનું વચન સાંભળીને તે યમનાદુતો તેને ઘોર નરકમાં નાખવા માટે લઈ ગયા ॥ ૯૦ ॥

ते तत्रादौहि नरके । घोरे रौरव संज्ञिते ॥
चिक्षिप स्तत्र पापिष्टं । क्षिप्ते रावो भवन्महान् ॥९१॥

તેમાં પહેલો રૈરવ નામના ઘોર નર્કમાં તેને જ્યાં નાખવામાં આવ્યો ત્યારે તે નર્કમાં રહેનાર પ્રાણીઓનો મહાન ભયંકર ભીષણવાળો હાહાકાર શબ્દ થયો ॥ ૯૧ ॥

प्राणिनां नरकस्थानां । मेन मुंचन्तु भाषितां ॥
अस्य सदर्शनादेव । पीडा शतगुणाहिनः ॥९२॥

અને તેઓ નર્કના જીવો યમદુતોને કહેવા લાગ્યા કે હે દુતો એને અમારા રહેવાના નર્કમાં ન નાખો કારણકે એને તમે જ્યારથી અહીં લાવ્યા અને એનાં દર્શન અમને થયાં ત્યારથી અમારા શરીરમાં સોગણી પીડા વધી ગઇ છે અને ॥૯૨ ॥

यथो ल्युकैः प्रदिप्तेश्च । समृध्यै देहातामिह ॥
यावत्सं दर्शनादस्य । तुंडस्यैव फलं महत् ॥९३॥

અમને જેમ બળતા અગ્નિની જવાળાઓ પેઠે અમારા શરીરને એ બાળી મુકે છે આ બધું દુઃખ જ્યારથી એનું મુખ અમે જોયું છે. ત્યારથી અમને પ્રાપ્ત થયું છે એ એના મુખ જોવાનું ફળ છે. ॥ ૯૩ ॥

॥ यथा कुजन संगत्या । सुजनो याति दुर्गतिं ॥
॥ संनिधानं तथा स्माकं । क्षते क्षारा वसेचनम् ॥९४॥

જેમ દુર્જનની સંગતિથી સજ્જન પણ દુર્જન બને છે તે પ્રમાણે આ મહાન પાપીની સંગતિથી અમારે પણ ઘણુંજ દુઃખ ભોગવવું પડશે જેમ કોઈ જગ્યાએ વાગેલું હોય ને તેમાં ક્ષાર પડવાથી વિશેષ દુઃખ થાય છે તેમ આ અમને એ પાપથી દુઃખ થશે. ॥ ૯૪ ॥

॥ प्रसादः क्रियता माशु । पापोऽन्यत्राति वर्त्यताम् ॥
॥ नरकाः संति बहवः । कथमेकोऽस्ति रौरवः ॥९५॥

માટે અમારી ઉપર દયા કરીને, આ પાપીને બીજા કોઈ નર્કમાં લઈ જાઓ, ઉતાવળ કરો કારણકે ક્યાં આ એકજ રૌરવ નર્ક એકલો થોડો છે, અહીં જમપુરીમાં ક્યાં નર્કની ખોટ છે બીજા ઘણા નરકો છે તો એને તેમાં લઈ જઈને નાખો. ॥૯૫॥

॥ एवमुक्तस्त तस्तैस्ते । गताश्चैवा शुचिं प्रति ॥
॥ तत्रापि नारकाः सर्वे । पूर्ववत्ते विचुकुशुः ॥९६॥

આ પ્રમાણે યમદુતોને રૌરવ નર્કમાં રહેનારા જીવોએ કહ્યું એટલે તે લોકો તે વાણીઆને લઇને બીજો અશુચી નામનો નર્ક હતો ત્યાં ગયા તો ત્યાં પણ પહેલાંની પેઠે તે નર્કમાં રહેનારા જીવો તેને જોઇને હાહાકાર કરી રહ્યા. ત્યાર પછી ॥૯૬॥

॥ एवं ते किंकराः सर्वान् । तं नित्वा नरकान्नृप ॥
॥ पर्यटंतो विषण्णा वै । किं कार्यमिति चाब्रुवन् ॥९७॥

હે રાજન્. તે દુતો બધા નરકોમાં નાખવા માટે તેને લઇને ગયા. પણ તે મહાપાપી વાણીઆને કોઈ પણ નર્કમાં

જગ્યા મળી શકી નહિ. ત્યારે ખેદ કરતા તે કહેવા લાગ્યા કે હવે આપણે શું કરવું. કારણ કે ॥૯૭॥

॥ नरकेऽपि स्थिति र्नास्ति । पापिनोस्याद्य दुर्मतेः ॥
॥ ततो निगृह्य तं जग्मुः । किंकरा यम संनिधौः ॥९८॥

આ પાપીને માટે નર્કમાં પણ વાસ નથી એટલે ફરી પાછા તેને લઇને યમરાજાની પાસે ગયા ॥૯૮॥

गत्वा निवेदयामाशु । यद्वृत्तं नारकेस्सह ॥
॥ किं तस्य वद कर्तव्यं । नरके यस्यनो स्थितिः ॥९९॥

ત્યાં જઇને બધા નરકના જીવોની સાથે બનેલી બીના કહી. અને કહેવા લાગ્યા કે હે યમરાજ હવે આને શું કરવું છે કારણ કે આને માટે તો નરકોમાં પણ જગ્યા. નથી. ॥૯૯॥

॥ यम उवाच ॥ ત્યારે યમરાજા કહેવા લાગ્યા કે—

॥ तथा त्वशेष नरकान । भुक्त्वा काले यथोचितम् ॥
॥ योनिंयात्वेष पापिष्टः । तैर्यंचीं पाप संवृतां ॥१००॥

બાકી રહેલા બધા નરકો એને ભોગવાવી પછી એટલી પાપથી ભરેલી એવી પશુ પક્ષી વીગેરેની યોનીમાં એનો જન્મ આપો. ॥૧૦૦॥

॥ कालं ऋषिभिरूद्दिष्टे । मात्रं पापः प्रवेश्यतां ॥
॥ एवमुक्ते च वचने । प्रजा संयमनेनतु ॥१०१॥

અને એ પાપી જે યોનિમાં જાય અને તે કેટલો ટાઇમ ત્યાં રહે તે તમે ઋષિઓને પુછો એટલે તેઓ તમને કહેશે. આ પ્રમાણે પ્રજાને નિયમમાં રાખનાર યમરાજાએ કહ્યું ॥૧૦૧॥

॥ चक्रुर्यथोक्तं ते दुताः निन्युस्तेनरकानपृथक्‌ ॥
॥ ततो नीतः स कृमितां । विष्टासु बहुधा नृपा ॥१०२॥

એટલે હે રાજન તે દુતો બાકી રહેલા બધા જુદા જુદા નરકો ભોગવાવી તેને વિષ્ટામાં અનેક પ્રકારના કીડા થાય છે તેમાં તેનો જન્મ આપ્યો. ॥૧૦૨॥

॥ ततश्च दंश मशक । मंकोटक पिपिलिका ॥
॥ यूका मत्कुण बिड्भक्षः । शृगृंगाला हि पत्रिणं ॥१०३॥

ત્યારપછીથી મચ્છર, માંખ, મંકોડા, કીડી, જુ, માંકડ, ચાંચડ, વિષ્ટા ભક્ષ કરનાર, કીડા વિગેરે યોનિમાં આપ્યો. પછીથી કુતરાં, શિઆળ, વીગેરે યોનિમાં તેને જન્મ આપ્યો.

॥ मक्षिका शरठानां । गृह गोधा निवासिनां ॥
॥ काक मर्कट गृध्राणां । वृक वृश्चिक सौकरीं ॥१०४॥

અને પછીથી કરોળિઆ, કાંચીડા, કાગડો. ગીધ, કરચલો, વીંછી, અને વાંદર, ભૂંડ વીગેરે યોનિઓમાં અનુક્રમે ગયો. ॥૧૦૪॥

॥ खराश्वश्च जगरादिनां । योनिं पापः क्रमादगतः ॥
॥ एताश्चान्याश्च बह्व्यो वे । योनिः स्थावर जंगमाः॥१०५॥

આ પ્રમાણે અનુક્રમ સ્થાવર જંગમમાં આવેલી, ગધેડો ઘોડો, અજગર, વિગેરે યોનિઓમાં પણ તેને જન્મ આપ્યો. ॥૧૦૫॥

॥ पशुं योनिं ततोलब्ध्वा । गवां योनि मवाप्तवान ॥
॥ सतां योनि मनु प्राप्तो । धुर्यो भूद्भारवाहकः ॥१०६॥

જ્યારે તે પશુ યોનિમાં આવ્યો ત્યારે ગાયની યોનિમાં મહાન ભારને વહેનાર એવો બળદ તે વાણીઓ થયો. ॥૧૦૬॥

॥ गृहेतु पार्थि वेशस्य । धार्मिकस्य यशस्विनः ॥
॥ एकदा सनृपः प्राप्तां । मत्वा वै कार्तिकीं शुभां ॥१०७॥

તેમાં તે કોઈએક ધાર્મિક અને મહાન યશસ્વી એવા રાજાને ત્યાં બળદ થઈને જન્મ્યો હતો. હવે તેમાં એક વખતના સમાયોગે, રાજાએ વીચાર કર્યો કે આ મહાન સુંદર પર્વરૂપી કાર્તિક સુદી પૂર્ણિમા આવેલી છે એટલે ॥૧૦૭

॥ पुरोहित मथाहुय । ब्राह्मणांश्च शुभान बहुन् ॥

પોતાના ગોર તથા બીજા સારા કેટલાએક બ્રાહ્મણોને બોલાવીને

॥ राजा उवाच ॥ રાજા તેમને કહેવા લાગ્યા કે—

॥ न गृहे कार्तिकीं कुर्यादि । तिमे बहुशः श्रुतम् ॥
॥ समेता स्तत्र गच्छामो । इति ब्रूत द्विजर्षभाः ॥१०८॥

હે મુનિઓ એવું મેં ઘણાએક માણસોના મુખથી સાંભળ્યું છે, કે ઘેર કોઈ દિવસ કાર્તિક પૂનેમ કરવી નહિ તો આપણે બધા એકઠા થઈ ક્યાં જઈએ, એવું જો કોઈ તીર્થ હોય તે તમે મને કહો કારણ કે— ॥૧૦૮॥

॥ यो गृहे कार्तिकी कुर्यात । स्नान दान विवर्जितः ॥
॥ संवत्सर कृतात पुण्यात । सबहिः स्यादिति श्रुतिः॥१०९

જે માણસ સ્નાન, દાન, રહિત થઈને ઘેર જો કાર્તિકી પૂનેમ પ્રમાદથી કરે છે, તો આખા વરસનું કરેલું જે પુણ્ય હોય તે તેનું નાશ પામે છે એવું મેં સાંભળ્યું છે. ॥૧૦૯॥

॥ तस्मात्सर्व प्रयत्नेन । तीर्थं सर्व गुणो चितम् ॥
॥ वयं सर्वेऽपि गच्छामः । स्नातुं दातुं स्वशक्तितः॥११०॥

માટે મહા મહેનતથી પણ આપણે બધાઓએ કોઈ સારૂ સર્વ પ્રકારના ગુણવાળું, પવિત્ર જો તીર્થ હોય તો ત્યાં પોતાની શકિત પ્રમાણે સ્નાન, દાન, વીગેરે કરવા જવું જોઈએ. આ પ્રમાણે રાજાએ પેલા બ્રાહ્મણોને કહ્યું ત્યારે

॥ श्री मार्कंडेय उवाच ॥ શ્રી માર્કંડેય મુનિ કહેવા લાગ્યા કે

॥ एवमुक्ते तु वचने । पार्थिवेन द्विजोत्तमाः ॥
॥ उचु स्तीर्थं नृप श्रेष्ठ । रेवायामुत्तरे तटे ॥१११॥

હે રાજન, તે બ્રાહ્મણો રાજાને કહેવા લાગ્યા કે નર્મદાજીના ઉત્તર કીનારા ઉપર એક સુંદર તીર્થ છે. ॥૧૧૧॥

॥ भारेश्वरेति विख्यातं । मुक्ति तिर्थं द्विजोत्तमा ॥
॥ तत्र यामो वयं सर्वे । तिर्थं पापक्षयं करं ॥११२॥

તેનું નામ ભારેશ્વર તીર્થ એવું છે અને ત્યાં જનારને મુકિત ભોગ અને પાપનો નાશ કરે એવું એ તીર્થ છે. તો ત્યાં આપણે બધા જઈએ. ॥૧૧૨॥

॥ एवमा भाष्य नृपति । गृहित्वा प्रचुरं वसु ॥
॥ शकटा तिवरं भृत्वा । तत्र युक्तः स धूर्वहः ॥११३॥

આ પ્રમાણે રાજાને કહ્યું એટલે રાજાએ તે તિર્થમાં જવા માટે પોતાની સાથે ઘણુંજ દ્રવ્ય લઈ, અને બીજાં પણ પરચુરણ માલનાં ગાડાં ભરાવી તેમાં પેલો વાણીઓ જે અનેક નરકો ભોગવી બળદ થએલો છે તેને જોડવામાં આવ્યો. ॥૧૧૩॥

॥ मित्रघात करो योवै । स योनिं तुक्रमादृगतः ॥
॥ इत्थं स नर्मदां राजा । प्राप्तवां स्तिर्थं मुत्तमम् ॥११४॥

કે જે વાણીઓ મિત્રહત્યા અને વિશ્વાસઘાત કરી

પોતાના મિત્ર સોમશર્માને મારી નાખ્યો હતો. આ પ્રમાણે આ રાજા બધાંને સાથે લઈ નર્મદાજીના ઉત્તર કીનારા ઉપર આવેલા ભારભૂતિશ્વર નામના તિર્થમાં કારતક સુદી ૧૫ ના પર્વ ઉપર સ્નાન કરવા માટે ગયો. ॥૧૧૪॥

॥ गत्वा चतुर्दशी दिने । उपवास कृत क्षणः ॥
॥ स्नानार्थ तीरमासाद्य । भक्त्या देवं शिवं स्मरन ॥११५॥

ત્યાં તે કારતક સુદી ૧૪ નો દીવસ હતો, તેથી આગલે દીવસે ત્યાં જઈને ઉપવાસ કરી સ્નાન કરવા માટે મહાન ભક્તિ અને શ્રદ્ધાથી શ્રી ભારભૂતેશ્વર મહાદેવનું સ્મરણ કરીને નર્મદાજીના કીનારા ઉપર તે રાજા આવ્યો. ॥૧૧૫॥

॥ शुचि प्रदेशाच्च मृदं । स्वयं जग्राह मंत्रवत ॥

પછીથી મંત્ર ભણીને સારી પવિત્ર જગ્યાએથી માટી લીધી તેમાં નીચેનો મંત્ર બોલ્યા કે

॥ उध्धृता शिव राहेण । कृष्णेन शतबाहुना ॥
॥ मा मुद्धर तथा धात्रि । प्रजया च धनेन च ॥११६॥

હે ધાત્રિ સહસ્ત્ર હાથવાળા એવા કૃષ્ણ પરમાત્માએ વરાહવતાર ધારણ કરીને તારો ઉદ્ધાર દઈત્યોને મારીને કર્યો, તે પ્રમાણે તું મારો પ્રજા અને ધનથી ઉદ્ધાર કર. ૧૧૬

॥ स एवं मृद मादाय । गत्वा निरे जलांतिके ॥
॥ अदर्शय दभास्काराय । मंत्रमेन मनुस्मरन ॥११७॥

આ પ્રમાણે કહીને માટી લઇ પછીથી કીનારા ઉપર પાણી પાસે જઇ માટી બંનેઉ હાથમાં લઇ નીચેનો મંત્ર ભણી સૂર્યને બતાવવા લાગ્યા. ॥૧૧૭॥

॥ अश्वक्रांते रथक्रांते । विष्णुक्रांते वसुंधरे ॥
॥ मृत्तिके हरमे पापं । यन्मया पूर्व मर्जितम् ॥११८॥

હે વસુંધરા તારી ઉપર શ્રી વિષ્ણુ ભગવાને અનેક અવતારો લઇ તારા ઉપર લીલા કરી છે, માટે તેમના પાદારવિંદાથી તારી ધુળમાં ફર્યા તેમજ રથથી, ઘોડાથી પણ ચિન્હિત થઇ તો હે મૃતિકા મારા પુર્વ જન્મનું જે કંઇ પાપ થએલું હોય તે તારા ધારણ કરવાથી નાશ પામજે ॥૧૧૮

॥ ततोऽवग्राहयेद्दंभो । रेवं मंत्र मुदीरयन ॥

આ પ્રમાણે મૃતિકા ધારણ કરી, નીચેના મંત્રથી શ્રી નર્મદા સ્નાનને માટે રેવાની સ્તુતિ કરવા લાગ્યા

॥ त्वं नर्मदे पुण्य जला । तवांभ शंकरोद्भवं ॥
॥ स्नानं प्रकुर्वतोमेऽद्य । पापं नाशय सर्वतः ॥११९॥

હે નર્મદા તમારૂ પાણી મહાદેવના શરીરથી ઉત્પન્ન થયેલુ છે તેથી બહુજ પવિત્ર છે તો એવા પુણ્ય અને પવિત્ર જળમાં આજે હું સ્નાન કરૂં છું તો મારૂં સર્વ પ્રકારનું પાપ નાશ કરજો ॥૧૧૯॥

॥ अनेन विधिना स्नात्वा । संतर्प्य पितृ देवताः ॥
॥ प्रिणयित्वा पितृन्श्राध्धे । ततो देवालयं व्रजेत् ॥१२०॥

આ પ્રમાણે કહીને નર્મદાજીમાં સ્નાન કરી દેવ પિતૃ મનુષ્યોનું તર્પણ કરવું અને ત્યાં કિનારા ઉપર પિતૃઓ શ્રાદ્ધ કરી તેમને તૃપ્ત કરવા આ પ્રમાણે તીર્થકર્મ પરવારી પછીથી શ્રી ભગવાન ભારભૂતેશ્વરના દેવાલયમાં જવું ત્યાં ૧૨૦

॥ शुभान् संभृत्य संभारान् । चिंतयन्शंकरंहृदि ॥
॥ आगमोक्त पुराणोक्त । विधिना पुजयेच्छिवम् ॥१२१॥

અનેક પ્રકારની પુંજાને સારૂ સાહિત્ય લઇ જવું પછી મનમાં અંતરમાં શ્રી શંકરનું ધ્યાન કરી શાસ્ત્રપુરાણોમાં કહેલા મંત્રથી વિધિ પ્રમાણે શ્રી ભારભુતિશ્વરનું પુજન કરવું. ।।૧૨૧।।

॥ पुजान्नतुष्टये देवे । शिवरात्र्यां समाचरेत् ॥
॥ संस्नाप्य:प्रथमे यामे । पंचगव्येन शंकरं ॥१२२॥

તેમાં કારતક સુદી ૧૪ એટલે મહાદેવની શિવરાત્રીની તિથિ ચતુર્દશી મનાય છે માટે ચાર પહોરની પુંજા મહાદેવની કરવી.. અને પહેલા પહોરમાં ભગવાન મહાદેવને ગાયનું મુત્ર-છાણ દહી દુધ, ઘી, આ પંચગવ્યથી સ્નાન કરાવવું. ।।૧૨૨।।

॥ पंचामृते न च तथा । देवदेवं जगद्गुरु ॥

પછી જગતના પિતા દેવાધિદેવને પંચામ્રત દુધ, દહીં ઘી, મધ, ખાંડ વીગેરેથી સ્નાન કરાવવું

श्रीमार्कंडेय उवाच ॥ ત્યારે શ્રીમાર્કંડેય મુનિ કહેવા લાગ્યા કે

॥ एवं राज्ञा कृतं तेन । लिंग आज्येन पूरितम् ॥
॥ धूप दीपादि नैवेद्य । रूपहारैर्यथाक्रमम् ॥१२३॥

આ પ્રમાણે સ્નાન કરાવો પછીથી શ્રીભારભુતેશ્વરના લીંગને ઘીથી પુરી દઇ અનુક્રમે શોડષોપચાર પૂજન ધુપ દીપ નૈવેધ તથા બીજા સાહિત્યથી કર્યું. ।।૧૨૩।।

॥ दद्या वर्ध्यंच देवाय । मंत्रेणानेन भारत ॥

પછીથી નીચે લખેલા મંત્રથી શ્રી ભગવાન મહાદેવને અર્ધ્ય અર્પણ કર્યો.

नमस्ते गिरिजार्धांग । शंभो परम कारण ॥
॥ गृहाणार्घ भिमंदेव । संसाराद्धुद्धरस्वमाम् ॥१२४॥

હે શંભુ જગના મહાન કારણરૂપ ઇશ્વર જેણે પાર્વતીને પોતાના અર્ધા શરીર ઉપર બેસાડેલાં છે એવા આપને હું

નમસ્કાર કરૂં છું. જે હે દેવ આપને હું આ અર્ઘ્ય અર્પણ કરૂં છું તે આપ સ્વીકારો અને આ સમુદ્રરૂપી સંસારમાંથી મારો ઉદ્ધાર કરો. ॥ ૧૨૪ ॥

॥ वित्तानुरुपतो दत्तं सुवर्णं मंत्र कल्पितम् ॥
॥ वन्हिर्वै देवताः सर्वा सुवर्णंच हुताशनात ॥१२५॥

વળી પોતાની શક્તિ પ્રમાણે તે રાજાએ બધા દેવો અગ્નિરૂપ છે અને તે અગ્નિથી સોનું ઉત્પન્ન થએલું છે. માટે તે સોનું શાસ્ત્રમાં કહેલી વીધી પ્રમાણે દાનમાં મહાદેવના નિમિતે આપ્યું અને નીચે પ્રમાણે સંકલ્પ કર્યો.

॥ अत सुवर्ण दानेन । प्रीताः स्युः सर्व देवताः ॥
॥ अनेन स्वर्ण दानेन । प्रीतो भवतु शंकरः ॥१२६॥

કે હે મહાદેવ આ સુવર્ણના દાનથી બધા દેવો પ્રસન્ન થજો. ને શ્રીભગવાન મહાદેવ પણ પ્રસન્ન થજો. ॥૧૨૬॥

॥ अनेन विधिना राज्ञा । पूजितः प्रथमे शिवः ॥
॥ यामे द्विर्माये च तथा । पूर्वोक्त विधिना यजन ॥१२७॥

આ પ્રમાણે ઉપર કહેલી વિધિથી રાજાએ પહેલા પહોરની પુંજા મહાદેવની સમાપ્ત કરી, બીજા પહોરમાં ઉપર પ્રમાણે વિધિથી પુજા કરવા લાગ્યો. ॥૧૨૭॥

॥ स्नापयामास गव्येन । दुग्धेन परमेश्वरम् ॥
॥ तंदुलै रक्षतै स्तेन । सितैर्लिंगं प्रपूरितम् ॥१२८॥

તેમાં પંચામૃત તથા પંચગવ્ય તથા દુધ વડે કરીને શ્રી ભગવાન મહાદેવને સ્નાન કરાવી ધોળા અખંડિત જે ચોખા તેનાથી મહાદેવના લિંગને પૂરણ કરી દીધું વળી ॥ ૧૨૮ ॥

॥ सितवस्त्र युगं चैव । दत्तं देवाय भारत ॥
॥ पाने तृतिये मधुना । संस्नाप्य त्रिपुरांतकम ॥१२९॥

હે ભારત! બીજા પહોરની પુજાને અંગે તે દેવના નિમિ-તે પહેલાં પ્રમાણે સંકલ્પ કરીને બે ધોળાં વસ્ત્ર દાનમાં આપ્યાં, પછીથી ત્રીજા પહોરની પુજાનો આરંભ કર્યો તેમાં ભગવાનને મધથી સ્નાન કરાવ્યું અને ॥ ૧૨૯ ॥

॥ तिलैः प्रपूरितं लींगं । तिल द्रोणंच दत्तवान ॥

શ્રી ભગવાન મહાદેવના લીંગને તલથી પૂરણ કરી દીધું તથા એક દ્રોણ પર્યંત તલનું દાન ત્રીજા પહોરની પુંજાને અંગે નીચે પ્રમાણે સંકલ્પ કરી આપ્યું.

॥ तिलाश्वेताश्च कृष्णा । पवित्राः सर्व वल्लभाः ॥
॥ तिल द्रोण प्रदानेन । छिंधि पापं महेश्वर ॥१३०॥

તલ ધોળા તેમજ કાળા અને તે પ્રાણીમાત્રને પ્રિય તેમજ પવિત્ર છે. માટે હે મહેશ્વર તેવા આ તલ એક દ્રોણ પર્યંતના આપના નિમિ-તે આજે હું દાનમાં આપું છું તેનાથી મારાં બધાં પાપ નાશ કરજો. આ પ્રમાણે કહી તલનું દાન ॥ ૧૩૦ ॥

॥ सितवस्त्र युगं यामे । तृतियेचाथ वेदद्दौ ॥
॥ दध्योदनेनच कृतं । तुरीये लिंगपुरणम ॥१३१॥

કર્યા પછી બે ધોળાં વસ્ત્ર પણ ત્રીજા પહોરની પુજાને અંગે દાનમાં આપ્યા પછી ચોથા પહોરની પુજાનો આરંભ કર્યો તેમાં પૂર્વોક્ત વિધિ પ્રમાણે પૂજન કરી શ્રી ભગવાન મહાદેવના લીંગને દહીં (ભાત) ચોખાથી મિશ્રિત કરી પૂરણ કરી દીધું, અને તે પહોરની પુજાને અંગે નીચે પ્રમાણે ॥૧૩૧॥

॥ तस्मिन्प्रदत्ता गौः । शंकरः प्रियतामिति ॥
॥ अनेन विधिना राज्ञा । यामिनीत्वति वाहिता ॥१३२॥

સંકલ્પ કર્યો કે હે પ્રભુ હું આપના નિમિત્તે આ ગાયનું દાન કરૂ છું. માટે મારી ઉપર આપ પ્રસન્ન થજો એ પ્રમાણે કહી ઉપર લખ્યા પ્રમાણેની ચાર પહોરની પુજા કરવામાં તે રાજાની રાત્રિ વ્યતિત થઈ ગઈ. ॥ ૧૩૨ ॥

॥ गित नृत्य विनोदैश्च । ब्रह्मघोषेण भारत ॥
चकार जागरं चापि । बहु पुण्य प्रसाधकम् ॥१३३॥

તેમાં ગીત, વાદિત્ર, તથા નૃત્ય શાસ્ત્રના વિવાદ, બ્રાહ્મણોનો મંત્રોચ્ચાર વડે કરી થતો, શબ્દઘોષ એ બધી રીતે આખા દીવસનો ઉપવાસ તથા જે બહુજ પુણ્યને પ્રાપ્ત કરાવે છે એવું જાગરણ તે રાજાને થયું. ॥૧૩૩॥

॥ यो जागरे त्रिनेत्रस्य । शिवराव्यां व्यस्थिताः ॥
॥ ते यांति यांगति पार्थ । नतां वै क्रतु याजिनः ॥१३४॥

વળી હે પાર્થ ! કહ્યું છે કે, જે માણસ મહાદેવની શીવરાત્રીના દિવસે ઉપવાસ કરી, રાત્રે જાગરણ કરે છે, ભક્તિ શ્રદ્ધાથી તો તેમને જે ઉત્તમ ગતિ પ્રાપ્ત થાય છે એવી મહાન યજ્ઞ કરનારને મળતી નથી ॥ ૧૩૪ ॥

॥ यानि कानिच पापानि । जन्मकोटि कृतानिच ॥
॥ हर केशवयोस्तानि । जागरे यांति संशयं ॥१३५॥

વળી કરોડો જન્મ ધારણ કરીને જે કંઈ પાપ કરવામાં આવ્યું હોય છે, તે મહાદેવની શીવરાત્રી અને વિષ્નુ-ભગવાનની એકાદશીને દિવસે જો શ્રદ્ધા ભક્તિથી વ્રત કરી જાગરણ કરવામાં આવે છે, તો તે સંચિત કરેલાં બધાં પાપો નાશ પામે છે. ॥ ૧૩૫ ॥

॥ यावंतो निमिषा नृणां । भवंति निशि जाग्रतां ॥
॥ निमिषे निमिषे राजन् । अश्वमेध फलं लभेत ॥१३६॥

કારણકે રાત્રે જાગરણ કરવામાં માણસ જેટલી વખત આંખો મીંચે છે અને ઉઘાડે છે તેટલા અશ્વમેઘયજ્ઞનું પુણ્ય ફળ તેને મળે છે ॥ ૧૩૬ ॥

॥ उपवास पराणां च । देवायतन वासिनां ॥
॥ शृण्वतां पुण्यमाख्यानं । ध्यायतां हरकेशवौ ॥१३७॥

કારણ કે ઉપવાસ કર્યો હોય, તેમાં વળી દેવના મંદીરમાં બેસી શ્રીભગવાન મહાદેવ અથવા શ્રીવિશ્નુનું ધ્યાન કરી તેમની કથા વાર્તા સાંભળીને જો જાગરણ કરવામાં આવ્યું હોય ॥ ૧૩૭ ॥

॥ तृतिये चरमेचैव । निशायाः किंपुनर्नृप ॥
॥ तदा कालार्जितं पुण्यं । वक्तुं ब्रह्मापि नक्षमः ॥१३८॥

તો તે જાગરણની રાત્રીના ત્રીજા અને ચોથા પહોરના જાગરણનું પુણ્ય અને તેનું ફળ બ્રહ્મા પણ કહેવાને શક્તિવાન નથી. ॥૧૩૮॥

॥ न शिवः केशवो वापि । काकथान्य सुरस्यवै ॥
॥ बहु स्वर्णेन निमिषः । क्रतुनां न तुलां लभेत् ॥१३९॥

તેમજ વિશ્નુ અને મહાદેવથી પણ કહી શકાય એમ નથી, તો બીજા દેવોની વાતજ શી કરવી કારણ કે નિમેષ માત્રના જાગરણમાં સોનાના ઢગલા આપો અથવા યજ્ઞ કરો કે તુલાદાન આપો તોપણ તેના જેટલું પુણ્યફળ મળી શકતું નથી. માટે ॥ ૧૩૯ ॥

॥ शिवरात्रि तिथिः पुण्याः । कार्तिकीच्च विशेषतः ॥
॥ रेवायामुत्तरे कुले । तिर्थे भारेश्वरे नृप ॥१४०॥

હે રાજા શ્રીનર્મદાજીના ઉત્તર કિનારા ઉપર ભારભૂતેશ્વર તિર્થમાં કાર્તિક મહીનાની સુદી ૧૪ ચૌદશની તિથિ શિવરાત્રી હોવાથી બહુજ પુણ્યવાળી તિથિ મનાય છે. ॥ ૧૪૦ ॥

॥ कृतं जागरणं दुःखात् । कथं पापं न हास्यति ॥
॥ इत्थं सजागरं कृत्वा । शिवराच्यां नरेश्वरः ॥१४१॥

આવા તિર્થમાં ઉત્તમ તે દિવસે ગમે તેટલું કષ્ટ ભોગવીને પણ રાત્રે જાગરણ કરેલું હોય તો તેનાં ગમે તેવાં પાપ હોય તે પણ નાશ પામ્યા શિવાય રહેતાં નથી આ પ્રમાણે તે દિવસે તે રાજાએ ત્યાં રાત્રે જાગરણ કર્યું. ॥ ૧૪૧ ॥

॥ प्रभाते विमले गत्वा । नर्मदा तीर सन्निधौ ॥
॥ स्नापिता स्तेन ते सर्वे । तुरगाश्च धुरंधरः ॥१४२॥

બીજે દિવસે સવારમાં સૂર્યોદય થયો, એટલે તે રાજાએ નર્મદાજીના કિનારા ઉપર જઈને પોતાના ઘોડા તથા ગાડાંઓએ જોડી લાવેલા બધા બળદોને સ્નાન કરાવ્યું ॥ ૧૪૨ ॥

॥तत्र मध्य स्थितः स्नातः । स्तिर्यक्त्वं योगतो वणिक् ॥
॥ यैर्वाहै रागतस्तिर्थे । स्नातोहं स्नापयामितान् ॥१४३॥

તેમાં વાહનમાં જોડાઈને આવેલો પેલો મિત્રહત્યા તથા વિશ્વાસઘાત કરનારો વાણીઓ જે બળદની યોનિને પ્રાપ્ત થયો હતો તેને પણ રાજાએ સ્નાન કરાવ્યું પછી ॥ ૧૪૩ ॥

॥ दद्या-तेभ्यः समुद्दिश्य । किंचित्कृत्यानुरूपतः ॥
॥ ददौ दानं सपुण्यात्मा । राजा परहिते रत ॥१४४॥

પારકાનું કલ્યાણ કરનાર તથા પુણ્યશાળી એવા તે રાજાએ વાહનના દોષથી મુક્ત થવાને માટે પોતાની શક્તિ પ્રમાણે તે પશુઓના નિમિત્તે પણ તિર્થમાં દાન કર્યું ॥૧૪૪॥

॥ श्री मार्कंडेय उवाच ॥ ત્યારે શ્રી માર્કંડેય મુનિ કહેવા લાગ્યા કે—

॥ एवं वाहनजा दोषात् । मुक्तो भवति मानवः ॥
॥ अन्यथा सुकृतं भागं । कृतं व्रजति तान्प्रति ॥१४५॥

આ પ્રમાણે તિર્થમાં આવીને જે દાન કરે છે પશુઓના નિમિત્તે તો તે માણુસ વાહનથી ઉત્પન્ન થયેલાં જે પાપ તેનાથી મુક્ત થાય છે. નહિ તો તે માણુસ તે તિર્થમાં જેટલું પુણ્યકરે છે તેનો અર્ધો ભાગ, તે પશુઓને મળે છે. કારણ કે તેની ઉપર બેસીને આવેલો છે તેથી ॥૧૪૫॥

॥ सस्नाप्य तान् ततो राजा । स्वयंस्नात्वा विधानतः ॥
॥ संतर्प्य पितृ देवांश्च । श्राध्धं कृत्वा यथाविधिः ॥१४६॥

આ પ્રમાણે પશુઓને સ્નાન કરાવી આજે કાર્તિકી પૂર્ણિમા હોવાથી પોતે પણ શ્રી ભારભુતેશ્વર તિર્થમાં ઉપર કહેલી વિધિ પ્રમાણે સ્નાન કર્યું, પછીથી દેવ પિતૃઓ અને મનુષ્યોનું તર્પણ કરી તેમના નિમિત્તે તિર્થ શ્રાદ્ધ કર્યું અને ॥ ૧૪૬ ॥

कृत्वा पिंडान यथा शास्त्रं । वृषमुत्सृज्य पार्थिवः ॥
गत्वा देवालयं पश्चात । देवं तिर्थोदकेनच ॥१४७॥

શાસ્ત્રમાં કહેલી વિધિ પ્રમાણે (વૃષોત્સર્ગ) નિલોદ્વાહ કરી તે જગ્યામાં પોતાના પિતૃઓના નિમિત્તે પિંડપ્રદાન કર્યાં પછીથી ગોક્ષુરમાં તીર્થનું જળ લઈ દેવાલયમાં જઈ ॥૧૪૭॥

संस्नाप्य पंचगव्येन । ततः पंचामृतेनच ॥
सर्वोषधि जलैःस्नाप्य । चंदनेनानुलिप्यच ॥१४८॥

શ્રી ભગવાન ભારભુતેશ્વરને પંચગવ્ય, પંચામૃત તથા તિર્થના જળથી સ્નાન કરાવ્યું, પછી સર્વ પ્રકારની ઔષધીઓના પાણીથી સ્નાન કરાવી ચંદન ચઢાવ્યું. ॥ ૧૪૮ ॥

कुंकुमैश्च सकर्पुरैः । गंधैश्च विविधैरपि ॥
सुगंधै विविधैः पुष्पैः । लिंगमापूर्य सर्वतः ॥१४९॥

તેમાં કર્પુરની સાથે અનેક સુગંધી દ્રવ્યોવાળુ કંકુ પણ ચઢાવી સારાં સુગંધીવાળાં અનેક પ્રકારનાં પુષ્પોથી મહાદેવના તે લિંગનેચોમેરથી ઢાંકી (આચ્છાદિત કરી) દીધું. ॥૧૪૯॥

गोदानंच कृतं पश्चात् । विधिना मंत्रपुर्वकम् ॥
धेनुके रूद्र रूपासि । रूद्रेण परि निर्मिता ॥१५०॥

પછીથી મંત્રનો ઉચ્ચાર કરી વિધિ પ્રમાણે શ્રીભારભૂતેશ્વરના નિમિ-તે કાર્તિક સુદી ૧૫ પુર્ણીમાના દીવસે પુજન કરીને ગાયનું દાન કર્યું ત્યારે તે રાજા ગાયની પ્રાર્થના કરવા લાગ્યો કે હે ધેનુ તને મહાદેવે સરજાવેલી છે તેથી તું રૂદ્રરૂપ છે માટે ॥ ૧૫૦ ॥

दत्तामया भवाब्धोमां । पतंतं त्वं समुद्धर ॥
एवं स्वलंकृतां धेनुं । दत्वा पश्चात् क्षमापयेत् ॥१५१॥

હું આજે તારૂં દાન કરૂં છું તો મને આ સંસારરૂપી સમુદ્રમાં ફરીથી જન્મ મરણ ન થાય, એવી રીતે તું મારો ઉદ્ધાર કર, આ પ્રમાણે કહીને શણગારેલી એટલે સોનાની શીંગ-ડીઓ રૂપાની ખરીઓ તથા ત્રાંબાની પીઠ વળી ગળામાં ઘંટડી બાંધેલી છે એવી વસ્ત્રથી આચ્છાદિત કરેલી ચંદન પુષ્પથી અર્ચિત કરેલી કાંસાના દોહવાના પાત્ર સાથે દાનમાં સંકલ્પ કરી આપી ॥ ૧૫૧ ॥

ब्राह्मणाम् भोजयेत् पश्चात् । शक्त्या संतोषयेच्छिवम् ॥
षड्रसैर्भोजनै र्भक्ष्यै । वासोभिस्तानथार्चयेत् ॥१५२॥

પછીથી પોતાની શકિત પ્રમાણે મહાદેવને પ્રસન્ન કરવા માટે ભકિતવડે કરીને પુજા કરી વસ્ત્ર વીગેરે અનેક પ્રકારના ભક્ષ્યભોજ્ય પદાર્થોથી બ્રાહ્મણોને ભોજન ત્યાં કરાવ્યું. ॥૧૫૨॥

दक्षिणाभि र्विचित्राभिः संतोष्याथ विसर्जयेत् ॥
एवं कृत्वा सराजापि । स्वयंच बुभुजे पुनः ॥१५३॥

અને તેમને અનેક પ્રકારની દાન દક્ષિણાઓ આપી સંતુષ્ટ કરવા પછી તેમનો આશિર્વાદ લેવો, આ પ્રમાણે તે રાજાએ પણ ત્યાં કર્યું. પછી તે બ્રાહ્મણોને વીદાય કરી પોતે પણ ઇષ્ટમિત્ર બંધુવર્ગની સાથે ભોજન કર્યું, ॥૧૫૩॥

इष्टबंधु जनैः सार्धं । परिवार समन्वितः ॥
अपितां रजनीं तत्र । न्यवसज्जगति पतिः ॥१५४॥

અને પોતાના ઇષ્ટ બંધુવર્ગ પરિવાર સાથે પૂર્ણિમાની રાત્રી તે રાજા શ્રી ભારભુતેશ્વરના તીર્થમાં રહ્યો. ॥ ૧૫૪ ॥

तत्र तस्येवित स्येवं । निशिथे नृप सत्तम ॥
अंतरिक्षे सुनिर्घोषा । वागुवाचा शरीरिणी ॥१५५॥

હે નૃપશ્રેષ્ઠ મધ્યરાત્રિ વ્યતીત થઇ એટલે બધા સાંભળી શકે એમ મહાન ગંભીર શબ્દથી આકાશ વાણી થઇ ॥ ૧૫૫ ॥

श्री भारती उवाच ॥ આકાશ વાણી કરે છે કે—

राजन्संसर्गजं लोके । फलेस्यादपि तच्छृणु ॥
पातित्य मथवोन्नत्यं । संसर्गादेव जायते ॥१५६॥

હે રાજા આ લોકમાં બીજાના સંસર્ગથી શું ફળ મળે છે તે હું તને કહું છું તે તું સાંભળ હમેશાં પ્રાણીમાત્રની ઉન્નતિ અને અધઃપતન બંને સંસર્ગથીજ થાય છે ॥૧૫૬॥

॥ संसार सागरे ह्यस्मिन । पतितानां दुरात्मनां ॥
॥ यदि संसर्ग मात्रेण । फलंस्यात्तथा शृणु ॥१५७॥

આ સંસારરૂપી સાગરમાં સ્વીપચી રહેલા જે દુષ્ટ જીવો તેમને સંસર્ગ માત્રથી શું ફળ મળે છે તે તું સાંભળ, કેઃ— ॥ ૧૫૭ ॥

॥ य एषत्वद्गृहे वोढा । महद्भार धुरंधरः ॥
॥ विश्वस्त मित्रघ्नोत्वें । कृतो ह्येतेन पाविना ॥१५८॥

જે તારે ઘેર બહુજ ભારને વહેનાર આ બળદ છે તેણે વિશ્વાસઘાત અને મિત્રહત્યા બંને પાપ કર્યા છે. ॥ ૧૫૮ ॥

॥ पुरा जन्म सहस्त्रेण । व्यतिते परजन्मनि ॥
॥ ततो बहूंश्च नरकान । अनुभूय पृथक पृथक ॥१५९॥

એ પાપને લઇને એણે જુદા જુદા નરકો ભોગવ્યા, પછીથી હજારો યોનિમાં આ જન્મ પહેલાં એના જન્મ થયા. ॥ ૧૫૯ ॥

पापयोनि सहस्त्राणि । गत्वाचारोहिणों गति ॥
॥ गों यानि समनुप्राप्ता । त्वत्गृहे सद्रात्मशान ॥१६०॥

તેમાં કેટલીક હજારો પાપયોનિઓ એણે ભોગવી ત્યાર પછી વાહનની યોનિમાં જન્મ આપ્યો તેમાંથી અત્યારે તારે ઘેર એ દુષ્ટ પાપી બળદ થઇને ગાયની યોનિમાં જન્મ લીધો છે. ॥ ૧૬૦ ॥

॥ स्नापितश्च त्वया तिर्थे । ह्यस्मिन्पर्वणि पार्थिव ॥
॥ दृष्टा पूजा ह्यनेनात्र । तथा जागरण क्रिया ॥१६१॥

હે રાજા તેને તેં આ સુંદર પર્વના દિવસે અહીં લાવી આવા ઉત્તમ તિર્થમાં સ્નાન કરાવ્યું વળી તેં કરેલી રાત્રીની

ચારે પહોરની પુજા એણે જોઇ અને તેમાં એને જાગરણ થયું. ॥ ૧૬૧ ॥

॥ तेन निष्किल्बिषो जातः । तत्पुरः पश्य भूपते ॥
॥ स्वर्गंता सतनुं त्यक्त्वा । विमानेनार्क वर्चसा ॥१६२॥

તેથી એ પાપથી મુક્ત થઇ હે રાજા આ તારી સામે ઉભો છે. જેને સ્વર્ગમાં લઇ જવા માટે સૂર્યના જેવું તેજસ્વી વિમાન અહીં આવશે. એટલે એ આ બળદની યોનિમાંથી મુક્ત થયો છે. ॥ ૧૬૨ ॥

॥ एवमुक्तेतया देव्या । धूर्यः प्राणैर्विमुच्यत ॥
॥ विमान वरमारूढ । स्तत्क्षणात्समदृश्यत ॥१६३॥

આ પ્રમાણે જ્યાં આકાશવાણીએ કહ્યું એટલે તે બળદ ત્યાં મરણ પામ્યો. અને તેજ સમયે તેના કહેવા પ્રમાણે આવેલું સુંદર વિમાન તેમાં તેને બેઠેલો જોયો. ॥ ૧૬૩ ॥

॥ दिव्या भरण शोभाढयो । दिव्यमाल्यांबरावृतः ॥
॥ सतं प्रणम्य राजानं । उवाचानंद पुरितः ॥१६३॥

જેણે સુંદર ઘરેણાં તેમજ વસ્ત્રો ધારણ કરેલાં છે. એવો તે વાણીઓ રાજાને નમસ્કાર કરી, મહાન આનંદમાં આવી જઇને કહેવા લાગ્યો.

॥ वणिक उवाच ॥ વાણીઓ કહેવા લાગ્યો કેઃ –

॥ अहो नृपवर श्रेष्ट । तिर्थ माहात्म्य मुत्तमम् ॥
॥ यत्राप्यन्यस्मद्विधास्तीर्थे । मुच्यन्ते पातके नराः ॥१६४॥

હે નૃપ શ્રેષ્ટ શું આ તીર્થનું ઉત્તમ મહાત્મ્ય છે, કે, જે તિર્થમાં અમારા જેવા પાપી માણસો પણ ગમે તેવા મહાન્ પાપથી મુક્ત થાય છે. ॥૧૬૪ ॥

॥ मया ज्ञातमशेषेण । मत्समोनास्ति पातकी ॥
॥ अतःपरं किंतु कुर्यात् । नृप तिर्थानुकिर्तनम् ॥१६५॥

અને તે બધું મારૂં પાપ મેં હવે જાણ્યું છે કે, મારા જેવો બીજો કોઈ પાપી નથી તો એવો હું પણ એ મહાન પાપથી અહીં છુટયો તો હવે બીજું આનાથી વધારે મારે આ તિર્થનું વર્ણન શું કરવાનું રહ્યું. વળી ॥ ૧૬૫ ॥

॥ पिता माता सुहृद्‌बंधु । भवानेव ममेश्वरः ॥
॥ मुक्तो ह्यशेषपापेभ्यो । यत्प्रसादहं नृप ॥१६६॥

હે રાજા તમે મારા માતા પિતા ભાઈ સ્નેહી અથવા તો ઈશ્વર જે કંઈ કહો તે તમેજ છો કારણકે હું આજે આપની દયાથી અશેષ પાપથી મુક્ત થયો છું. વળી ॥૧૬૬॥

॥ उच्चैः स्वर्गस्थितिंप्राप्तः । पार्थिवत्वत्प्रसादतः ॥
॥ क्षंतव्यं प्रणतोऽस्म्यद्य । यस्मिंस्तिर्थे हि माद्रशाः ॥१६७॥

આપના જેવા મહાન પુરૂષોની સંગતિથી હે રાજન આજે મને સ્વર્ગ મળ્યું છે. માટે ક્ષમા કરજો, આપને હું નમસ્કાર કરૂં છું કે જે તીર્થમાં મારા જેવા ॥ ૧૬૭ ॥

॥ गतिमिद्रग्विधां यांति । न जाने तवका गतिः ॥
॥ समाराध्य महेशानं । संपूज्यच यथाविधिः ॥१६८॥

પાપી માણસો આવી ઉત્તમ ગતિને પ્રાપ્ત થાય છે તો તમે પોતે રાજા છો, વળી આપે મહાન ભક્તિ શ્રદ્ધાથી શ્રી ભારભૂતેશ્વરનું પુજન વિધિ પ્રમાણે કરી ભગવાનના નિમિત્તે દાન વિગેરે આપીને પ્રસન્ન કર્યા છે, તો કોણ જાણે આપને શું પ્રાપ્ત થશે તે મારાથી કહી શકાય એમ નથી વળી ॥૧૬૮॥

॥ लिंगं चतुर्धा संपूज्य । दानं दत्वा यथोदितम् ॥
॥ कागति स्तव संभाव्या । देह्यनुज्ञां मम प्रभो ॥१६९॥

ભગવાનની ચાર પ્રકારની ચાર પહોરની પુંજા તથા શાસ્ત્રમાં લખ્યા પ્રમાણે દાન વીગેરે પણ તમે કર્યાં તો આપને શું ગતિ મળવી જોઈએ માટે હે પ્રભુ આપ હવે મને સ્વર્ગમાં જવાની આજ્ઞા આપે. ॥ ૧૬૯॥

॥ त्वरयंतीह मांह्येते । शांभवा प्रमथा दिवि ॥
॥ स्वस्त्यस्तु ते गमिष्येहं । इत्युक्त्वां तरधीयत् ॥१७०॥

કારણકે મને તેડવા માટે આવેલા મહાદેવના ગણો સ્વર્ગમાં લઈ જવા સારૂ ઉતાવળ કરે છે માટે આપનું કલ્યાણ થાઓ. આ પ્રમાણે કહીને તે વાણીઓ અંતર્ધ્યાન થઈ ગયો. ॥ ૧૭૦ ॥

॥ श्रीमार्कंडेय उवाच ॥ શ્રી માર્કંડેય મુનિ કહેવા લાગ્યા કે—

॥ अंतर्धानं गते तस्मिन् । सराज्ञाविस्मयान्वितः ॥
॥ तिर्थ माहात्म्य मतुलं । वर्णयन स्वपुरंययौ ॥१७१॥

રાજા તેના અંતર્ધ્યાન થઈ ગયા પછીથી આશ્ચર્ય પામી અને માર્ગમાં બધે શ્રી ભારભૂતેશ્વર તિર્થની પ્રશંસા તેમજ તે તીર્થના માહાત્મ્યનું વર્ણન કરતો કરતો પોતાને ઘેર ગયો. ॥ ૧૭૧ ॥

॥ एवं भूतं तिर्थमिदं । नर्मदायां व्यवस्थितम् ॥
॥ सर्व पाप क्षयकरम् । सर्व दुःखघ्न मुत्तमम् ॥१७२॥

એ પ્રમાણેનું શ્રી ભારભૂતેશ્વર નામનું તીર્થ શ્રી નર્મદાજીના ઉત્તર કિનારા ઉપર રહેલું છે તે સર્વ પ્રકારના

પાપો તેમજ સર્વ પ્રકારના દુઃખોનો નાશ કરે એવું ઉત્તમ છે કે- ॥ ૧૭૨ ॥

॥ उपपापानि नश्यंति । स्नान मात्रेण भारत ॥

હે ભારત જે તીર્થમાં સ્નાન કરવા માત્રથી સાધારણ પાપોનો નાશ થાય છે. માટે

॥ कार्तिकस्य चतुर्दश्यां । उपवास परायण ॥
॥ चतुर्धापुरये लिंगं । तस्य पुण्य फलं शृणु ॥१७३॥

દર વરસે કાર્તિક મહીનાની શુકલપક્ષની ચૌદશના દિવસે તીર્થમાં જઇ ઉપવાસ કરી ઉપર કહેલી વિધિ પ્રમાણે ચાર વસ્તુઓથી જે ચાર પહોરમાં મહાદેવના બાંણને પુરણ કરે છે તેને શું ફળ મળે છે તે હું કહું છું તે સાંભળો. ॥ ૧૭૩ ॥

॥ ब्रह्महत्या सुरापानं । स्तेयं गुर्वंगनागमः ॥
॥ महापापानि चत्वारि । चतुर्भिर्यान्ति संक्षयम् ॥१७४॥

બ્રહ્મહત્યા, સુરાપાન, ચોરી અને ગુરૂની સ્ત્રીની સાથે ગમન આ ચાર મહાપાપો કર્યા હોય તો તે પણ ઉપર કહેલી વિધિ પ્રમાણે ચાર પહોરની પુજાથી નાશ પામે છે. ॥૧૭૪॥

॥ सोऽश्वमेधस्य यज्ञस्य । लभते फल मुत्तमम् ॥
॥ कार्तिके शुक्लपक्षेच । चतुर्दश्यां उपोषितः ॥१७५॥

વળી કારતક મહીનાની શુકલપક્ષની ચૌદશને દિવસે શ્રી ભારભૂતેશ્વર તીર્થમાં આવી જે ઉપવાસ કરે છે તેને એક અશ્વમેધ યજ્ઞનું ઉત્તમ ફળ મળે છે. ॥ ૧૭૫ ॥

॥ तत्र स्नात्वाच दत्वाच । वा जपेय फलं लभेत ॥

અને સ્નાન કરવાથી, તેમજ એ તીર્થમાં દાન કરવાથી વાજપેય નામના યજ્ઞનું પુણ્ય ફળ મળે છે.

॥ अष्टम्यां वा चतुर्दश्यां । वैशाखे मासि पूर्वत: ॥
॥ दीपं पिष्ट मयं कृत्वा । पितृन सर्वान् विमोक्षयेत ॥१७६॥

અને વૈશાખ મહીનાના શુકલપક્ષની આઠમ તથા ચોદશના દિવસે જે મનુષ્ય આ તીર્થમાં આવી લોટનો દીવો બનાવી દેવની આગળ મુકે છે તો તેના પિતૃઓનો મોક્ષ થાય છે. વળી. ॥ ૧૭૬ ॥

॥ भारभूत्यां मृतानांच । नराणां भावितात्मनां ॥
॥ अनि वर्तिकागतिस्तेषां । शिवलोकान्न संशय: ॥१७७॥

જે મનુષ્યો એ ભારભુતેશ્વર તિર્થમાં આવી અને મહાદેવની ભકિત કરતાં જો મરી જાય, તો તેમને અક્ષય્ય એવા શિવલોકમાં વાસો થાય છે, અને ફરીથી તેને જન્મ મરણ લેવું પડતું નથી. અને તેનો ॥ ૧૭૭ ॥

॥ अथवा लोक वृत्त्यर्थं । मर्त्यलोकं जिगिषति ॥
॥वेदवेदांग विद्विप्रो । जायते विपुले कुले ॥१७८॥

કદાચ કોઇ કારણસર જન્મ આ લોકમાં થાય છે. ત્યારે મહાન કોઈ ઉત્તમ કુળમાં વેદ તથા શાસ્ત્રને જાણનાર હોય એવા બ્રાહ્મણનો થાય છે. ॥ ૧૭૮ ॥

॥ धन्यधान्य सुखैर्युक्तो । धर्म कर्म विशारद: ॥
॥ सर्व व्याधि विनिर्मुक्तो । जीवेच्च शरदां शतम् ॥१७९॥

અને તે ધન ધાન્ય વિગેરેથી સુખી તથા ધર્મ કર્મમાં કુશળ અને સર્વ વ્યાધિથી રહિત થઈ સો વરસ સુધી જીવે છે. ॥ ૧૭૯ ॥

॥ एत-तुपुण्यं पापहरं । कथितं नृप सत्तम ॥
॥ भारभूते मयाख्यातं । मोहात्म्यं तिथ संभवं ॥१८०॥

એ પ્રમાણે પુણ્યને પ્રાપ્ત કરાવે તથા પાપનો નાશ કરે એવું આ શ્રી ભારભુતેશ્વર તીર્થનું માહાત્મ્ય હે નૃપ સત્તમ યુધિષ્ટિર મેં તને કહ્યું. ॥ ૧૮૦ ॥

कार्तिकी पूर्णिमा श्रेष्टा । चैत्री चैवाथ मुक्तिदा ॥
वर्षे अष्टादशे प्राप्ते । प्राप्ते भाद्रेधि मासतः ॥
भारते यानि तिर्थानि । तानि आयांति अत्रवै ॥१८१॥

માટે દર વર્ષમાં કાર્તિકી તથા ચૈત્રી પૂર્ણિમા તેમજ અઢાર વર્ષે આવતા અધિક ભાદરવા મહિનામાં આપણા ભારત વર્ષનાં દરેક તીર્થો નદીઓ ક્ષેત્રો બધાં અહીં એક મહીના સુધી મહાયાત્રા માટે તે સમયે આ તીર્થમાં આવે છે, જેથી આવનાર મનુષ્યને આ માહાત્મમાં લખેલું સંપૂર્ણ પુણ્ય ફળ અહિં પ્રાપ્ત થાય છે.

॥ इति श्री वायूक्त शिवसंहितायां श्री नर्मदायां
श्री भारभूतेश्वर तिर्थ नाम एकसततिनमोऽध्यायः ॥

॥ श्री स्तु ॥
॥ श्री शिवार्पण मस्तु ॥



॥ श्री गणेशाय नमः ॥

॥ श्री शांब सदाशिवाय नमः ॥

॥ आरति ॥

जय गंगाधर हरहर जय गिरिजाधीश शिव जय गिरिजाधीशा ॥
त्वंमांपालयनित्यं ॥२॥ कृपया जगदीशा ॥

ॐ हरहरहर महादेव. ॥१॥

कैलासे गिरिशिखरे । कल्पद्रुमविपिने शिव कल्पद्रुम विपिने
गुंजति मधुकर कुंजे ॥२॥ पुंजवने गहने ॥

ॐ हरहरहर महादेव ॥२॥

कोकिल कुंजत खेलत हंसावन ललाना शीव हंसावनललीना ॥
रचयति कलांकलापं ॥२॥ नृत्यतिमुदसहिता ॥

ॐ हरहरहर महादेव ॥३॥

तस्मिन ललित सुदेशे शालामणि रचिता ॥ शिव शालामणि०
तन्मध्ये हरनिकटे ॥२॥ गौरि मुदसहिता ॥

ॐ हरहरहर महादेव ॥४॥

क्रीडा रचयति शंभु रंजितमतिमिशं ॥ शिवरंजितमतिमीशं ॥
इंद्रादिक सुरसेवित ॥२॥ प्रणमति ते शीर्षं ॥

ॐ हरहरहर महादेव ॥५॥

विबुध वधूर्बहुनृत्यति ॥ हृदयेमुदसहिता शिव हृदयेमुद० ॥
किन्नर गानं कुरुते ॥०॥ सप्तस्वर सहिता ॥

ॐ हरहरहर महादेव ॥६॥

धिननं धिननं कथयति मृदंग वाजयते ॥ शिव मृदंग वाजयते ॥
कनुकुनु ललितं वेणु ॥२॥ मधुरं नादयते ॥

ॐ हरहरहर महादेव ॥७।

रूणुरूणु चरणे वाजति । नूपुरेपूज्वलिता ॥ शिवनूपुरेपूज्वलिता ॥
चक्रावर्ते भ्रमयनि ॥ २ ॥ कुरूते तां तां तां ॥

ॐ हरहरहर महादेव ॥८॥

तां तां भुपचुप भुपचुप । तालं वाद्यते ॥ शिवतालं वाद्यते ॥
अंगुष्टां गुलिनादं ॥ २ ॥ लास्यगतं कुरूते ॥

ॐ हरहरहर महादेव ॥९॥

॥ मुंडे रचयति माला । पन्नग मुपवितं ॥ शिव पन्नगमुपवितं ॥
वाम विभागे गिरिजा ॥२॥ रूपं शशि ललितं ॥

ॐ हरहरहर महादेव ॥११॥

सकलशरिरे विलसति । कृतभस्माभरणम् ॥ शिवकृतभस्माभरणम् ॥
इति वृषभध्वज रूपं ॥ २ ॥ तापत्रय हरणं ॥

ॐ हरहरहर महादेव ॥११॥

कर्पुरद्युति गौरं । पंचानन सहितं ॥ शिव पंचानन सहितं ॥
त्रिनयन शशिधर मौलि ॥ २ ॥ विषधर कंठयुतं ॥

ॐ हरहरहर महादेव ॥१२॥

सुंदर जटाकलापं । पावकधृत भालं ॥ शिवपावकधृतभालं ॥
डमरू त्रिशुल पीनाकं ॥२॥ करधृम कपालं ॥

ॐ हरहरहर महादेव ॥१३॥

शंखनिनादं कृत्वा । झलरि नादयते ॥ शिव झलरि नादयते ॥
नितरां यजते ब्रह्मा ॥ २ ॥ वेद चतृ सहिते ॥

ॐ हरहरहर महादेव ॥१४॥

अमृत सरोजं । हृदि कमले धृत्वा ॥ शिव हृदि कमले धृत्वा ॥
अवलोकयति महेशं ॥ १ ॥ ईशं बहु नत्वा ॥

ॐ हरहरहर महादेव ॥१५॥

ध्यानं आरति समयो हृदये अति धृत्वा ॥ शिवहृदये अतिधृत्वा ॥
शीर्षा त्रिजटानादं ॥ २ ॥ शंभु बहुनत्वा ॥

ॐ हरहरहर महादेव ॥१६॥

शांबरनाशं प्रतिदिन । पठनं यः कुरूते ॥ शिवपठनं यः कुरूते ॥
शिवसायुज्यं गच्छति ॥ २ ॥ भक्त्याय: शृणुते ॥

ॐ हरहरहर महादेव ॥१७॥

कर्पुरगौरं करूणावतारं संसारसारं भुजगेन्द्रहारं ॥
सदावसंतं हृदयारविन्दे ॥ भवंभवानि सहितं नमामि ॥१॥
मंगलं भगवान शंभु ॥ मंगलं वृषभध्वज ॥
मंगलं पार्वतिनाथ ॥ मंगलाय तनो हरः ॥२॥
सर्व मंगल मांगल्ये ॥ शिवे सर्वार्थ साधिके ॥
शरण्ये त्र्यंबकेगौरि नारायणि नमोऽस्तुते ॥३॥

ॐ श्री भारभूतेश्वराय शांब सदाशिवाय नमः आरार्तिक दीपं समर्पयामि ॥ ॐ नमः पार्वतिपतये ॐ हरहरहर महादेव ॥
॥ पुष्पै देवं अर्पयेत ॥ आत्माभिवंदनं ॥ हस्तोप्रक्षाल्य ॥२४॥

ઉપર પ્રમાણેની મહા આર્તિ શ્રી ભગવાનની ઉત્તરપુજા સમયે કરવી અને તે આર્તિ ભગવાનને પુષ્પથી અર્પણ કરી પોતે લેવી પછી હાથ ધોઈ નાખી અંજલીમાં પુષ્પ લઈ ભગવાનની મંત્રપુષ્પાંજલી ઉભા થઈને નીચે લખેલા મંત્રોથી કરવી.

॥ अथ पुष्पांजली ॥

ॐ यज्ञेन यज्ञमयजन्तदेवास्तानि धर्म्याणिप्रथमान्यासन् ॥
तेहनाकं महिमानः । सचन्तयत्र पूर्वे साध्याः सन्तिदेवाः ॥१॥

ॐ राजाधिराजाय प्रसह्यसाहिने ॥ नमो वैश्रवणायकुर्महे ॥
समेकामान्कामकामाय मह्यं । कामेश्वरो वैश्रवणोदक्षतु ॥
कुबेराय वैश्रवणाय । महाराजायनमः ॥२॥ ॐ स्वस्ति ॥
साम्राज्यं भौज्यं स्वाराज्यं वैराज्यं पारमेष्टयं राज्यं महाराज्य ॥
माधिपत्य मयं समन्तपर्यायी स्यात् सार्वभौमः सार्वायुष ॥
.न्तादापरार्धात् ॥ प्रथिव्ये समुद्रपर्यंताया एकराडिति ॥
तदप्येषश्लोकोऽभिगितो मरूतः परिवेष्टारो मरूत्तस्या ॥
वसन्गृहे । आविक्षितस्य कामप्रे विश्वेदेवाः सभासद इति ॥
ॐ विश्वतश्चक्षुरूत विश्वतोमुखो विश्वतोबाहुरूत विश्वतस्पात् संबाहुभ्यान्धमति सम्पतत्रैद्यावा भूमीजनयन्देव एकः ॥३॥

ॐ भूर्भुवः स्वः श्री भगवते भारभूतेश्वराय नमः मन्त्र पुष्पांजलिं समर्पयामि ॥२५॥

ઉપર પ્રમાણેના મંત્રોથી ભગવાનને મંત્ર પુષ્પાંજલી અર્પણ કરવી પછીથી નીચેનો મંત્ર ભણી પ્રદક્ષિણા કરવી.

॥ अथ प्रदक्षिणा मंत्रः ॥

ॐ सप्तास्यासन्परिधयस्त्रिः सप्तसमिधः कृताः ॥
देवायद्यज्ञन्तन्वानाऽअबध्नन्पुरूषं पशुम् ॥ २४॥
यानिकानिच्च पापानि ॥ जन्मांतर कृतानिच्च ॥
तानिसर्वाणि नश्यंतु ॥ प्रदक्षिणा पदे पदे ॥१॥ २६॥
ॐ भूर्भुवः स्वः श्री भगवते भारभूतेश्वराय नमः
प्रदक्षिणां स० ॥

ઉપર પ્રમાણે લખેલા મંત્રોથી પ્રદક્ષિણા અર્ધી કરવી કારણકે ॥ शिवस्यार्ध प्रदक्षिणा ॥ એ શાસ્ત્રના વચનથી પછી નીચે લખેલા મંત્રોથી સ્તુતિ નમસ્કાર કરવા.

॥ अथ स्तुति मंत्रः ॥

रत्नैः कल्पितमासनं हिमजलैः स्नानंच दिव्यांबरं ॥
नानारत्न विभूषितं मृगमदामोदांकितं चंदनं ॥
जातिचंपक बिल्वपत्र सहितं पुष्पंच धूपं तथा ॥
दीपं देव दयानि पशुपते हृत्कल्पितं गृह्यतां ॥१॥
सौवर्णे मणि रत्नखंड रचिते पात्रे घृतं पायसं ॥
भक्ष्यं पंचविधं पयोदधियुतं रंभाफलं पानसम् ॥
शाका नामयुतं जलं रूचिकरं सुस्निग्ध शाल्योदनं ॥
तांबूलं मनसा मया विरचितं पुजां फलं स्वीकुरू ॥२॥
छत्रं चामरयोर्युगं व्यजनकं चादर्शकं निर्मलम् ॥
वीणाभेरि मृदंग काहलकला गीतंच नृत्यं तथा ॥
साष्टांग प्रणति स्तुतिबहुविधा चैतत्समस्तं मया ॥
संकल्पेन समर्पितिं तप विभो पुजांगृहाण प्रभो ॥३॥
आत्मात्वं गिरिजामतिः सहचरा प्राणाः शरिरं गृहं ॥
पूजाते विषयोप भोगरचना निद्रा समाधि स्थितिः ॥
संचारः पदयोः प्रदक्षिणविधिः स्तोत्राणि सर्वांगिरो ॥
यद्यत्कर्म करोमि तत्तदखिलं शंभो तयाराधनं ॥४॥
करचरण कृतंवा कायजं कर्मजंवा श्रवणनयन जंवा मानसं
वापराधं ॥ विहितमविहितंवा सर्वमेतत्क्षमस्व जयजय
करूणाब्धे श्री महादेव शंभो ॥५॥ असित गिरिसमंस्यात् ॥
कज्जलं सिंधुपात्रे सुरतरूवरशाखा लेखिनी पत्रमूर्वि ॥
लिखति यदिग्रहित्वा शारदा सर्वकालं तदपितवगुणानामिश
पारं नयाति ॥६॥ त्वमेव माताच पिता त्वमेव । त्वमेव
बंधुश्चसखा त्वमेव ॥ त्वमेव विद्या द्रविणं त्वमेव । त्वमेव
सर्वं मम देवदेव ॥७॥

॥ प्रार्थना मंत्रः ॥

आवाहनं नजानामि । नजानामि तवार्चनम् ॥
पुजांचैवनजानामि । क्षमस्व परमेश्वर ॥१॥
मंत्रहिनो क्रियाहिनो । भक्तिहिनो सुरेश्वर ॥
यत्पूजितो मयादेव । परिपूर्णं तदस्तुमे ॥२॥
यदक्षर पदभ्रष्ट । मात्राहिनं तुयद्भवेत् ॥
तत्सर्वं क्षम्यतां देव । प्रसीद परमेश्वर ॥३॥
अन्यथा शरणं नास्ति । त्वमेव शरणं मम ॥
तस्मात् कारूण्य भावेन । रक्षस्व परमेश्वर ॥४॥
मत्समो पातकी नास्ति । पापहा त्वत्समो नहि ॥
एवं ज्ञात्वा महादेव । यथायोग्यं तथाकुरू ॥५॥ २८॥
ॐ श्री भूर्भुवः स्वः भगवते भारभूतेश्वराय नमः
स्तुति पाठपूर्वक नमस्कारान् समर्पयामि ॥

આ પ્રમાણે ભગવાનની પુજા કરી સ્તુતિ પાઠપૂર્વક નમસ્કાર કરવા પછીથી નીચે લખેલા પંચાક્ષરી મંત્ર ૧૦૮ વાર જપ કરી નીચે લખેલા વિધિ પ્રમાણે આચમનીમાં પાણી લઇ પુજા નિવેદન ભગવાનને અર્પણ કરવી.

॥ जप मंत्रः ॥

ॐ नमःशिवाय ॥ अष्टोत्तर शतं जपेत् ॥ मया अद्यान्हि यथाशक्ति मिलितोपचार द्रव्यैः अभिषेक पूर्वक पूर्वोत्तरांग पूजनाख्येन कर्मणा भगवान श्री भारभूतेश्वर भवानि शंकरौ प्रियेताम् नमम ॥ तत्सर्वं इश्वरार्पणमस्तु ॥ ब्रह्मार्पणमस्तु ॥ नमः पार्वतिपतये० ॥

પછીથી બ્રાહ્મણની પુજા કરવી અને તેમને દક્ષિણાદાન વીગેરે આપોને નીચેના મંત્રોથી આશીર્વાદ લેવો અને પોતાના ઈષ્ટમિત્રો તથા બ્રાહ્મણો સાથે ભોજન કરવું અને તે રાત્રિ શ્રી ભારભૂતેશ્વર તિર્થમાં ભજન કિર્તનથી વ્યતિત કરવી.

॥ ब्राह्मण पूजन मंत्रः ॥

ॐ चरणं पवित्रं विततं पुराणं चरणपुतस्तरति दुष्कृतानि ॥
तेन पवित्रेण शुध्धेन पुनाती पाप्मानमराति तरिमा ॥१॥
ब्रह्मणेगंधाः पांतु सुमंगलं चास्तु । अक्षताःपांतु आयुष्यमस्तु ॥
पुष्पाणिपांतु सुश्रेयमस्तु । दक्षिणाःपांतु बहुधनमस्तु ॥

॥ आशिर्वाद मंत्रः ॥

ॐ स्वस्तिन इन्द्रोवृद्धश्रवाः स्वस्तिनः पूषा विश्ववेदाः ॥
स्वस्तिनस्ताक्ष्योंअरिष्टनेमिः स्वस्तिनो ब्रहस्पतिर्दधातु ॥१॥
॥ ३० ॥

यशस्करं बलवन्तं प्रभुत्वं त्यमेवधिराजधिपतिर्बभूव ॥
संकीर्णनागास्वपतिर्नराणां सुमंगल्यं सततं दीर्घमायुः ॥१॥

यावद् भूमंडलंधत्ते । सशैल वनकाननम् ॥
तावत्तिष्ठतु मेदिन्यां संततिः पुत्र पौत्रिकी ॥१॥

देहान्ते परमं स्थानं । यत्सुरैरपिदुर्लभम् ॥
प्राप्नोतुपुरुषा नित्यं । महामाया प्रसादत. ॥२॥
लभते परमेरूपं । शिवेन सह मोदते ॥
यावद् भागीरथी गंगा । यावद्देवो महेश्वरः ॥
यावद्वेदाः प्रवर्तंते । त्वावत्वंच सुखीभव ॥३॥

मंत्रार्था सफलाः संतु । पुर्णा संतु मनोरथः ॥
शत्रुणां बुद्धि नाशोऽस्तु । मित्राणा मुदयस्तव ॥४॥

श्री वत्र स्वमायुष्यमारोग्य लोत्र विधात् पत्रमा ं महियते धनं धान्यं पशुपुत्र लाभं शत संवत्सरं भवतु ॥३१॥

ઉપર પ્રમાણેનો આશીર્વાદ બ્રાહ્મણો પાસેથી લઇ ભગવાનને નમસ્કાર કરી નૈવેદ્ય ધરાવવું અને પછીથી પોતે પણ ભોજન કરવું. આ પ્રમાણે શ્રી ભારભૂતેશ્વર તિર્થમાં દર વરસે બે સામાન્ય જાત્રાઓ ભરાય છે. જેમાંની એક કારતક સુદ ૧૫ તથા બીજી ચૈત્ર સુદી ૧૫ અને ત્રીજી મહાયાત્રા અઢાર વરસે અથવા સત્તાવીસ વરસે અધિક ભાદ્રપદ માસમાં એક મહિનાનો મોટો મેળો ભરાય છે, જેમાં લાખો માણસો ભક્તિ શ્રદ્ધાથી અહીં આવી ઉપર પ્રમાણેની પુજા વિધિ તથા સ્નાન અને કથા વાર્તા સાંભળે છે. તો તેને શ્રી ભારભૂતેશ્વરની કથામાં લખેલા પુન્યની પ્રાપ્તિ થાય છે માટે દરેક મનુષ્યે આ જન્મને સાર્થક કરવા માટે તે તીર્થમાં જઇ અને તે પ્રમાણે પ્રભુના નિમિત્તે ભજન પૂજન સ્નાન દાન, જપ, તપ વીગેરેથી લાભ લેવો જોઇએ કારણકે બીજી વખતે આપણને મનુષ્યદેહ મળશે કે કેમ તેની શંકા છે તો હમણાં અનેક જન્મોના પુન્યથી મળેલા મનુષ્યદેહને નિરર્થક જવા દેવો ન જોઇએ. આટલી વિજ્ઞપ્તિ કરી અહીં હવે હું મારી લેખીનીને બંધ કરૂં છું.

॥ सर्वत्र सुखिनः संतु । सर्वे संतु निरामया ॥

॥ सर्वे भद्राणि पश्यंतु । माकश्चि दुःख माप्नुयात् ॥

॥ इतिशम् ॥

॥ इश्वरार्पणमस्तु ॥

॥ ॐ ॥

॥ निर्माल्य ग्रहणम् ॥

॥ तत्र पद्मपुराणे ॥ પદ્મપુરાણમાં લખ્યું છે કે:—

॥ द्रव्यमन्नं फलं तोयं शिवस्वं नस्पृशेत क्वचित ॥
॥लंघयेन्नैव निर्माल्यं । कूपे सर्वं परित्यजेत ॥१॥

હમેશાં શ્રી ભગવાન મહાદેવના મંદીરમાં અર્પણ થયેલું દ્રવ્ય, અનાજ, ફળ, પાણી વીગેરે જે કંઈ હોય. તેને લેવું નહિ, તેમજ અડકવું પણ નહિ, પણ બિલીપત્ર વિગેરે નિર્માલ્ય લઇને આંખે માથે ચઢાવી ભગવાનના નિર્માલ્યના કુવામાં તેને નાખી દેવાં કારણકે શિવનિર્માલ્ય જો લેવામાં આવે છે તો તે લેનારના બધા કુળનો નાશ કરે છે.



॥ ૐ ॥

શ્રી ભગવાન ભારભૂતેશ્વર મહાદેવનો ગરબો.

ધન ધન રેવાજીના તીર કે અતી રળીઆમણા રે લોલ,
ત્યાં છે નાહ્યા સરખાં નીર કે અતી સોહામણા રે લોલ. ૧
આવે ગામે ગામના લોક કે મરદન ત્યાં કરે રે લોલ,
ન્હાતાં દેહનાં દુખડાં જાય કે સુખ આપે ઘણું રે લોલ ૨
વ્યાસજીની ફરી છે આણ કે સુખથી થાપીઆ રે લોલ,
ધન ધન સુરત સરખું શહેર કે સોની ત્યાં વસે રે લોલ ૩
સોનીને નહિ પૈસાતણો પાર કે પણ પુત્ર નહિ મળે રે લોલ,
સોનીએ મનથી કર્યો વિચાર કે સંઘ કઢાવીએ રે લોલ. ૪
કાશી ખંડે વિશ્વનાથ કે પુજવા ત્યાં જઇએ રે લોલ,
પુત્ર જો આપે ગંગા માત કે સુખીઆનકીથઇએરે લોલ. ૫
સોની સંઘ કઢાવી જાય કે નીંદ્રા વશ થયો રે લોલ,
સ્વપ્ને આવ્યા મારા નાથ કે દેવળ બંધાવજો રે લોલ ૬
રેવાખંડે ભારભૂત છે ગામ કે કુવો ત્યાં પડયો રે લોલ,
તે કુવામાં મારો વાસ કે વેગે આવજો રે લોલ. ૭
સોની સ્વપ્નામાંથી જાગ્યો કે હરખઘણોવાધીઓ રે લોલ,
નારી સાંભળ મારી વાત કે આજ સ્વપ્નાતણી રે લોલ. ૮
સ્વપ્ને આવ્યા ભોળાનાથ કે દેવળ બંધાવજો રે લોલ,
નારી કહે છે મહારા કંથ કે જરૂર બંધાવીએ રે લોલ. ૯
સોની ત્યાંથી વેગે ચાલ્યો કે ભરૂચના ચોકમાં રે લોલ,
આવી પુછયાં ઘર કડીઆના કે ભરૂચના લોકને રે લોલ. ૧૦

કડીઆ તું છે મારો વીર કે દેવળ બંધાવવા રે લોલ,
જોઈએ તો પૈસા આપું ઝાઝા કે કામ રૂડાં કરો રે લોલ. ૧૧
સોની કડીઓ આવ્યા વેગે કે રેવાજીનાધારમાં રે લોલ,
રૂડું ત્યાં આવ્યું ભારભૂત ગામ કે દેવળજ્યાંબાંધવા રે લોલ. ૧૨
આગળ કરી ચોક કરાવ્યા કોટ કે વચમાંદેવળરચ્યું રે લોલ,
જ્યારે કૃપા કરી મહારાજ કે શીખર પુરૂં થયું રે લોલ ૧૩
સોનીએ ત્યાં કરાવ્યા હોમ કે વિપ્ર જમાડીઆ રે લોલ,
કુવામાંથી કાઢયા ભોળાનાથ કે દેવળ પધરાવ્યા રે લોલ ૧૪
માંહી પધરાવ્યા ભારેશ્વરનાથ કે ગોર્બી ત્યાંગાજીઆ રે લોલ,
પ્રભુના પ્રતાપનો નહિ પાર કે નગારાં વાગીઆં રે લોલ. ૧૫
ત્યાં છે કુવો નર્મદા તીર કે હજુ નીશાન છે રે લોલ,
આપે નીરધનીઆને દ્રવ્ય કે વંધ્યા પુત્ર જણે રે લોલ. ૧૬
ત્યાં છે સોમનાથ પોતે ગુરૂજી કે શિષ્યો સહુ જાણે રે લોલ;
ત્યાં તો બન્યા બટુકજી શંભુ કે પોતે ભણવાગયા રે લોલ. ૧૭
ત્યાં તો લીલા દેખાડી પોતે કે સૌ નાહવા ગયા રે લોલ,
સૌ ત્યાં બાંધ્યા ભારામાંહી કે નાખ્યા રેવાજ તે રે લોલ. ૧૮
ગુરૂજી કોપ્યા સુણી આ વાત કે બટુકતેં ખોટું કર્યું રે લોલ,
બટુક લાવ્યા ત્યાં વેગેથી ભારો કે ગુરૂ ચરણે ધર્યો રે લોલ. ૧૯
ભારો ત્યાં છોડયો દીનદયાળ કે લીંગરૂપ પ્રગટથયા રે લોલ,
ભારેશ્વર નામ ધર્યાં છે પોતે કે સૌનું કલ્યાણ કરે રે લોલ. ૨૦
સોમનાથ ગુરૂને લાગું પાય કે ચરણમાં રાખજો રે લોલ,
ભારેશ્વર દેવને લાગું પાય કે મુક્તિ આપજો રે લોલ ૨૧
સંવત ૧૯૫૭ ની સાલ કે સોનીનાં કામ કર્યાં રે લોલ,
કહે છે લક્ષ્મણપુરી મહારાજ કે ગુરૂ શંકરપુરી રે લોલ ૨૨

શ્રી ભારેશ્વરની આરતી (સ્તુતિ.)

રાગ આશાવરી તાલ પંજાબી.

પ્રથમ નમુ ભારેશ્વર મહાદેવા.
જે જન મુક્તિ આશા ધરતા કરતા પ્રેમે સેવા. પ્રથમ.
નામ તમારૂં નિશદિન ધ્યાઉં સમરૂં દેવાધીદેવા.
પૃથ્વીમાંથી પ્રગટ્યા પોતે બીરાજે તિરે દેવા. પ્રથમ.
સ્થાપન એની ક્યાંથી તમારૂં નામ ભારેશ્વર દેવા,
પુત્રરત્ન માટે સ્વપ્ન આપ્યું ભાવે દેવળ તીર દેવા. પ્રથમ.
કાન ગણપત આલેખ્યું પ્રીતે જગના શ્રી મહાદેવા,
પુત્ર થાતાં પુત્ર દીધો પ્રેમે કર્યા શ્રી સેવા. પ્રથમ.
તે બ્રાહ્મણ સુતવાળી પુત્ર આશે એ જાતો કાશી,
મંદિર કરી પોતે અવિનાશી નામ આપ્યો તીર દેવા. પ્રથમ.
એ રીતે સ્થાપન તમારૂં નામ ભારેશ્વર આપે ઘણું,
કળીયુગે મોક્ષ દેનારૂ પ્રીતે કરે જન સેવા. પ્રથમ.
જ્યારે જે આદરવા સાથી આવે જ અનુભવો ભારી ભાગે.
ભારેશ્વર તીર્થે બહુ જન આવે કરવા દર્શન સેવા. પ્રથમ.
મિત્રદ્રોહી વિશ્વાસઘાતી તે પાપીની મુક્તિ થાતી,
નિત્યે આવી સ્નાન કરાવી જપતા ભારેશ્વર દેવા. પ્રથમ.
પ્રત્યક્ષ પ્રમાણ તુજ કેટલાં એનો પાર ન આવે કહેતા દેવા,
હું અલ્પમતી કરી આરતી સેવા આનંદે શ્રીમહાદેવા. પ્રથમ.
તેને નામે બીજા દેવ પણ છે તેના મંદિર તમ નામે છે,
મહંત લક્ષ્મણપુરી સેવા કરે છે નિર્મળ ભક્તિ નિત્ય સેવા. પ્રથમ.
દાસ જયકૃષ્ણ કુબેરદાસનો એ સુણ તમ ભજે અવિનાશી,
તમ દર્શને દુઃખ જાવે ભાવે નમું દેવાધીદેવા. પ્રથમ.